

SOUTH-AT-RANK-PUBLIC-USE
9 MAY 1950

INDIAN OPINION

Founded by
MAHATMA GANDHI
IN 1903

No. 18 -Vol. XLVIII

FRIDAY, 5TH MAY, 1950.

Registered at the G.P.O. as a Newspaper.
PRICE: FOUR PENCE

MY COUNTRYMEN

What do you seek My Countrymen?
Do you desire that I should build for
You gorgeous palaces, decorated
With words of empty meaning, or
Temples roofed with dreams? Or
Do you command me to destroy what
The liars and tyrants have built?
Shall I uproot with my fingers
What the hypocrites and the wicked
Have implanted? Speak your insane
Wish!

What is it you would have me do,
Shall I purr like
The kitten to satisfy you, or roar
Like the lion to please myself? I
Have sung for you, but you did not
Dance; I have wept before you, but
You did not cry. Shall I sing and
Weep at the same time?
Your souls are suffering the pangs
Of hunger, and yet the fruit of
Knowledge is more plentiful than
The stones of the valleys
Your hearts are withering from
Thirst, and yet the springs of
Life are streaming about your
Homes—Why do you not drink?
The sea has its fullness and
Crescents, and the Ages have
Their winter and summer, and all
Things vary like the shadow of
An unborn God moving between
Earth and sun, but Truth cannot
Be changed, nor will it pass away;
Why then do you endeavour to
Disfigure its countenance?

—KAHLIL GIBRAN.

(Secrets of the Heart)

JAYBEE SILK HOUSE

(FORMERLY THE JAPAN BAZAAR)
JOHANNESBURG'S FAMOUS SAREE HOUSE



45" Wide COLOURED
GEORGETTE.
Superior Quality.
In following shades:

Pink, Salmon, Saxe, Royal,
White, Emerald, Red, Purple
Wine, Maroon, Black, Orange,
Lemon, Petunia. Yd. 7/11.
Ideal for Sarees.

45" SUEDE SILK, White,
Pink, Sky. Per yd. 7/11.

JUST ARRIVED!

45" wide TINSEL
GEORGETTE.
All Shades. Per yd. 15/-
SAMPLES ON REQUEST.

FOR BLOUSES
SWISS EMBROIDERED
GEORGETTE, 36"
per yd. 12/6.

MEN'S
PURE
SILK
SHIRTS.

Cream.
Collar
Attached.
All Sizes.
27/3
each.

VELVET.

44" Chenille Georgette
in all latest Shades
Suitable
For
Sarees.
Per yd.
22/6

EMBROIDERED GEOR-
GETTE SAREES. In all lead-
ing shades. Now reduced to
£4/10/0. each.

EMBROIDERED SUEDE
SILK SAREES. Attractive
Embroidery. Special price
£4/4/0. each.

GEORGETTE JARI WORK
SAREES, with attractive wide
borders in all shades.
Reduced to £6/10/0. each.

GEORGETTE HEAVY JARI
WORK SAREES, with Jari
work borders in all shades.
£12/12/0. each.

FANCY TINSEL
SAREE BORDERS
In Latest Designs
& Colourings
8 yds. to a piece
From 25/- To 50/-
per piece.

SAREES

★
Printed Voile Sarees.
In Latest Designs. Pink,
White & Blue Ground.
5 yds. lengths. 25/- each
6 yds. lengths. 30/- each

Phone 33-6229.

39a: MARKET STREET,


JOHANNESBURG.

P. O. Box 5169

ELGIN

21 Jewel Lord Elgin and 17 Jewel
Elgin De Luxe in Solid Gold and
Gold Filled Cases.

Latest models 15 Jewel Elgins
in Gold Filled Cases.



WITH THE
NEW MIRACLE
DURA-POWER MAINSPRING.

ADVANCE 1950 MODELS

KATZ & LOURIE LTD.

COR. KLOFF & MARKET STS., JOHANNESBURG

બેઠમે છે
હાડકા

તમારાં સ્ત્રેશન કે સાધડાંજી
પહેંચતા કરવા માટે
અમે ટનના
પા. ૭ આપીશું

માલી બેંગો રેલ કીરાયું ભરી પાળી મોકલી આપીશું
વધુ વિગતો માટે લખો :

THE
BULLBRAND
FERTILIZERS LTD.
SARNIA NATAL.

Kasturba Gandhi Memorial Number

Copies of Kasturba Gandhi Memorial Number can be had
at this office at 1s. 3d. including postage.

'Indian Opinion',
Phoenix, Natal.

Are You a subscriber of
'Indian Opinion'
If not, Why not?

PHONE 33-2651
MASTER BROS.
 Manufacturers of Ladies and Girls
 Straw and Felt Hats
 Wholesale Merchants and Direct Importers.
**House For Keen
 Cash Prices.**
 33 West Street, JOHANNESBURG.

मास्टर ब्रदर्स
 होलसेल मरचन्ट्स अन्ड डायरेक्ट इम्पोर्टर्स.
 रेडी मेमन् सुतरीज क्राफ्ट, बुलन्ट रस्स, प्लानेटेस—जेभी आण्डो
 माटे नन्त नन्तनो माल-मेमन् केपीडीसी ल्योरन्टे सडीके।
 गीरे माटे इमारे लां प्रथम तपास
 इरवा भवाम्बु छे.
 33 वेस्ट स्ट्रीट,
 जोहानिसबर्ग
 फोन
 33-2651

Cable & Tel. Add.: "HARGVAN". Phone 21429.

P. HARGOVAN & CO.
 (PTY.) LTD.
 WHOLESALE MERCHANTS
AND IMPORTERS.
 P. O. BOX 1250.
 15 & 17, Cross Street,
DURBAN.

M. J. PATEL
 INTERNATIONAL SPORTS COMPANY
 Importers & Exporters & General
 Commission Agents
 10 Peking Road, Kowloon, HONG KONG.
**Special attention is paid
 to indent orders**
Write To Us For Further Particulars.

HANNON'S DETECTIVE AGENCY (PTY.) LTD.
 MANAGING DIRECTOR: O. HANNON, seventeen years Royal Irish
 Constabulary and Criminal Investigation Department, S. A. Police.
 Manager: MINDEN PLUMLEY, ex Hendon Police College and Crimi-
 nal Investigation Department, New Scotland Yard, London.
 Criminal, Commercial and Matrimonial Investigations Carried Out
 in Strictest Confidence.
 11/12 Pastern Chambers, Jeppe Street; P.O. Box 5199, Johannesburg.
 Phones:—Office: 22-7771. After hours: 24-4544.

HEADACHES QUICKLY RELIEVED
 BY TAKING
TYSONO BRAND (PAIN-I-CURE) HEADACHE POWDERS
 FROM YOUR CHEMIST AT 92, 1/6, 2/6 and 4/6; or POST FREE FROM
ERNEST TYSON, CHEMIST, TOLLGATE, DURBAN 1499

THE
NEW INDIA ASSURANCE
 COMPANY LIMITED.

**Life, Fire, Motor Car, Motor Lorry,
 Motor Bus, Plate Glass, Workmen's
 Compensation, Etc. Etc.**

आ हींदी वीमा कंपनीमां छ'इंगीना, आम, मोटर कार मोटर
 दोरी, मोटर बस, प्लेट ग्लासो, कामदारोने लभता वीमाओ,
 सायबद वीगेरे हेक नतना वीमाओ इतराती थकथ छे.
 हींदी कंपनीने उपवन आपवुं अे हेक हींदीनी इरन् छे.

Natal Office:
"NATVAR MANSION"
 74, Victoria Street,
DURBAN.
 Telephone 26845, P. O. Box 1610.
 Tel. Add: "RUSTOMJEE"
 Durban.

Transvaal Office:
ROOMS NO. 12 & 13.
BARKLY ARCADE,
Digonal Street,
JOHANNESBURG
 Telephone 33-4478
 Tel. Add: "RUSTOMJEE"
 JOHANNESBURG.

JALBOY RUSTOMJEE
 Principal Representative For The Union Of South Africa.



B. I. S. N. Co. Ltd.

Announce the re-introduction of direct calls at Karachi.

Passengers must conform with the Vaccination and Yellow Fever inoculation requirements and obtain certificates from their nearest District Surgeon. Inoculation by and certificates from private Medical Practitioners will not be accepted.

FARES : DURBAN TO BOMBAY

First Class	single	without food	£66-0-0
Second "	"	"	45-0-0
Inter-Class	"	"	30-0-0
Unberthed (Deck)	without food		18-15-0

Muslim Special Food £10-17-6 Ordinary Food £4-15-0

Hindu Special Food £10-0-0 Ordinary Food £4-2-0

Bookings for 1st, 2nd, Inter-Class and Unberthed (Deck) can be effected by communication with us by telegram or letters.

For further particulars apply to—

SHAIK HIMED & SONS [PTY] LTD.

390 PINE STREET — — DURBAN.

'INDIAN OPINION'

(Founded By Mahatma Gandhi In 1903)

For The Moral, political and Social Advancement Of Indians In South Africa.

Published Every Friday.

Subscription Rates

Payable Always In Advance.

Within the Union	26s.	Annually
" " "	13s. 6d.	Half-yearly
Outside the Union	30s.	Annually
" " "	15s.	Half-yearly

Become a Subscriber and persuade your friends to do likewise.

Apply to—

Manager,
Indian Opinion,
Phoenix, Natal.

DUFF'S ROAD TOWNSHIP.

Good road, ½ acre Lots are selling fast in this lovely area within easy rail transport of Durban, 70 miles from City Hall. Buy now and save.

ALSO FOR SALE:

The homestead, containing 8 rooms, 2 bathrooms (one white tiled) small office, hot water system, wide verandahs. With kitchen block of 3 rooms suitable for conversion to 6 rooms, and detached rooms. £3,500. Also offered, separately or together, cottage and various outbuildings.

ALL ON EASY TERMS

Voysey, Boshoff

&

Co. (Pty.) Ltd.

291, Smith Street,

Phone 28954

Tear off here and post to

VOYSEY, BOSHOFF & CO. (PTY.) LTD.

291, Smith Street, Durban.

I am interested in the Duffs Road sites and would like to have a plan of the Township. (Please print)

NAME.....

ADDRESS.....

धी न्यु दिख-भुथ स्वीट मार्ट

वेनेवर: मस्तीसार्थ बाबुबाबु मस्तीसार्थवावा.

दरेक जातनी मीठाफळी, बोकामा घीनी तेमल बोकामा देवा, मसालाधी अमे अनारीमे कोमे.

अमाड' वज्जामेकु' सुरती सुसु' देव, ममरा, मीठिमा, मज्जामा, पातारा विगेरे इरशेल ताल' अनारीमे कोमे.

पाटीं वीमेरे मार्टे मोटा प्रभाळुमां मीठाफळी मोटा व प्रभाळु कुंठे वज्जतमां अनारी आरीकु'

PHONE 33-6575.

P. O. BOX 3680.

THE NEW DIL-KHUSH SWEET MART,

34 President Street Corner Diagonal St., Johannesburg

इरनीयर! इरनीयर! इरनीयर!!!

वेदभूम सुट, दाडनींगभूम सुट, वेगदशेप, इरनीयर वेदभूम सुट वेदा मोफरीस देरके, सुके वेस, टोपल, तडन कोफायत कावे अनारीमे शकेरी. लते पधारी लाव देवा सुकेरी नाके.

—वेदभूम, टोपल अने कीवन इरनीयर—

वे इमारी इरनीयर नीये तर्हवार बाप ठे. तेने रतीं इमेर-तर्हवार रडे ठे. मान रेकडा बावोना प्रार्थन वीरठ मंत्रोवा अने वेपार आयज वधारी.

L. MISTRY

51 BREE STREET, BURGERSDORP, J'BURG

PHONE 33-4691.

BOX 2626. 10

INDIAN OPINION

Founded by
MAHATMA GANDHI
IN 1903

No. 18—VOL.—XLVIII.

FRIDAY, 5TH MAY, 1950

Registered at the G.P.O. as a Newspaper.
Price: FOUR PENCE

Indian Opinion

FRIDAY, 5TH MAY, 1950

Our Birthright Or A Mess Of Pottage?

WHEN Shakespeare — whoever he was—wrote "There is a tide in the affairs of Men (or Man)" he shewed that he was possessed of deeper wisdom and insight than many of our twentieth century self-satisfied, materialistic-minded scientists.

More and more, it is being brought home to earnest seekers of Truth, even though their search compels the abandonment of ideas hitherto regarded as unassailable, that the new is but a refining of the old; that there really is nothing new under "the Sun."

More and more it is being brought home to the thoughtful that mankind's evolutionary progress from the transition stage that is presently his towards the full adulthood that is to be his, is contingent upon his abandonment of the "each for himself" jungle ideology that has so generally prevailed hitherto, and the recognition in practice, of the unity that binds every member of the human family to every other member.

The futility of wars with lethal weapons must surely by now have been sufficiently demonstrated. Attempted conversion and reformation by such means is obviously about as intelligent as burning down one's house for [the purpose of getting rid of the bugs.

There is, however, a war that is righteous war and that has to be fought for the assurance of mankind's progress and perhaps even of his survival, but it is war on a different plane to that of brute force. It is the age-old struggle, the warring of the forces of light against the forces of darkness.

And, the part we humans are called upon to play in that struggle is the battling with and conquest of ignorance and selfishness.

Whether the doctrine of "The Fatherhood of God and the Brotherhood of Mankind" impresses or does not impress us, it

is becoming increasingly difficult to avoid the conclusion that there is basic Unity behind Nature's Diversity, a conclusion towards which progressive scientific thought is rapidly advancing.

And, this truth applies equally to the human as to every other of Nature's Kingdoms. For, rightly regarded Mankind is an organism. We are all "members of each other."

Instead, however, of recognising the fact of our interdependence as integral parts of the greater whole, our ignorance and selfishness have led to a state of almost continuous war between the members. Our selfishness impels us to cling to the delusion that, in order to survive, we must live on and at the expense of each other, instead of for each other. Our ignorance blinds us to the fact that the universe is ruled by Law and that there is plan and purpose behind evolution including mankind's.

Obviously, until that ignorance is dispelled, and, at least some understanding of that plan and purpose is arrived at we are liable to continue floundering hopelessly in the morass of our ignorance and reaping the inevitable miseries consequent upon our mistakes.

There is nothing secret or mysterious about the better way the sages have summarised in the two words "Right Life." By precept and example they have emphasised the spiritual unity that mankind must recognise and mould its conduct by in order that man maintain his place in the greater evolutionary march.

Expressed in terms of ethics, the teaching is simply that "we must love one another;" that "we should love our neighbour as ourselves;" that "we should do unto others as we would be done by;" that "the strength of the strong should be employed for the helping of the weak. Not ex-

ploitation, but service; arriving at the true answer to "Am I my brother's keeper?"

Now, the Wise Ones who are versed in these matters teach us that in the great evolutionary sweep, in the progressive development from lesser to greater, from fractionhood towards wholeness, there are critical stages reached at which such further progress requires the discarding of the outworn forms that can no longer adequately serve the needs of the growing life within, in favour of higher forms more capable of giving it expression.

This sounds very abstruse and technical, but is really quite simple. All forms, in every one of Nature's Kingdoms, are but expressions of Life, of fractions of the same one divine Life, evolving towards complete self-realisation. The mineral, vegetable and animal are but stages towards the human; the human but a stage towards self-conscious divinity.

The way of growth of real progress, for the human being, for Man, is the transcending of the narrow-little personality—self of him and identifying his selfhood with the All-Self, i.e. by Self-realisation. He has then, as The Buddha put it "wrought the purpose through, of what did make him Man," or as the Christian dispensation has it, "has Become one with the Father."

Basically, Life is One; the Many-ness, in all its diversity, but refractions of that One. Separateness has been called the great illusion; also, the great heresy. Man's evolutionary progress is slow. Selfishness and Egotism grip him hard and hold him in tight bondage. He is reluctant to abandon "the self of matter"—the narrow little personality—I of material desires and ambitions—for the Self of Spirit, which is what he must do if he is to maintain his place, and advance in step with the greater evolutionary sweep in which his own progress is but part. (Man occupies an important rung on the evolutionary ladder, but only a rung; not the whole ladder.)

Evolutionary growth is synony-

mous with an expansion of the consciousness of the evolving life centre. Man has reached the stage at which his further progress is synonymous with his recognition of the Unity amid Diversity, the One-ness as the Reality of the Many-ness. He has to transcend the illusion of separateness; to recognise that none can live for themselves alone. That these truths, and much that they signify, are influencing the minds of mankind's most advanced thinkers is evidenced by the world-wide movements towards Unity presently taking place.

While the members that in the aggregate constitute humanity are, quite naturally, at different stages of evolutionary growth, they, nevertheless, are all members of the human family. What they share in common and what unites them, is of incomparably greater importance than the accidental differences that distinguish them. Ill-health in any one of the members inevitably affects the health of every other, i.e. of the whole organism. This has been, and it still is being, clearly demonstrated. It is the well-being of the body-corporate, as a whole, that is aching to be restored.

The view that the only nations that really matter are those privileged to call themselves "white" is no longer tenable. The East has almost completely freed itself from the imperialist domination under which, for so long, it was the Tom Tiddlers Ground of Western exploitation. The Negroid peoples of Africa are becoming more and more insistent upon a recognition of their right to a place under the Sun. We are experiencing a world-wide surge from separateness towards unity, in which India is playing a leading part.

Gandhiji proved the superiority of Soul-Force over Brute Force, and justified the teaching of the Christian Master about returning good for evil. Beginning at home, India plans to set the nations of the world an example in brotherly relationships and brotherly intercourse based on the principle of

Service. We, her children here in South Africa, have been afforded the privilege of sharing that noble work. Our part is to resist by every pacific means the forces that make for separateness and to count no cost too great to advance the cause of unity. We are qualified to do this, and fortune has favoured us with the material means, perhaps, so that they might be devoted to this very purpose.

The problem before us may be approached in two ways, and we may attack it from either or both remembering always that the greater includes the less. The first is that of human values. Are we agreeable to accept the position that the stature and worth of a Man are to be determined by the colour of his skin or the accident of his birth place? Is status to depend upon a question of pigmentation and geography or upon his value as a human being, a soul? This as we believe we understand it, is the essential and basic principle underlying the policy and programme of India's statesmen. It involves sacrifice, and if we, in South Africa, are big enough to rise to the occasion, we can do much to promote its realisation. In so doing, we shall incidentally be resisting what we have so persistently protested against, the affront to our self-respect; we shall be stressing the right to consultation in all matters affecting us.

The other is what Gandhiji was wont to refer to as "Loaves and Fishes." Put plainly and simply that resolves itself into the one question. Are we prepared to barter our birthright for a mess of pottage, however meagre and in whatever manner it may be dished out to us?

We will now have to decide quickly. What is to be the answer?

May Day And Its Lesson

MAY DAY has come and has gone. It has left a lesson that can profitably be learned by all. We had expressed the opinion that it was not an opportune time for us yet to talk of, much less talk of, a non-European united front on all the laws affecting the non-Europeans generally in South Africa, because they were all not sufficiently united and


organised for a task which was far beyond the capacity of the leaders to tackle. We had said that the Africans and the Indians should organise themselves as separate units and fight their own cause separately, and the Indians, who were, or at least they ought to be, better experienced in the technique of non-violence should set an example for others to follow. The Transvaal Indian Congress leaders, however, thought otherwise and they called upon the non-Europeans to close their businesses and cease work, and to hold demonstrations and mass meetings on May Day. The whole issue was so confused that one did not know what actually one was fighting for. Was it for the Natives' Pass Laws or was it for the freedom of speech and the freedom of movement or was it for the Group Areas Bill? The Transvaal Indian Congress leaders were busy the whole week preparing on a grand scale posters and placards informing the people what they were to do on May Day. But all of a sudden to their surprise they found a Government order issued, banning all public meetings and demonstrations of any kind during the week-end and Monday, and in conformity with those orders circulars were issued on Saturday night by the Congress officials cancelling all meetings and demonstrations which were arranged to be held on Sunday and Monday. Businesses were however closed generally in almost all the Indian quarters and the Africans had struck work. Over forty per cent. of the Africans, it was stated, had not turned up to work on Monday. The Johannesburg city gave an appearance of a holiday on that day. The housewives must have had to suffer a great deal of inconvenience without their "toys." But what, after all, did the Indians close their businesses for? Did they close them as a protest against the Group Areas Bill? From the investigation, we were able to make personally we were satisfied that most of them had closed out of fear of being attacked and damage done to their person and property. The Congress leaders abandoned their elaborate programme of mass meetings and demonstrations, also out of the same fear, be-

cause they were threatened by the authorities with severe action if they acted in contravention of their orders. The Congress leaders had at least acted wisely in the interest of public safety and they are to be congratulated for it.

But the very fact that they had to retract showed that they had acted unwisely from the beginning. For why did they not forestall the Government orders? Did they think the Government would sit quiet and not take any counter steps to crush their movement? Had they not had sufficient experience in the past? The rule of non-violent action is not to go into action unless you are fully prepared to face all the consequences, and once having resolved to act there can be no going back. By the present action they have only shown the Government their weakness and have given them an opportunity to crush us by sheer brute force to which we are prone to submit. The Government, through their police force, have been able to successfully achieve their end. The police are apparently given a free hand while dealing with non-Europeans. The police are not supposed to lay their hands on anyone unless one is unruly. But when they start speaking with a non white person they hardly do so with their mouth; they speak with their hands and their feet. That was not so in the past; but it is invariably the

case at present and it is increasing under the present Government. On Monday, at the Transvaal Indian Congress office the police, without any rhyme or reason, caught hold of a responsible official of the Congress by the neck and put him in the police van and after a while he was set free. Such provocative acts on the part of the police were partly responsible for much of the trouble that took place on May Day when several deaths and casualties took place.

So the first lesson we have to learn is fearlessness. Unless we are able to shed all fear we shall never be able to succeed in our struggle. The second thing we must do is to vow not to touch any intoxicating drink. This applies to the Africans much more. Unless they scrupulously avoid that they will never be able to remain non-violent and if they do not remain non-violent under the extremest provocation they will run the risk of being brutally massacred by the much superior force of the Government. The Africans are not conscious of their potential power. A taste of it was had on May Day when they struck work. But unless we have all developed that soul force and the strength and courage to renounce everything including our lives, to save our soul, we are doomed, for "What doth it profit a man who gains the whole world but loseth his own soul?"



Mr. Godwin Mbikusita Lewanika, General President of the Northern Rhodesia African Congress, now on a world study tour and passing through India, exchanged greetings in Bombay on April 8 with the Hon'ble Mr. R. R. Divakar, Minister of State for Information and Broadcasting, Government of India.

SENATOR BROOKES ON GROUP AREAS BILL

DR. EDGAR BROOKES, who represents the Natives of Natal in the Senate and is sympathetic to but independent of the Opposition parties, foresees that the Group Areas and Anti-Communist Bills will put the Parliamentary Opposition and its supporters in many parts of the country severely to the test.

Asked his views Dr. Brookes said: "The attitude of Natal, for instance, towards the Group Areas Bill will undoubtedly be mixed.

"By those who regard the existing Indian legislation as desirable and fair, the Group Areas Bill may even be welcomed in that it makes the possibility of restriction on Indian purchase and occupation of property permanent and probably, while the present Government are in power, more effective than it is now. On the other hand there are those—and there are many, who have serious misgivings about the fairness and wisdom of the present legislation against Asiatics. For them the Group Areas Bill can have no redeeming feature.

"But the most practical difficulty raised by the Bill is that of the Coloured people in the Cape. The Coloured community as a whole civilised, indubitably South African, speaking only the official languages, closely associated with politics and having possessed the franchise for nearly 100 years; a group to which the United Party has many commitments and which, if the United Party fails it at this time, has no other political home to look to but Communism."

Dr. Brookes points out that so far as the Cape Peninsula and adjoining districts are concerned the Group Areas Bill is seeking to divide the indivisible both in the residential and also in the human sense.

"It would provoke great human suffering, not to mention shattering losses among property owners, if an attempt were made to divide these areas and separate these intertwined populations artificially.

If the United Party, to placate Natal were to sacrifice its Coloured supporters—and its very large White liberal support in the Cape, it would sign its own death warrant, and its last act before execution would have been of a degrading nature.

"How is it possible to get a fair division of land or even a division faintly approximating to fair, when it is a division between races; when the dividers belong to one race and when they are subject to political pressure from one race only? If the non-Europeans get anything at all they will get what is left over and unwanted. If it were not so the

political ferment created among the European voters would go far to upset any Government which turned Europeans out of a desirable area to make room for another group.

"More than that, those who support the Bill in principle should beware that the powers which will be given to the Minister of the Interior for use in the first instance against non-European groups will be available for use against European group as well. Dr. Brookes said that although the terms of the anti-Communist Bill were not yet known, it was

probable that it likewise would be a mixture of precautions which might ultimately be used against the Parliamentary Opposition itself.

"Both Bills will provide a severe test of the Opposition's loyalty to democratic principles and to those ideals for which the Parliamentary Opposition stands. Where the Group Areas Bill is concerned the Opposition will have to try to draw a sharp distinction between political expediency and democratic fair play. Where the anti-Communist Bill is concerned the Opposition will have clearly to discern what is anti-Communism and what is anti-cominonsense."

DANGERS OF UNION'S AFRICAN POLICY

PROF. MACMILLAN'S PICTURE OF 'MUDDLE-HEADED ADMINISTRATION'

SPEAKING on "African Revisited" before a joint meeting of the Royal African and Royal Empire Societies, over which the Earl of Clarendon, one-time Governor-General of the Union, presided, Professor W.M. Macmillan, formerly Professor of History at the University of the Witwatersrand, and now director of colonial studies at the University of St. Andrews declared that the picture he would draw of the position of Africans in South Africa to-day was "one of muddle-headed administration, not the conventional one of deliberate repression."

He said the policy of apartheid made an unerring appeal to the wishful thinking of the Platterland of proposing to put back the clock, but only a handful of idealists meant the literal separation of the races.

The vast majority conceived apartheid as a return to the days when farmers and others could count on the services of as many Africans as they happened to think they needed, and forget about all the rest.

In half a generation the Africans who disturbed the country's dreams might come to be not the millions who used to be effectively segregated out of sight, but millions overflowing in the European towns and dorps of South Africa.

The administrative machinery that grew up in simpler times rumbled along unadapted and almost unchanged, yet there was little but the speed of change to excuse the country's being caught so unawares, and perhaps the distraction of war time.

Being certainly wanted in the towns to share in the industries that for years had been hoped and prayed for, the Natives were

entitled to ask for what Kenya had begun to see as reasonable—homes for their families and some measure of social security. At the very least, and as a preliminary, there might have been labour exchanges to guide the flow of workers where it was most wanted or could be assimilated.

Arrived there, they needed housing, (admittedly a most difficult problem), the protection of reasonable labour legislation and machinery for enforcing their minimum rights.

Kenya, forearmed, was through its labour departments trying to keep step in these things with the growth of industrial employment; indeed, Kenya now recognised it was in the position of needing to increase, not to check, the flow of labour.

"It is the brighter side of the South African picture," said Professor Macmillan, "that the law courts can be trusted to do justice to any case that reaches them, but the typical South African reaction is that 'drift' to the towns is unfortunate—a menace to be controlled, not aided and eased. The result has been an intensification rather than a reform of the pass laws.

"As administrative rule stands at the moment labour must be strictly rationed in the sense that townships must be periodically combed, which means raided for those classified as 'reboundant' or superfluous.' What can you make of an office solemnly labelled controller of urban influx.' And the irony of it all was brought home to me very early on my tour when I found that in spite of all passes and the registrations, two departments differed by as much as 50,000 in their estimate of the number of Africans employed in

Johannesburg municipal area."

The picture he would draw was one of muddle-headed administration, not the conventional one of deliberate repression. Many South Africans had been too engrossed in their own novel prosperity or perhaps in getting on with the war to see, clearly what had been happening.

It was quite untrue to suggest that the Africans as a whole were worse off than ever. Earnings were better, old age pensions were something new, there was still some Native school feeding, even social insurance had actually been tried but broke down, as might have been expected in the chaotic state of urban labour.

For more individual Africans than he was used to see, were well set up and economically independent. He met clear evidence also that the influx of Africans into Cape Town and elsewhere in the Cape, though it originally threatened to undercut the Coloured people, had in the end pushed them up in the economic scale. There was, moreover, a good deal of very excellent African housing—only not nearly enough of it—and the old Cape still led Africa in the field of African education.

Such a government might avoid being driven by ideology into doing some of the foolish things now in official favour. But the precedent was not a very hopeful one for the African people. It was the fusion ministry of 1936 that cast adrift from that sheet anchor, the Cape franchise.

These last years might well have done, as General Smuts had said, "irretrievable damage" to the spirit of the Native and Coloured people. If this was so, Afrikaner and British must both take their share of the blame.

The present trend of policy was essentially South African and would not be reversed until the people of all races took fresh stock of the just resentment of a growingly enlightened subject people.

"South Africans will continue to frame their policies in ignorance or in defiance of African opinion at their own peril, and perhaps that of the rest of us. The lawlessness of, say, Newclare, or even the more hopeful Moroka, gives fair warning."

The Henry Miller Memorial Fund

The Principal, Sastri College, acknowledges with thanks the receipt of the following donations to the Henry Miller Memorial Fund: Already acknowledged £94 5s 6d., Colleague 10s., Dr. Mabel Palmer 10s., Total £95 5s. 6d.,

GANDHI AND MARX

By K. G. Mashruwala In 'Harijan'

VI

WE are often told that you cannot go back upon the progress which man has made in the realms of general knowledge, science, industry, art, technology, etc., and return to a past age. The advice is partly good, partly out of place, and to the extent it is good, it applies to non-material and intangible progress also.

By its very nature, the world is so made that you cannot return to the same place again. Seasons appear to return year after year; the sun, the moon and the planets seem associated with the same stars again and again. We do speak of their revolutionary cycles and even exactly declare where a particular heavenly body would apparently be at a particular moment. But the path of progress is of the nature of an extremely complicated, endless spiral, wherein though the face turns in same direction again and again, neither the looker nor the object looked at is ever in the same place. Therefore the apprehension that you might return to the "primitive or Middle Ages" of the past is as groundless as the desire to return to the "golden age" of the past is futile. A higher civilisation, i.e. a particular society of human beings, might decay and degenerate, and be overrun and destroyed by one, which is still low, but mankind will never return to its own past.

Secondly, if one cannot consent to go back in the realm of material sciences, can one do so in the sphere of spiritual and moral development of the human race? Can we disregard the progress made by man, age after age, in the spiritual, moral, intellectual and mental spheres, which made it possible for humanity to produce men like Socrates, Buddha, Confucius, Jesus, Gandhi and others who stand like lighthouses to others for centuries, and who in their own selves show a point higher than the one preceding?

Winwood Reade, an atheist in the ordinary sense, but a great humanitarian, says in his book 'The Martyrdom of Man':

"The desire to do good which arose in necessity, which was developed by the hopes of a heavenly reward, is now an instinct of the human race.... There will always be enthusiasts for virtue as there are now, men who adorn and purify their souls before the mirror of their conscience, and who strive to attain an ideal excellence in their actions and their thoughts."

Identifying himself with this class, he thus expounds the form of his "Virtue-religion" and the discipline for attaining it:

"To develop to the utmost our genius and our love, that is the only true religion. To do that which deserves to be written, to write that which deserves to be read, to tend the sick, to comfort the sorrowful, to animate the weary, to keep the temple of the body pure, to cherish the divinity within us, to be faithful to the intellect, to educate those powers which have been entrusted to our charge and to employ them in the service of humanity, that is all that we can do. Our religion therefore is Virtue, our Hope is placed in the happiness of our posterity; our Faith in the Perfectibility of Man. Love, not Fear, will unite the human race.... With one faith, with one desire, they will labour together in the Sacred Cause—the extinction of disease, the extinction of sin, the perfection of genius, the perfection of love, the invention of immortality, the exploration of the infinite, the conquest of creation.

"All men cannot be poets, inventors, or philanthropists; but all men can join in the gigantic and Godlike work of the progress of creation. Whoever improves his own nature, improves the universe of which he is a part. He who strives to subdue his evil passions, vile remnants of the old four-footed life and who cultivates the social affections; he who endeavours to better his conditions and to make his children wiser and happier than himself; whatever may be his motives, he will not have lived in vain.... But this condition is not to be easily attained.... Virtue in its purest and most exalted form can only be acquired by means of severe and long continued culture of the mind."

Man has often appeared to have gone forward and backward in the course of his evolution. He has also often erred, and has had to count over and over again. He has often tried to undo what had been done once deliberately and to restore the *status quo* as nearly as possible. For instance, in the realm of political institutions he has not settled down to any one form as yet. Absolute monarchy (dictatorship), limited or constitutional monarchy, oligarchy, democracy, republican State, unitary government; federal government are forms which have

been tried in a variety of shades again and again, and may be tried in the future. The historian does not look into the apparent forms of these governments and the temporary advances and set-backs in them, but examines the state of political thought behind every such experiment, and the extent of humanity influenced by it. It is on this that he assesses the civilisation of that period.

Marx examined the political institutions of the world from the point of view of their effect on the economic status and freedom of man, and came to the conclusion that with the passage of time political power will progressively pass into the hands of the industrial workers. They will be the most privileged class of people in the State. Hence, he concludes, it is the duty of discerning men to help that transformation.

This might be true. But this does not mean that it is the whole truth, and even if it be so, it may be brought about by any means whatsoever. The spiritual and moral progress made by man during all these centuries must also be borne in mind in achieving the end. And this progress should be properly assessed. If Gandhiji showed the climax of moral perfection of the present age, the next great man of the world will have to show a still higher stage of perfection. If determinism has any value, this may be taken as the next destined goal of humanity, and if it be true, as the Marxist believes, that an individual man is nothing more than a small bee working itself out, even unto death, for the perfection of the beehive and its queen, he must so work that it may be possible for humanity to produce a man greater than Gandhi at the next stage, and within a shorter period than humanity has taken hitherto. It must be remembered that only thousands of individual strugglers for moral perfection could have made it possible for a Gandhi to be born; tens of thousands of similar strugglers are necessary to produce one still greater than him. Hitler might have excelled all the great conquerors and despots of the past. Even super-Hitlers might reappear in the world. But they too are born as a result of thousands of smaller adventurers of the same type. But the development of this feature cannot be the right goal of humanity.

The moral goal is as important and inevitable as the economic and political goal. Rather, if a choice has to be made between the two, the former must be regarded as the more important one. Any attempt to disregard it will fail to bring about the attainment of even the material goal.

It will either be not achieved at all or even if seemingly achieved will bring no peace and prosperity to the people on whose behalf it is attempted. We see with our own eyes how the neglect of the moral emphasis of Gandhiji is responsible for absence of peace and prosperity in our country in spite of independence. It will be the same after the establishment of Communism.

It is also a partial truth to say that it is wrong to give up a line of progress once traversed. Progress is not synonymous with breaking a past record irrespective of its moral value and utility. Such a theory can lead us only to the ever-increasing perfection of destructive weapons and demons in human form. The next war would have to be more extensive, total and terrible and to be directed by more inhuman generals than the last one. Progress would consist in destroying a larger part of humanity than hitherto.

Indeed there do exist people who believe so; nor is it impossible that the appearance of such events and monsters might occur in the future. But it will be progress not towards further development but towards decay and destruction of civilisation and mankind. If a conscious effort is to be made, it should be to prevent it, never, to hasten it.

(To be continued)

TRUMAN BACKS NEGROES' PLEA

The U.S. Department of Justice, with President Truman's approval, is supporting the cases of three Negroes who are challenging a 54-year-old doctrine of "separate but equal facilities for Negroes," says a SAPA message from Washington. The Attorney-General of Texas, Mr. Price Daniel, said that segregation was necessary because "some people have feelings that make for conflict when the two races associate too closely."

Mr. Daniel made his remarks in the case in which a Negro, H. Sweat, has brought a suit to force the all-White University of Texas Law School to admit him. The Assistant Attorney-General of Oklahoma, Mr. Fred Hansen, told the Court that his State must continue to segregate Negro and White students to prevent race riots. He appeared to oppose G. W. McLaurin, a Negro student at the University of Oklahoma, who is allowed to attend the White school but is segregated in the classroom, the library, the cafeteria and elsewhere. The third case arises from a complaint by a Negro against the practice of the Southern Railway Co. of partitioning off one end of its dining cars.

KENYA LETTER

(FROM OUR NAIROBI CORRESPONDENT)

NON-EUROPEANS CONDEMN SOUTH AFRICAN RACIALISM

APRIL 23, 1950, will go down in the history of East Africa as a historic day for the non-Europeans of Eastern Africa. For it was on this day that in a joint meeting of Indians and Africans under the auspices of two political institutions—the E.A. Indian National Congress and the Kenya African Union—a warning was sounded to European settlers of Kenya, Tanganyika and the Rhodesias that "any attempt to build society in East Africa on the basis of South African racialism is bound to meet with the utmost opposition by non-Europeans, ultimately leading to clash and conflict".

The meeting which was called jointly by the two political bodies for the purpose of counteracting the European settlers' agitation against the Tanganyika Government's proposals for reforms in that Territory whereby the Tanganyika Legislature would have equality of African representation also passed a strongly worded resolution demanding "complete independence" and called upon the non-Europeans to take vigorous action to safeguard their future".

A crowd estimated to be over 15,000 Africans and Indians heard speakers denounce the European settlers' agitation against the Tanganyika Government's constitutional proposals. It was presided over by the Hon'ble E. W. Mathu, an African Legislative Councillor, and addressed by the Hon'ble A. B. Patel, Indian Elected Member of Kenya Council, Mr. Jomo Kenyatta and Mr. Tom Mbotela, President and Vice-President respectively of Kenya African Union, Mr. Peter Koinange, American-trained African educationist, Mr. Chahan Singh President of Nairobi Indian Association, and Mr. Makhan Singh, General Secretary of the non-racial East African Trade Union Congress.

The resolution while deprecating the agitation launched by European settlers of Kenya and Tanganyika against the Tanganyika Government's proposals granting equal unofficial representation to Africans and non-Africans on the Legislative Council strongly condemned the "highly aggressive" attitude shown by them in country-wide meetings and declared "that these non-official Europeans have completely forfeited the confidence of the non-Europeans as to their ability

or willingness to be fair or just to others living in these Territories or to exercise any power in their hands impartially".

It has also appealed to the "Governments of the United Kingdom and other Commonwealth countries and to the Trusteeship Council of UNO to watch carefully the events in Tanganyika and to take effective steps with a view to promoting the political, economic and social progress of the inhabitants of the Territory generally and to save it from the designs of domination by the Europeans of East and Central Africa".

"This meeting", the resolution concluded, further declares that the real solution of the problem is not this or that small reform but the complete independence and sovereignty of the East African territories and establishment in the same of the democratic governments elected by the people and responsible to the people of these territories only and that this should be implemented at an early date".

African Legislative Councillor Hon'ble Mathu, who presided, traced the causes of the Settlers' agitation in Kenya, Tanganyika and, to some extent, in these territories were attempting to take their "inspirations" and "guidance" from their brothers in South Africa, the Rhodesias and Central Africa where "the racial policies are too inhuman to be imported into East Africa", and added, if these policies are introduced here, it would be the deathblow to the political, economic and social development of our children and our children's children.

"I do not wish to paint a gloomy picture of the future of non-Europeans in East Africa", Mr. Mathu declared. We must not be defeatists; we must form a united front and turn the present antagonistic tide (of Europeans) to save the future of our children. We must appeal to the United Kingdom Government, the friendly Dominions, the UNO and, as far as Tanganyika is concerned, to the Trusteeship Council. Let us give our cooperation to all those who wish to see equal opportunities given to all inhabitants of Tanganyika and the rest of Africa". He congratulated the E.A. Indian National Congress and the Kenya African Union for having taken the initiative in forming a united

front. He also expressed the hope that such consultations between Indians and Africans on matters of common problems would take place frequently.

The speeches of other leaders were notable for their forthright denunciation of the moves made by some unofficial Europeans. Hon'ble A. B. Patel warned the European settlers that "any attempt to build society in East Africa on the basis of South African racialism is bound to meet with the utmost opposition by non-Europeans, ultimately leading to clash and conflict."

Mr. Tom Mbotela, Vice-Pres-

ident of Kenya African Union, declared that "Europeans must live in this country as citizens, not as rulers or dominators; otherwise there will be trouble", he declared amidst thunderous applause.

This was perhaps the first meeting in Kenya where Indians and Africans formed a united front to counteract what are known here as "the evil designs of European settlers".

While it is difficult to gauge the feelings of Europeans at this stage, it is widely believed that they are taken aback at the common front of non-Europeans.

PANDIT GANGAPERSADH IN UITENHAGE



On Monday, April 17, Pandit Gangapersadh Upadhyaya, spoke before an audience of nearly 200. He called for torch-bearers of the Indian culture, which had suffered a decline from pre-eminence by social and political disorders, and by outside influences. Asked by a questioner, at the end of the meeting, he declared that the Republican India was going ahead, and he was confident of its future, which is being adjusted significantly.

In the picture above from left to right are Mr. B. K. Gajjar chairman of the Uitenhage Hindu Mandal, Mr. M. L. Gajjar, Pandit Gangapersadh Upadhyaya, Mr. A. K. Bhagatjee, Mr. T. Makhan and Mr. Dr. R. Lalla, chairman of the Port Elizabeth and Uitenhage Reception Committee.

A Farewell Banquet was given in honour of Pandit Gangapersadh Upadhyaya, at the Gandhi Hall on May 3, by the Arya Pratinidhi Sabha (Natal). Pandit Gangapersadh left South Africa by the s.s. Karanja on May 3,

OUR INDIA LETTER

(FROM OUR OWN CORRESPONDENT)

Baroda, April 19.

"Compulsion Of Events"

"The mere fact of an agreement is good" said Pandit Nehru in a broadcast to the nation, "and to be welcomed, because it turns people's minds to the ways of construction and away from the ways of destruction. Secondly, I can tell you with all confidence and in all honesty that both of us, who held these long talks, were animated by an urgent and earnest desire to find a peaceful and satisfactory solution. We were impelled to do so by the gravity of the situation and by the compulsion of events."

"Human Problem"

The Prime Minister of Pakistan appealed at Karachi to the Press in Pakistan to assist him in creating peaceful and livable conditions on both sides of the Indo-Pakistan border. He said that the problem of minorities was not political but human and should be seen from the viewpoint of serving humanity. He said that since partition the people of Pakistan and India had steadily drifted apart from each other, but at the present moment he had found a desire and determination among the people that the two countries should come closer. He was hopeful that those Muslims who had immigrated into Pakistan would return to their homes when normal conditions were restored. In a broadcast from Karachi Mr. Liaquat Ali Khan expressed the hope that the Indo-Pakistan Agreement on minorities would inaugurate a new era "in which we shall be able to settle mutually our disputes which have resulted in growing dissension between the two countries."

Indo-Pakistan Amity

According to a report in the 'Hindustan Times', Mr. Liaquat Ali Khan is reported to have said at New Delhi privately that India and Pakistan must in their own interest not only be friends but must be closer to each other than to any other country, that they had been untrue to the people in whose name they had won freedom by spending their resources in arming against each other.

Sardars Appeal

On the eve of his six-days' visit to Calcutta, at a three-hour meeting of the Congress Parliamentary Party in New Delhi, Sardar Patel made an impassioned appeal in support of the

Indo-Pakistan Agreement, which profoundly moved the members. He not only pledged his whole strength and energy to making a success of this Agreement and vindicating the stand of the Prime Minister but called upon every member, in the name of patriotism and duty to their country, to do so. His speech, which members later described as one of the most moving appeals they had ever heard, deeply stirred all sections of the party and filled them with firm determination to see the Agreement through—whatever may be the difficulties ahead. A debate on the Pact which was to take place in Parliament was dropped, after this appeal, at the request of members.

Sardar In Calcutta

At Calcutta Sardar Patel, meeting various sections of the public, appealed to them all to help in the implementation of the Agreement which, he said, must be honoured in a spirit of discipline. He called upon the Press to help create conditions, first for a general solution of the minority problem in both Bengal, and second, for arresting the present exodus. He is understood to have pointed out to the West Bengal Cabinet that nobody in India should wish to see Pakistan implemented the Pact or not, instead, they should stand solidly to give the Agreement a fair trial. Describing the Agreement as a 'good pact', Sardar Patel declared, at a West Bengal Congress Workers' meeting, that the Government of India were determined to see that the Agreement was implemented in the country. He said he believed that the Pakistan Government was as sincere as the Government of India in this respect. He also appealed to Congress leaders who had recently come from East Bengal to return to their former homes and places of activities and help create confidence amongst the minorities there. He urged the Congressmen to contact the refugees already assembled in the State and to persuade them to return to East Bengal.

"Good Results"

Pandit Nehru stated in Parliament on the 19th that the results obtained from the Agreement even during this brief period of eleven days had been satisfactory. The Government of India, he said, had taken immediate steps to implement the Agreement. After giving

details of the various measures adopted by the Government of India in this matter, Pandit Nehru said: "The Press in India and Pakistan have, as a whole, clearly indicated their determination to help in implementing the agreement and their general approach to Indo-Pakistan issues had changed greatly for the better. It is proposed to hold a joint meeting of the All-India Newspapers Editors' Conference in Delhi early in May." The number of Muslims leaving West Bengal for East Pakistan, which had risen to a peak figure of about 10 thousand a day, has gone down to 1,200. "Muslims going from other parts of India to West Pakistan have practically stopped doing so." The number of Hindus coming from East Bengal to West Bengal, which had risen to the peak figure of over 20 thousand a day, has now gone down to 9 to 11 thousand a day. "We have arranged for special ships" for migrants from East Bengal. "Steps are being taken for the

recovery of abducted women. Border incidents have decreased."

More About The Pact

Pandit G. B. Pant, Chief Minister of U.P. (Uttar Pradesh), reiterated India's determination to implement the Agreement and his firm resolve to protect the secular character of the State. "We will not deviate from the chosen path, whatever might happen in Pakistan," he added. He advised Muslims to fight the propagators of the two-nation theory. On the other hand, he said, "it is wrong to demand loyalty tests from the Muslims. I know that they are loyal to their Motherland." At Hyderabad Shri Velloodi, Chief Minister, asked representatives of the Press to take particular care to avoid giving expression to views or news which will have the effect of estranging feelings between the two communities. Shri C. R. Srinivasa, President of the All India Editors' Conference in a statement says: "Reports received so far from both Pakistan and India are encouraging. The task of implementation of the Prime Ministers' Agreement has been taken vigorously on hand and really heartening results are recorded. The spirit of amity engendered by the political settlement has permeated to Press of the two countries."

"May I request all members of the Press to see that nothing is published which is likely to prejudice the success of the Agreement. There is no bar of to the publication of truthful news and accurate reports. Undoubtedly, people would be anxious and concerned to know what is happening. But it is the duty of the Press to get their reports confirmed and publish only authenticated, factual and objective news.

All that I desire to emphasize at the moment is that we are passing through a period of crisis, that there should be an awareness of our responsibility and that whatever is published should be such as is not calculated to prejudice the central purpose of the Agreement on which there can be no difference of opinion. The Pakistan Press, according to report, has imposed on itself a self-denying ordinance in report of news and comments, and I am sure that the Press in this country would interpret its obligations, in the circumstances, in a spirit of goodwill, fairplay and restraint without any prompting from me.

"This Agreement is primarily concerned with issues raised on a narrow front of the differences



FLY VIA
NAIROBI
TO
INDIA
PAKISTAN
CEYLON

*the most direct route
to the EAST*

Alternate Thursdays a Constellation leaves Nairobi, reaching Bombay after only 12 hours flying.

Immediate connections at Bombay for all parts of the East.

Fare Nairobi/Bombay
£83 single £149. 8s. return



AIR-INDIA
International LTD.

Shell House, P.O. Box 1080
NAIROBI, Cables AIRINDIA.

Write to us, to E. A. C. our General Agents or to any I.A.T.A. Agent.

that existed between the two countries. But its success will lead the way to a just resolution of all the other issues, and I trust that thought will weigh with my colleagues in all that they publish and with the paramount consideration."

President Among Jains

At a reception held at New Delhi by the Jains the President, Dr. Rajendra Prasad said that the Nehru-Liaquat Pact was a ray of hope which, he believed, would soon shine like the noonday sun. An address was presented to the President which said that though the Jains were a minority they had not asked for any guarantees. It assured him the co-operation of the Jain community in bringing about an order of things devoid of violence and abounding in good in the land. Dr. Prasad said that the country was fortunate in having had the fortune of *Avatars* like Buddha and Mahavira. By following Mahatma Gandhi and his principles, the country had attained independence and taken a place among the nations of the world. Dr. Prasad said that Gandhiji had left behind him the creed of non-violence. The Government had a responsibility in the matter of spreading his gospel. Recent events that had happened in the country tended to shake the foundations of his creed. It was the responsibility of those who had followed the creed of non-violence all along to defend it at all cost. Referring to the reception Dr. Prasad said that the Constitution had given freedom to practise one's religion. But, the same Constitution had made all

Indians equals. Therefore, receptions by denominational groups should not be encouraged. He concluded: "For strengthening the nation and to forge ahead, all differences of religion should be done away with."

Egyptian Envoy's Praise

The first comment from a foreign State on the Delhi pact on minorities was available in the capital. Hailing the conclusion of the agreement between India and Pakistan, the Egyptian Ambassador in India, H. E. Ismail Kamel Bey declared in Delhi, "These two great countries which are among the greatest benefactors of mankind are putting their heads together to show to the world the shining face of Asia. Speaking before a gathering of Indian M.P.s a dozen prominent foreign diplomats and several Indian Minister who met to witness the inauguration of the Indian Council of Cultural Relations. The Egyptian Ambassador significantly added: "The ideal of the secular State is the most basic and beneficial factor in that agreement."

Bombay Merchant Arrested

A hardware merchant of Nagdevi Street, Bombay, was arrested in connection with the escape of Mir Laik Ali, former Premier of Hyderabad. It is said that the accused had helped Laik Ali in taking out the money required by the latter for his escape. He has been taken to Hyderabad.

MR. C. V. RAMAN' NEW DISCOVERY IN STRUCTURE IN SOLIDS

THE well known Indian Physicist and Nobel Laureate, Shri C. V. Raman, revealed in a Press interview in Madras "a new and hitherto unsuspected feature and behaviour of amorphous solids like glass."



Mr. C. V. Raman

He said that observations made by him with five specimens of vitreous silica obtained from the Libyan desert and presented to him by the famous British mineralogist, Dr. L. J. Spencer, two years ago, have led him to recognise this phenomenon, "which will be of enormous importance to industry."

The discovery relates to the existence of the phenomenon of double refraction in certain types of silica glass. This new phenomenon of double refraction has been termed "Structural-Bi-Refraction," to distinguish it from the already known "Stress-Bi-Refraction."

Distinct Phenomenon

He said: "Immersed in a suitable liquid and viewed between crossed polarised sheets, the specimens show bright bands of restored illumination, which run more or less parallel to each other, and to the longest dimension of the specimen. It is not possible to explain the phenomenon on the basis of the well-known double refraction exhibited by glasses in a state of stress. Indeed, parallelism of the band of illumination and their extent through the whole volume of the specimen completely excluded any such explanation."

This "Structural-Bi-Refraction" is distinct from "Stress-Optical-Double Refraction," familiar to Physicists and known to exist in glasses in various circumstances. He said: The two phenomena differ both in their observable character and in respect of their origin. The Stress Optical-Double-Refraction is a consequence of the deformation produced in the solid by externally

applied and internally existing systems of force. On the other hand, the new phenomenon arises from the basic departure of the structure of the material from that necessary, and normally assumed to exist, in order that the material might be singly refractive.

Abnormal Procession

The studies so far have indicated that double refraction arises when the material has been subject to a mechanical working while still in some fluid state and has not had the opportunity to reach ideal and normal conditions where there is no "Bi-Refraction."


Shri C. V. Raman added: "Amazingly enough, of piece of plate glass, familiar to all householders, exhibits such structural "Bi-Refraction" in readily observable fashion. It appears to be the consequence of the process employed in the making of plate glass."

Mr. E. H. Ismail President Indian Retailers Association has send the following telegram to Dr. Dongs: Durban and District Indian Retailers Association protests strongly against the obnoxious Group Areas Bill. It will cripple us commercially. Utterly repugnant to our people, we are doomed if it goes through.

R. VITHAL

Bookkeeper, Writing up Sets of Books, Balance Sheets, Income Tax Returns. Apply:

306 Commissioner St.,
Jeppe, Johannesburg.



World Copyright Reserved,
Centropress Denmark.

"Gold Medal" [Quality


High Class
Display Counters &
Showcases,
Refrigerator
Counters,
Wall Units
Fish Fryers,
Display Fittings,
etc.

New
Illustrated Catalogues
on Application.

ASSOCIATED SHOPFITTERS LTD.

Incorporating Excelsior Shopfitters, Ltd., S.A. Shopfitters, Ltd.

Manufacturers of High Class Display Cases
Awarded Gold Medal, Rand Water Show,
104 MARSHALL ST (facing Excom House) Johannesburg
Phone 33 421/2 P O Box 6501



THE CHURCH IN INDIA

INDIA is a great country destined to be even greater and the Church in India is great and destined to be very much greater. His Eminence Norman Thomas Cardinal Gilroy, Archbishop of Sydney and Papal Legate to the First Plenary Council of the Bishops in India, said in Bangalore recently.

The Plenary Council, which reaffirmed the Faith brought to India by St. Thomas nearly 2000 years ago concluded its 12-day session after signing "decisions" (the decisions reached at the conference). It was attended by 52 Archbishops, and Bishops, besides 70 other dignitaries. Cardinal Gilroy presided over the deliberations.

The Archbishop's tribute to India and the Indian Church was in reply to an address of welfare president by the Bishop of Bangalore, Dr. P. Thomas, on behalf of the Hierarchy, Clergy and the Catholics of India. The address traced the history of the Catholic Church in India and said from 20 Arch Dioceses and Dioceses in 1887, the number had increased to 48, besides four Prefectures Apostolic. The number of priests had doubled during the last 25 years, and that of religious sisters had nearly quadrupled. Of the 5,500 priests, over 4,000 were Indian Bishops.

A proof of the Government's goodwill towards the Catholic Church, the address said, was the inauguration of diplomatic relations between the Holy See and India in 1948. Catholics, it pointed out, had lived in concord and harmony with all sections of their countrymen and had not asked for political privileges under the new constitution. That constitution was secular and democratic in character with guarantees of liberty of conscience and denominations.

Cardinal Gilroy, replying to the address, said India was entering upon a new era and it was a happy coincidence that the first Plenary Council of the Catholic Church in India was being held at such a significant time. He was grateful to the civic authorities for the assistance they had given in holding that Council.

The Archbishop said the link between the venerable Church in India and the youthful Church in Australia was real. The history of the Church in India was almost coincident with the history of the Catholic Church itself and was nearly 2,000 years old. Despite that disparity in age they were intimately united.

"INDIAN AFFAIRS"

(Monthly Journal of the Indian National Congress)
News about our countrymen from all parts of the world.

Write for advertisement rates to The Manager "INDIAN AFFAIRS,"
7 Jantar Mantar Road,
NEW DELHI.

Sets Of Indian Art Pictures

By Celebrated Indian Artists
Price '8 - including postage.

To be had from:

'INDIAN OPINION,'
P. Bag, Phoenix, Natal.

BOOKS FOR SALE

Life of Ramakrishna
—By Romain Rolland 10 6
Life of Vivekananda and
the Universal Gospel
By Romain Rolland 10 6
The Indian States Problem
—By M. K. Gandhi 10 0

To be had from:—

The Manager,
INDIAN OPINION,
Phoenix, Natal

Books For Sale

Shri Aurobindo's Religious Books

LIGHTS ON YOGA	3	9
KALIDAS	3	3
ISHA UPANISHED	5	6
THE RENAISSANCE IN INDIA	3	9
HERACLITUS	3	3
IDEAL AND PROGRESS	3	0
THE NATIONAL VALUE OF ART	3	0
THE MOTHER	3	0
BANKIM—TILAK—DAYANANDA	3	6
AUROBINDO MANDIR ANNUAL 1943-44-45	10	6
COLLECTED POEMS AND PLAYS (Part 1 & 2)	27	6
THE RIDDLE OF THE WORLD	3	9
THE TEACHING AND THE ASHRAM OF AUROBINDO ON WAR	3	3

Obtainable from:

'Indian Opinion'

P. Bag, Phoenix,

Natal.

Books For Sale

Tagore's Literature

Essays, Novels, Poems and Plays

SACRIFICE (Novel)	5	6
GORA (Novel)	9	0
MASHI (Novel)	5	0
LOVER'S GIET (Poems)	3	6
CHITRA (Play)	3	6
STORIES FROM TAGORE (Short Stories)	3	6
STRAY BIRDS (Short Poems)	3	6
RED OLENDERS (Play)	1	0
HUNGRY STONES AND OTHER STORIES	5	6
THE HOME AND THE WORLD (Essays)	6	0
GLIMPSES OF BENGAL (Essays)	3	9
REMINISCENCES	5	6
POEMS OF KABIR	3	9
POST OFFICE (Play)	2	6
THE KING OF THE DARK CHAMBER (Play)	5	0

Obtainable from:

'Indian Opinion'

P. Bag, Phoenix,

Natal.

Cuticura



TALCUM POWDER

After the evening bath, a refreshing all-over dusting with fragrant Cuticura Talcum Powder will ensure sound sleep for a happy and contented baby, free from all chafing and irritation.

ABSORBENT AND COOLING

ઈન્ડિઅન ઓપિનિઅન.

મહાત્મા ગાંધીજીના દસ્તે
કાને 1૯૦૩માં સ્થપાયું. ૧

પુસ્તક ૪૮ મું—અંક ૧૮

શુક્રવાર તા. ૫ મે, ૧૯૫૦.

પુસ્તક નક્કલ પૈની.૪

“ ઈન્ડિઅન ઓપિનિઅન ”

શુક્રવાર તા. ૫ મે, ૧૯૫૦

મે કે અને તેનો પાઠ

મે કે આવ્યો અને ગયો. તે પાઠ શીખવી ગયો છે કે જે સૌએ શીખવે. લાભ દાયી થઈ પડશે. અમે પ્રથમથી મત દર્શાવી ગયા હતા કે સાઉથ આફ્રિકામાં સઘળા નેન-યુરોપી યોનેને લાય પડતા જીલમી કાય દાંચો સામે સંયુક્ત લડત ઉઠાવવાની વાત તો શું પરંતુ વીચાર કરવાનો પણ હજી અત્યુક્ત વખત આવ્યો નથી, કેમકે તેને માટે હજી આપણે પુરતું સંગઠન કરી શક્યા નથી અને એ કાર્ય હાલ હાથમાં લેવું એ નેતાઓની શક્તિ ની બહાર છે. અમે જાણી ગયા હતા કે આફ્રીકનો અને હાઈલેન્ડ ન પ્રથમ ધલાયદા વર્ગો તરીકે જ સંગઠીત થવું જોઈએ અને તેઓની લડત નેખી ચલાવી હાઈલેન્ડ, જેઓને અહીંસાના શસ્ત્ર નો વધારે અનુભવ છે, અથવા હોયો બાઈએ, તેઓએ ખીનઓને અનુકરણીય દાખલો બેસાડવો જોઈએ પરંતુ ટ્રાંસવાલ ઇન્ડિઅન કેંગ્રેસના નેતાઓને વીચાર જીદો થયો અને તેઓએ સમસ્ત નેન યુરોપીયોને એ દિવસે સઘળા રોજગાર બંધ રાખવાની અને કામ બંધ કરવાની અને દેખાવે કરવાની અને માસ મીટીંગો ભરવાની હાકલ કરી. આખો સવાલ એવો યુવ્યવાઈ પડ્યો કે શાની લડત હતી તેની પછી જ બચાર નહિ પડી. શું નેચેના પાસના કાયદાઓ માટે નેચેના પાસના કાયદાઓ માટે લખત હતી, કે છુટથી ઘોલવા અને હરવા ફરવાની સ્વતંત્રતાની હતી કે ગ્રૂપ એરીયાલ ખીલની સામે હતી? ટ્રાંસવાલ ઇન્ડિઅન કેંગ્રેસના નેતાઓ આખું અઠ-

વાહીયું મે કે ડને દિવસે લોકોએ શું કરવું તેની માહિતી આપનારા પોસ્ટરો અને પ્લેકાર્ડો તઈયાર કરવામાં પડી ગયા હતા. પરંતુ તેઓનાં આશ્ચર્ય વચ્ચે મે કે ના સોમવારના દિવસે અને અઠવાડીયાની આખરીથી તે દિવસ સુધી સઘળી બહાર સભાઓ કે દેખાવો કરવાના મનાઈ હુકમો છુટયા. અને એ મનાઈ હુકમને વશ થઈ શનીવારની રાતે રવીવારે અને સોમવારના દિવસોએ ગોઠવવામાં આવેલી સઘળી માસ મીટીંગો અને દેખાવો બંધ કરવામાં આવ્યાની બહાર બહાર બહાર પડી. પરંતુ હાઈલેન્ડ લતાઓમાં લગભગ સઘળી હાઈલેન્ડનો બંધ રહી હતી અને આફ્રીકનોએ કામની હડડતાળ પાડી હતી. કેન્ડેવાયું હતું કે આખીસ ટકા ઉપર નેટીવો સોમવારે કામપર ગયા નહોતા. જોહાનીસબર્ગ શહેરને દેખાવ એ દિવસે સળના દિવસ ના જેવો હતો. ગુહીલીઓએ એ દિવસે પોતાના “જોયો” વીના ઘણી અડચણો ભોગવવી પડી હશે. પરંતુ હાઈલેન્ડોએ હુકાનો શાને માટે બંધ રાખી હતી? શું ગ્રૂપ એરીયાલ ખીલની સામે ના વિરોધ દાખલ બંધ કરી હતી? અમે બંને કરેલી તપાસ પરથી અમે જોઈ શક્યા હતા કે ઘણા ખરાએ પોતાની હુકાનને અંગત અને પોતાની માલમતાને તુકસાન થાય એ બીકે બંધ રાખી હતી. કેંગ્રેસના નેતાઓ એ પણ માસ મીટીંગો અને દેખાવો પોતાનો મોટો કાર્યક્રમ એજ ભયની બંધ કર્યો હતો. કેમકે સરકારે ધમકી આપી હતી

કે તેના મનાઈ હુકમને અનાદર કરવામાં આવશે તો તે સખત પગલાં લેશે. કેંગ્રેસ નેતાઓએ જનતાની સુરક્ષિતતાના હિતને ખાતર એ ઠીકજ કયું હતું અને તેને માટે તેઓને અભિનંદન ઘટે છે. પરંતુ તેઓને પાછી પાની કરવી પડવી એ વસ્તુ જ બતાવી આપે છે કે તેઓએ પ્રથમથી જ ગેર ડહાપણ ભરવું પગલું લીધું હતું. કેમકે સરકારના ફરમાનો ના તેમને પ્રથમથી વીચાર કેમ નહિ આવ્યો? શું તેઓ એમ માનતા હતા કે સરકાર તેઓની હીલ ચાલને કચડી નાખવાને સામા પગલાં નહિ લે? તેનો શું તેઓ ને અગાઉ અનુભવ નથી થઈ ચુક્યો? અહિંસક કાર્યને સૌ થી પ્રથમ નીચમ જ એ છે કે સઘળાં પરિણામોને સામનો કરવાની તઈયારી ન હોય ત્યાં સુધી પગલું લેવું નહિ અને પગલું લેવાનો નીશ્ચય કર્યા પછી પાછી પાની થઈ શકે જ નહિ. તેઓના આવાં પગલાંથી તેઓએ સરકાર ને તેઓની નળબાઈ બતાવી આપી છે અને પપુબળ કે જેને આપણે મજબુત પપુબળથી તેઓને નાશ કરવી પડ્યા છીએ, એથી આપણને કચડી નાખવાની તેને તક આપેલી છે. સરકાર પોતાના પોલીસબળ થી તેમ કરવામાં સફળ થઈ છે. પોલીસને નેન-યુરોપીયોને સાથે ના વ્યવહારમાં દેખીતી રીતે છુટો હાથ આપવામાં આવેલો છે. પોલીસને ખરી રીતે કોઈના ઉપર તે તોફાન ન કરે ત્યાં સુધી હાથ લગાડવાની સત્તા નથી પરંતુ બ્યારે તે ખીન-ચોરા સાથે વાત કરે છે ત્યારે તે મહોટેથી ભાગે જ વાત કરે છે. હાથથી અને પગથી જ વાત કરે છે, એવી વસ્તુ જીવકાળમાં નહોતી. આજે તે સામાન્ય થઈ પડી છે, અને હાલની સરકાર ઉઠળ વધની

બંધ છે, સોમવારે ટ્રાંસવાલ ઇન્ડિઅન કેંગ્રેસની ઝોડીસમાં કેંગ્રેસના એક જવાબદાર અમલ દારને કશાં કારણ વિના ગરદન થી પકડીને પોલીસે વેનમાં નાખ્યા અને થોડેક સુધી લઈ ગયા બાદ છોડી ચુક્યા. મે કે ડને દિવસે જે તોફાનો થયા અને કેટલાક બન ગયા તેને માટે પોલીસના આવાં ઉસ્કેરનારાં કૃત્યો પણ કંઈક અર્થે જવાબદાર હતાં. એટલે સૌથી પ્રથમ પાઠ આપણે શીખવાનો છે તે નિર્ભયતા નો. જ્યાં સુધી આપણમાં ખીલ કુલ નીર્ભયતા નહિ આવે ત્યાં સુધી આપણી લડતમાં આપણે સફળ થઈ શકીશું નહિ. ખીજી વસ્તુ આપણે માદક પાણીને હાથ નહિ લગાડવાની પ્રતિજ્ઞા લેવાની છે. આ વસ્તુ નેટીવોને તો વીશેષ કરી લાય પડે છે, જ્યાં સુધી એ વસ્તુને તેઓ સદંતર લ્યાગ નહિ કરે ત્યાં સુધી તેઓ અહિંસક કદી નહિ રહી શકે અને ગમે તેવી ઉસ્કેરણીની સામે પણ એ તેઓ અહિંસક નહિ રહે તો સરકાર પોતાના વધારે મજબુત પપુબળથી તેઓને નાશ કરી નાખશે, આફ્રીકનોને જ હજી તેઓનામાં રહેલી ભાવિ શક્તિનું ભાન થયું નથી, તેનો કંઈક સ્વાદ મે કે ડને દિવસે તેઓએ કામપર નહિ ગયા ત્યારે બનતાને મળ્યો હતો. પરંતુ જે આપણે આત્મબળ અને આપણી આત્મા બચાવવાને આપણું સર્વસ્વ અને બન સુહાં કુરબ ન કરવાની શક્તિ અને હાઈમત કેળવી નહિ શકીએ તો આપણી નાશ જ થવાનો છે. બાઈબલનું મનનીય સુત્ર છે કે જેણે પોતાનો આત્મા ખોલ્યો છે તેણે સાઈ જગત જીતેલું પણ શા કામનું છે?”

ગુરૂ ખેરીયાઝ બીલ

સ્થાવર મીલકતની માલીકી મેળવવા ઉપર અને જમીન અને મકાન માં વસવાટ કરવા ઉપર અંગ્રેજી કુલુવા વગેરેથી લત્તાઓ સ્થાપવા અને તેને લગતી ખાખતો માટે વ્યવસ્થા કરનારું બીલ.

વ્યાખ્યાઓ

- (૧) આ કાયદામાં, તેના લખાણમાં જુદું જણાવેલું હોય તે સિવાય,
 - (૧) સ્થાવર મીલકતના સંબંધમાં "એકવાપર" (મેળવણું) શબ્દનો અર્થ કોઈ પણ પ્રકારે તેવી મીલકતના માલીક બનવું એવો થાય છે;
 - (૨) "મોડ"નો અર્થ કલમ ચોતીસથી સ્થાપવામાં આવેલી લેન્ડ ટેન્ચર એકવાપરની મોડ એવો થાય છે;
 - (૩) "કંપની"માં કોઈ પણ ખાનગી કંપની, કલમ સોળમાં જણાવેલી કોઈ પણ કંપની અને ૧૯૨૬ ના ૪૬ નંબરના કંપનીઝ એક્ટની યસો ઓગણી ત્રીસમી કલમમાં વ્યાખ્યા કરવામાં આવેલી છે એવી કોઈ પણ પરદેશી કંપની નો સમાવેશ થાય છે;
 - (૪) "કન્ટ્રોલ એરિયા"નો અર્થ ગુરૂ ખેરીયા અથવા જાહેર યએલો નેટીવ એરિયા લોકેશન, નેટીવ વીલેજ, કલડું લોકો માટેનું સેટલમેન્ટ, મીશન સ્ટેશન અથવા કલજી ત્રણની પેટા કલમ (૩) ના પારિત્રાહ (સી) માં જણાવેલો કમ્યુનલ રીઝર્વ ન હોય તેવા કોઈ પણ તે લતા અને તેમાં, કલમ દસના અપવાદ સિવાય, કલમ અગીયારમાં જણાવાયેલા કોઈ પણ ખાસ લત્તા નો સમાવેશ થાય છે. અપવાદ એ કે, કોઈ પણ ગુરૂ ખેરીયા, જે, કલમ ત્રણની પેટા કલમ (૧) ના પારિત્રાહ (એ) ની રૂએ યએલો જાહેરાત યુગ્મ વસવાટને માટેને, ગુરૂ ખેરીયા નહિ હોય, તે કન્ટ્રોલ એરિયામાં જમીન કે મકાનના વસવાટના સંબંધમાં, આ કાયદાના અર્થને માટે કન્ટ્રોલ એરિયાને બાગ ગણાશે, અને કોઈ પણ ગુરૂ ખેરીયા, જે ઉકત પેટા કલમમાં પારિત્રાહ (બી) ની રૂએ યએલો જાહેરાતમાં માલીકીને માટેનો ગુરૂ ખેરીયા નહિ હોય તે, કન્ટ્રોલ એરિયામાં સ્થાવર મીલકતની માલીકી મેળવવાના સંબંધમાં આ કાયદાના અર્થને માટે કન્ટ્રોલ એરિયાને બાગ ગણાશે.

(૫) કોઈ પણ કંપની ના સંબંધમાં "કન્ટ્રોલિંગ ઇન્ટરસ્ટ" નો અર્થ નીચે પ્રમાણે થાય છે.—

- (કે) તેના શેરોનો મોટો ભાગ; અથવા
- (ખ) શેર ડેપોઝિટના અરદા ઉપરના શેરો; અથવા
- (સ) સળખા શેરોની જુલમને કીમતની અરદી ઉપરની કીમતના શેરો; અથવા
- (ડી) શેર ધરાવનારાઓ તેના અરદા ઉપરના નફાને અથવા પુંજના અધિકારી અને એટલા શેરો; અથવા
- (ધ) શેરો ધરાવનારાઓ મોટા ભાગના અથવા ઘણા ખરા વોટોના અધિકારી અને તેટલા શેરો; અથવા
- (એક) કોઈ લેન ઉપરથી ઉપરિચિત યએલો કલેમ, જે તેની અરદી શેર ડેપોઝિટની અરદી ઉપરની કીમતનો હોય; અથવા
- (ઇ) કંપનીની પ્રદક્ષિઓ અથવા કંપનીની ડુબલ ઉપર, (એ) થી (એક) સુધીના પારિત્રાહોમાં સુચવવામાં આપ્યા છે તેવા પકારના કે તે સિવાય ના કોઈ પણ જાતના કોઈ પણ અન્ય કંપનીમાં કે કોઈ પણ બીજી રીતે, સીધી યા આડકતરી રીતે લાભો રાખીને કંપની ઉપર અથવા કંપની ની પ્રદક્ષિઓ કે તેની સુડી ઉપર કોઈ પણ જાતનો અંગ્રેજી ધરાવનારી સત્તા;

(૬) સ્થાવર મીલકત, જમીન અથવા મકાનના સંબંધમાં "ડીરેક્ટોરલી-કાઇડ (ન લાયક ઠરેલી) કંપની"નો અર્થ એવી કંપની કે જેમાં, તેવી મીલકત, જમીન કે મકાનના સંબંધમાં નાલયક ઠરેલા માણસ તરફથી અથવા તેની વતી અથવા તેના લાભમાં અંગ્રેજ ધરાવવામાં આવતો હોય અથવા ધરાવતો જણ્યોતો હોય;

(૭) કોઈ પણ ગુરૂ ખેરીયામાં સ્થાવર મીલકત, જમીન અથવા મકાનના સંબંધમાં "ડીરેક્ટોરલીકાઇડ પરસન"નો અર્થ એવો માણસ કે જે કલમ ત્રણ ની રૂએ યએલો લાગતી વળગતી જાહેરાતમાં દલાવવામાં આવેલા ગુરૂ (વર્ગ)નો ન હોય અને કન્ટ્રોલ એરિયામાં આવેલી કોઈ પણ સ્થાવર મીલકત જમીન કે મકાનનો માલીકના ગુરૂનો ન હોય, અથવા જે માલીક કે પ પ્રાંતની મ્યુનિસિપાલીટી સત્તાવાળી કોઈ પણ કાયદાથી સ્થપાયેલી અંગ્રેજી હોય તે તેની મંડળીના મોટા ભાગના સભ્યોના ગુરૂનો ન હોય, અથવા એવી કોઈ પણ પ્રજા મ્યુનિસિપાલીટી હોય તે તેનીકાઉન્સિલના મોટા ભાગના સભ્યોના ગુરૂનો ન હોય અથવા

જે કોઈ કંપની માલીક હોય તે તેવી કંપનીમાં અંગ્રેજ ધરાવતા અથવા તેની વતી અથવા તેના લાભમાં અંગ્રેજ ધરાવતા જણ્યા હોય તેવો માણસના ગુરૂનો ન હોય;

- (૮) "ગુરૂ"નો અર્થ કલમ મેમાં જણાવેલ વ્હાઇટ ગુરૂ, (મારનો વર્ગ) કલડું ગુરૂ અથવા નેટીવ ગુરૂ, અને તેમાં ઉકત કલમની પેટા કલમ (૨) ની રૂએ લાગતી વળગતી જાહેરાત અમલમાં મુકવાની જેટલે દરજ્જે જરૂર હોય તેટલે દરજ્જે ઉકત કલમની રૂએ ગુરૂ તરીકે જાહેર કરવામાં આવેલું હોય તેવા લોકોના કોઈ પણ ગુરૂ (વર્ગ)નો સમાવેશ થાય છે.
- (૯) "ગુરૂ એરિયા"નો અર્થ કલમ ત્રણની રૂએ જાહેર કરવામાં આવેલો કોઈ પણ લત્તા;
- (૧૦) "સ્થાવર મીલકત"માં તેવી મલકતમાં કોઈ પણ જાતનો ખરો દહ ધરાવતો હોય અને જે દહ રજીસ્ટર થવાથી તેવા ખરો દહ બનતો હોય તેનો અને (કલમ અગીયાર ની રૂએ ખાસ દરાવવામાં આવેલો હોય, તેવા લત્તામાં આવેલી સ્થાવર મીલકતના લીસ અથવા સમ-લીસ સિવાય સ્થાવર મીલકતના કોઈ પણ લીસ કે સમ-લીસનો સમાવેશ થાય છે, પરંતુ સ્થાવર મીલકત ઉપરના મોટાજેઠ મોડનો સમાવેશ યતો નથી;

(૧૧) "ઇ-રેક્ટર"નો અર્થ કલમ એકત્રીસની રૂએ નીમવામાં આવેલો ઇ-રેક્ટર;

- (૧૨) "જમીન"માં જમીનના કોઈ પણ ભાગનો સમાવેશ થાય છે;
- (૧૩) "લોકલ એથોરિટી" (સ્થાનિક સત્તા) નો અર્થ ૧૯૦૯ના સાક્રીય આક્રિકા એક્ટની કલમ પંચાસીના પારિત્રાહ (૬) માં ધારવામાં આવેલી કોઈ પણ સંસ્થા કે મંળી;
- (૧૪) "લગ્ન"માં (એક પતિન અથવા અનેક પતિનો આ વાળી) નેટીવ કાયદા અથવા ક્રિયાત્મક જુગ્મ અથવા બનને પદ્ધતિથી ગમે તેના ધર્મના નીચેનો જુગ્મ સ્વિકારવામાં આવેલો લગ્નનો સમાવેશ થાય છે;
- (૧૫) "પ્રધાન"નો અર્થ સુદ્ધ પ્રધાન: સિવાય કે નેટીવ ગુરૂ માટેના કોઈ પણ ગુરૂ ખેરીયાના સંબંધમાં અથવા નેટીવોને લગતા જમીનના કાયદાની રૂએ સ્થપાયેલા કોઈ પણ લત્તાના સંબંધમાં પ્રધાનનો અર્થ નેટીવ એક્સના પ્રધાન;

(૧૬) "પરમોટ"નો અર્થ કલમ ચીઠના લાગતા વળગતા ભાગની રૂએ આપવામાં આવેલ અર્થના આપવામાં આવેલ ગણાયેલો પરવાનો;

(૧૭) "શખ્સ" (પરસન) ના અર્થને કોઈ પણ નાલાયક ઠરાવાયેલા શખ્સ, નાલાયક ઠરાવાયેલી કંપની, ખાનગી કંપની, કલમ સોળમાં સુચવવામાં આવેલી કંપની અથવા કાયદાથી સ્થપાયેલી મંડળીના કોઈ પણ ખાસ સુચનના કારણે મર્યાદિત કરવામાં આવશે નહિ;

(૧૮) "મકાન" (રેસીડેન્સી) માં કોઈ પણ મકાનના કોઈ પણ ખંડ કે ભાગનો સમાવેશ થશે;

(૧૯) "કાયદાથી સ્થપાયેલી મંડળી"નો અર્થ કોઈ પણ કાયદાની રૂએ અથવા કાયદાથી સ્થાપવામાં આવેલી મોડ કે મંડળી."

આ ક.ય.દાના હેતુઓ માટે ગુરૂ

૨. (૧) આ કાયદાના હેતુઓ માટે નીચે પ્રમાણેના ગુરૂ રહેશે:

- (એ) વ્હાઇટ (ગેરની) ગુરૂ, જેમાં કોઈ પણ શખ્સ, જે દેખાવે ડેપોઝીટી રીતે ગોરા છે અથવા જે સામાન્ય રીતે અથવા શાખથી ગોરા તરીકે સ્વિકારા યેલો છે, અને જે દેખાવે ડેપોઝીટી રીતે ગોરા હોય છતાં, સામાન્ય રીતે અને શખથી રંગવણો શખ્સ છે, તેના જેવો નથી, અથવા જે પારિત્રાહ (બી) અને (સી) ના પેટા પારિત્રાહો (૨) અને (૩) ની રૂએ અથવા આ પેટા કલમના પારિત્રાહ (સી) અને પેટા કલમ (૨) ના પારિત્રાહ (એ) સહીત ઉકત પેટા પારિત્રાહોની રૂએ બીજા કોઈ પણ ગુરૂનો નથી, તેનો સમાવેશ થશે;
- (બી) નેટીવ ગુરૂ, જેમાં નીચેનાનો સમાવેશ થશે—

(૧) કોઈ પણ શખ્સ જે હકીકતમાં આફ્રિકાની યસલી પ્રજા કે ભતીનો છે અથવા સામાન્ય રીતે અને શાખથી એ પ્રજા કે ભતીના સભ્ય તરીકે સ્વિકારા યેલો છે અને જે પારિત્રાહ (સી) ના પેટા પારિત્રાહ (૨) અને (૩) ની રૂએ રંગવણી, (કલડું) ગુરૂનો નથી; અને

(૨) કોઈ પણ શખ્સ, જે પેટા પારિત્રાહ (૧) ની રૂએ ઠરાવાયેલા નેટીવ ગુરૂના છે. તેવા શખ્સોની સાથે તેવા શખ્સોની કોઈ પણ કોમના શખ્સ તરીકે આદતથી ભળતો હશે, અને પારિત્રાહ (સી) ના પેટા પારિત્રાહ (૩) ની રૂએ ઠરાવાયેલા કલડું ગુરૂનો નહિ હોય; અને

(૩) ગમે તે પ્રજા, ભતી કે વર્ગની કોઈ પણ સ્ત્રી, જેની અને પેટા પારિત્રાહ (૧) અને (૨) ની રૂએ ઠરાવાયેલા નેટીવ ગુરૂના કોઈ શખ્સની વચ્ચે લગ્ન યએલાં હશે અથવા જે તેવા શખ્સની સાથે સંગ કરતી હશે;

(સી) કલ્ડ ઝૂપ, જેમાં નીચેના તો સમાવેશ થશે—

- (૧) કોષ્ટ પશુ શબ્દને જે ગોરા ઝૂપ અથવા નેટીવ ઝૂપનો નથી;
- (૨) કોષ્ટ પશુ શબ્દને જે પેટા પારિઆફ (૧) ની રૂએ દરાવાયેલા કલ્ડ ઝૂપના શબ્દોની સાથે, તેવા શબ્દોની કોષ્ટ પશુ કોમના માણસ તરીકે, આદતથી લખતો હશે, અને જે પારિઆફ (બી) ના પેટા પારિઆફ (૩) ની રૂએ દરાવાયેલા નેટીવ ઝૂપનો નહિ હોય; અને
- (૩) એ તે પ્રભુ ભત્તી કે વર્ગની કોષ્ટ પશુ સ્ત્રી જેની અને પેટા પારિઆફ (૧) અથવા (૨) ની રૂએ દરાવાયેલા કલ્ડ ઝૂપના કોષ્ટ પશુ શબ્દોની વચ્ચે લખે થયાં હશે, અથવા જે તેવા શબ્દોની સાથે સંબંધ કરતી હશે; અને

(ડી) પેટા કલમ (૩) ની રૂએ એક ઝૂપ (વર્ગ) તરીકે ગહેર યથેચો હોય તેવા ઝૂપના શબ્દોના કોષ્ટ પશુ ઝૂપ.

(૨) ગ્રેડેટમાં જાહેરાતથી અવરનર-નવરલ

(એ) કોષ્ટ પશુ ભત્તીના, ભાષાના, સંસ્કૃતિના અથવા અન્ય વર્ગના શબ્દો, જેઓ નેટીવ ઝૂપના હોય અથવા કલ્ડ ઝૂપના હોય તેની વ્યાખ્યા આપશે; અને

(બી) તેની વ્યાખ્યા આપાયેલા ઝૂપને, આ કાયદાના હેતુઓને માટે અથવા જાહેરાતમાં જાણવાયેલા હોય તેવી તેની કલમોના હેતુઓને માટે અને મા તે સામાન્ય રીતે અથવા એક મા વધુ ઝૂપ ઝેરીયાજ (વર્ગીય લતાઓ) ના અથવા કન્ટ્રોલ્ડ ઝેરીયાજના અથવા તેના કોષ્ટ પશુ ભાગના સંબંધમાં, અથવા એક મા વધુ ઝૂપ ઝેરીયાજ અને કન્ટ્રોલ્ડ ઝેરીયાજ ખતોના સંબંધમાં અથવા તેના કોષ્ટ પશુ ભાગના સંબંધમાં એક ઝૂપ તરીકે જાહેર કરશે.

(૩) પેટા કલમ (૨) ના પારિઆફ (એ) ની રૂએ યથેચો જાહેરાતમાં એવું દર્શાવી શકશે કે, જે શબ્દો જાહેરાતમાં સુચવવામાં આવેલા ઝૂપના તરીકે ધારા મુજબ દરેક કરીને અથવા કોષ્ટ પશુ ખીજ કાયદાની રૂએ રજીસ્ટર થયેલા હશે તેવા શબ્દો જ એ ઝૂપના ગણાશે.

(૪) નેટીવ ઝૂપ અથવા કલ્ડ ઝૂપનો કોષ્ટ પશુ માણસ જે પેટા કલમ (૨) ના પારિઆફ (એ) ની રૂએ વ્યાખ્યા આપાયેલા કોષ્ટ પશુ ઝૂપનો માણસ હોય અથવા બનશે તો, ઉકત પેટા કલમના પારિઆફ (બી) ની રૂએ કરવામાં આવેલી કોષ્ટ પશુ જાહેરાતને અમકમાં સુકવાને જરૂરી જાણ્યો તેટલે દરજ્જે, નેટીવ ઝૂપ અથવા કલ્ડ ઝૂપ, જે હોય, તેમાંથી ખાતલ કરવામાં આવશે.

ઝૂપ ઝેરીયાજની સ્થાપના

૩. (૧) અવરનર-નવરલ લાખનુ જાણ્યો ત્યારે ગ્રેડેટમાં જાહેરાતથી—
(એ) એવું જાહેર કરી શકશે કે જાહેરાતમાં દર્શાવાયેલી તારીખ જે તારીખ જાહેરાતથી તારીખની ઓછામાં ઓછા એક વર્ષ બાદની હશે, ત્યારથી જાહેરાતમાં વ્યાખ્યા આપવામાં આવેલી લતો જાહેરાતમાં દર્શાવવામાં આવેલા ઝૂપના લોહાના વસવાટને માટેના લતો ગણાશે; અથવા

(બી) એવું જાહેર કરી શકશે કે જાહેરાતમાં દર્શાવવામાં આવેલી તારીખ થી જાહેરાતમાં વ્યાખ્યા આપવામાં આવેલી લતો તેમાં દર્શાવવામાં આવેલા ઝૂપના લોહાને માલીફી માટેના લતો ગણાશે.

(૨) પેટા કલમ (૧) ના પારિઆફ (એ) અને (બી) ની ૩ ના જાહેરાતો એના એજ લાના સંબંધમાં પશુ થઈ શકશે.

(૩) આ કલમની રૂએ કોષ્ટ પશુ જાહેરાત થઈ નહિ શકે—

(એ) સિવાય કે પ્રત્યેક દાખલામાં પાલોમેન્ટની બને સખાઓના દરાથી તેને માટે પ્રથમ સંમતિ મેળવવામાં આવી હશે; અપવાદ એ કે તેની સંમતિ મેળવ્યા વીના તેની જાહેરાત થઈ શકશે—

(૧) જે કેપ અથવા નાટલ પ્રાંતમાં આવેલા લતાના સંબંધમાં આ કાયદાની શરૂઆતથી પાંચ વર્ષની સુદત પુરી થયાં પહેલાં કરવામાં આવેલી હશે; અથવા

(૨) જે તે ડ્રાંસવાલમાં કલ્ડ ઝૂપને માટેના લતાના સંબંધમાં અથવા કલમ બે ની પેટા કલમ (૨) ની રૂએ વ્યાખ્યા આપવામાં આવેલા, કલ્ડ ઝૂપના માણસોના બનેલા ઝૂપને માટેના લતો જેનો આખો—અથવા મોટા ભાગ, આ કાયદાની શરૂઆત થઈ એ વખતે ડ્રાંસવાલના ૧૮૮૫ ના નંબર ૩ ના કાયદાની કલમ બે ના પારિઆફ (ડી) ની રૂએ અથવા ડ્રાંસવાલના ૧૯૦૫ ના મ્યુનિસિપલ એન્ડ ગેન્ડી ઓર્ડીનન્સની કલમ દસની રૂએ, ધલાપદા સ્થાપવામાં આવેલા લતાનો હોય તેના સંબંધમાં અથવા ડ્રાંસવાલના ૧૯૦૮ ના પ્રેચલ એન્ડ મેટ્ર ગેટલ્સ કટની કલમ એકસી એન્ડ ઝેરીસ (એ) ની પેટા કલમ (૧૦) માં જાણવાયેલી જમીનના સંબંધમાં યથેચો હોય;

(બી) સિવાય કે પ્રત્યેક દાખલામાં પ્રધાને લાગતા વળગતા પ્રાંતના એડમીનીસ્ટ્રેટરની સાથે મસલત કરી હશે, અને ગોરા ઝૂપ સિવાયના ખીજ કોષ્ટ ઝૂપને માટેનો લતો, જે આખો અથવા તેનો અમુક ભાગ, એવી જમીન પર આવેલી હોય, કે જે ખાણીને લગતા કોષ્ટ પશુ કાયદાની રૂએ પ્રોટેક્ટ થયેલી હોય અથવા પ્રોટેક્ટ ગણાતી હોય, તેવા દાખલામાં ખાણી ખાતાના પ્રધાનની સાથે મસલત કરી હશે, અને જે લતો આખો અથવા તેનો અમુક ભાગ જેની ૧૯૪૭ ના નેચરલ રિસોર્સીસ ડિવલપમેન્ટ એક્ટની કલમ એકમાં વ્યાખ્યા આપવામાં આવેલી છે, તેવા કન્ટ્રોલ્ડ ઝેરીયા માં આવેલી હોય તેવા દાખલામાં ઉકત કાયદાની કલમ બે થી સ્થપાયેલી નેચરલ રિસોર્સીસ ડિવલપમેન્ટ કાઉન્સિલની સાથે મસલત કરેલી હશે;

(સી) જે મકી કોષ્ટ પશુ ઝૂપ ઝેરીયામાં નીચેના પશુ સમાવેશ થયો હશે—

(૧) નેટીવ ઝેરીયા તરીકે દરાવાયેલા હોય તેવા લતામાં આવેલી આખી જમીન અથવા તેનો અમુક ભાગ અથવા ૧૯૩૬ ના નેટીવ ટ્રટ એન્ડ લેન્ડ એક્ટની રૂએ મુકત કરવામાં આવેલી લતો;

(૨) ૧૯૪૫ ના નેટીવ (અરબન ઝેરીયા) ડાન્સોલીડેશન એક્ટની કલમ બે માં દર્શાવાયેલ કોષ્ટ પશુ નેટીવ લોહેશન, નેટીવ વીલેજ અથવા નેટીવ હોસ્ટેલ, અથવા ઉકત કાયદાની કલમ નવની પેટા કલમ (૨) ના પારિઆફ (એ) ની રૂએ નેટીવોના વસવાટને માટે સંમતિ આપાયેલી કોષ્ટ પશુ લતો;

(૩) ૧૯૪૬ ના કલ્ડ પરસન્સ સેટલમેન્ટ એક્ટની કલમ, એકમાં જેની વ્યાખ્યા આપવામાં આવેલી છે તેવું કોષ્ટ પશુ કલ્ડ લોહોના વસવાટનું સ્થળ;

(૪) કોષ્ટ પશુ મીશન રેશન અથવા કમ્યુનલ રીઝર્વ, જેને કેપનો ૧૯૦૯ ના મીશન રેશન એન્ડ કમ્યુનલ રીઝર્વ એક્ટની કલમો અથવા ૧૯૪૮ ના કલ્ડ મીશન રેશન એન્ડ રીઝર્વ એક્ટની કલમ સોળ સાથે ઉપરોક્ત કાયદાની કલમો લાગુ પડતી હોય; અથવા

(૫) કોષ્ટ પશુ લતો જે ૧૯૨૬ ના નેશનલ પાક્લ્ડ એક્ટની રૂએ નેશનલ પાક્લ્ડ અથવા તેના પાર્ટનો ભાગ હોય તેવી કોષ્ટ પશુ જમીન.

ઝૂપ ઝેરીયામાં વસવાટ

૪. (૧) કલમ ત્રણની પેટા કલમ (૧) ના પારિઆફ (એ) ની રૂએ યથેચો લાગતી વળગતી જાહેરાતમાં દર્શાવવામાં આવેલી તારીખથી, અને જમીન કે મકાનમાં વસવાટને લગતી કોષ્ટ પશુ ખાસ કે કાયદાથી યથેચો જાણવલ્યમાં ગમે તે જાણવાયેલું હોય તે તો પશુ, કોષ્ટ પશુ ડીરકવેલીકોષ્ટ (નાલાયક) દરાવાયેલા શબ્દો, જેના સંબંધમાં જાહેરાત યથેચો હોય તેવા કોષ્ટ પશુ ઝૂપ ઝેરીયામાં આવેલી કોષ્ટ પશુ જમીન કે મકાનમાં પરવાના વીના વસવાટ કરી નહિ શકાય, અને કોષ્ટ પશુ શબ્દોની તેવા ડીરકવેલી કોષ્ટ (નાલાયક) દરેલા શબ્દોને વસવાટ કરવા દઈ નહિ શકાય.

(૨) પેટા કલમ (૧) ના વિધાનો કોષ્ટ પશુ નાલાયક દરેલા એવા શબ્દોને કોષ્ટ પશુ ઝૂપ ઝેરીયામાં આવેલી જમીન કે મકાનમાં વસવાટ કરવાનું ગેર કાયદેસર દરાવશે નહિ—

(એ) જે તે રાજ્યની, કાયદાથી સ્થપાયેલી મંડળીની અથવા (નાલાયક દરાવાયેલી કંપની કે કલમ સોળમાં સુચવાયેલી કોષ્ટ પશુ કંપની સિવાય) ઉકત જમીન કે મકાનમાં કાયદેસર વસવાટ કરી રહેલા કોષ્ટ પશુ શબ્દોની ખરા અર્થમાં નોકરી કરતો હશે;

(બી) જે તે ઉકત જમીન કે મકાનમાં કાયદેસર વસવાટ કરી રહેલા કોષ્ટ પશુ શબ્દોને ખરા અર્થમાં મુલાકાતે આવેલી હશે અથવા કોષ્ટ પશુ હોટલમાં ખરા અર્થમાં મહેમાન હશે;

(સી) જે તે કોષ્ટ પશુ હોસ્ટેલ, નરસીંગ હોમ, પામલ ખાનું, કે તેવી કોષ્ટ પશુ સંસ્થામાં દરદી હશે અથવા કેલખાનું, પ્રવૃત્તિ ક્ષેત્ર, કે એવી કોષ્ટ પશુ સંસ્થામાં કેદી તરીકે કે ખીજ રીતે મુકાયેલો હશે; અથવા

(ડી) જે (નેકરી કરનર માણસ સહીત) એવી જમીનમાં કે મકાનમાં કાયદેસર વસવાટ કરનાર કોષ્ટ પશુ શબ્દોના પતિ, પતિન, સગીર બાળક કે આશ્રિત હશે; અપવાદ એ કે આ પારિઆફના વિધાનો કોષ્ટ પશુ ઝૂપ ઝેરીયાના સંબંધમાં તોજ લાગુ પડશે જે અવરનર-નવરલ ગ્રેડેટમાં જાહેરાત થી એ ઝૂપ ઝેરીયાના સંબંધમાં તે લાગુ પડવાનું જાહેર કયું હશે, અને ઉકત જાહેરાતમાં દર્શાવવામાં આવેલું હશે એટલે જ દરજ્જે અને (જે કંઈ પશુ શરતો હશે તે) એટલી જ શરતોએ લાગુ પડશે.

(૩) પેટા કલમ (૧) માં સુચવવામાં આવેલા કોષ્ટ પશુ ઝૂપ ઝેરીયા માં આવેલી કોષ્ટ પશુ સ્થાવર મૂલકતના ટાઇટલ ડીડમાં ઝૂપને માટે જે લતો સ્થાપવામાં આવેલી હોય એ ઝૂપના શબ્દોને તેવી મૂલકતમાં વસવાટ

કરવાની કે તેનો ઉપયોગ કરવાની બંધી કરનાર કે પ્રતિબંધીત કરનાર કંઈ પણ વિધાન હશે તે ઉકત પેટા કલમમાં સુચવવામાં આવેલી તારીખથી ૨૬ થશે અને ત્યાર બાદ એવી કોઈ પણ મીલકતના ટાઇટલ ડીડમાં એવું કોઈ પણ વિધાન દાખલ કરવામાં આવશે નહિ.

ગ્રુપ એડ્રીયાહમાં સ્થાવર મીલકતની માલિકી

૫. (૧) નો કોઈ ગ્રુપ એડ્રીયાહ કલમ ત્રણી પેટા કલમ (૧) ના પારિશ્રાદ્ધ (બી) ની રૂએ માલિકીને માટેનો ગ્રુપ એડ્રીયાહ હશે તે -

(એ) કોઈ પણ નાલાયક હરેલી શખ્સથી કે નાલાયક હરેલી કંપનીથી, જાહેરાતમાં જણાવવામાં આવેલી લાગતી વળગતી તારીખથી અથવા ત્યાર બાદ એ લક્ષમાં આવેલી કોઈ પણ સ્થાવર મીલકત એ તારીખ પહેલાં વસીયતનામાંથી યા બીજા કોઈ પણ પ્રકારના કાર અચેલા હોય તે પછી, પરવાના વીના મેળવી નહિ શકાય; અપવાદ એ કે આ પારિશ્રાદ્ધના વિધાનો કાયદાથી સ્થપાયેલી કોઈ પણ મંડળી તરફથી એવી મીલકત મેળવવાનું ગેર કાયદે હરાવશે નહિ;

(બી) કોઈ પણ નાલાયક હરેલી કંપની જે ઉકત તારીખે એ લક્ષમાં આવેલી કોઈ પણ સ્થાવર મીલકતની માલિકી ધરાવતી હશે તેનાથી ઉકત તારીખથી દસ વર્ષની મુદત બાદ એવી મીલકતની માલિકી વગર પરવાને ધરાવી શકશે નહિ;

(સી) કોઈ પણ કંપની જે ઉકત તારીખે અથવા તે પછી નાલાયક કંપની હરે અથવા ફરીથી નાલાયક કંપની હરે તેનાથી તે લક્ષમાં આવેલી કોઈ પણ સ્થાવર મીલકત, જે તેણે એ તારીખથી અથવા તે પછી વગર પરવાને મેળવવી દશે તેની માલિકી પરવાને મેળવ્યા વીના ધરાવી શકશે નહિ.

(ડી) એ લક્ષમાં આવેલી કોઈ પણ સ્થાવર મીલકતનાં ટાઇટલ ડીડમાં, જે ગ્રુપને માટે એ લક્ષે સ્થાપવામાં આવેલો હશે એ ગ્રુપના શખ્સો તરફથી તેની મીલકતની માલિકી મેળવવાની બંધી કરનાર કે પ્રતિબંધીત સુકનાર કંઈ પણ વિધાન હશે તે ઉકત તારીખથી ૨૬ થશે અને ત્યારબાદ તેની કોઈ પણ મીલકતના ટાઇટલ ડીડમાં બંધી કંઈ પણ વિધાન દાખલ કરવામાં આવશે નહિ.

(૨) સ્થાવર મીલકત મેળવવા અથવા ધરાવવાને લગતાં કોઈ પણ ખાસ અથવા કાયદાના વિધાનોમાં ગમે તે જણાવેલું હોય છતાં પેટા કલમ (૧) લાગુ પડશે, પરંતુ ઉકત પેટા કલમ ખાણુ અથવા ખનીજ ધાતુની શોધ, કરવાને ખાતર કોઈ પણ મીલકત મેળવવા અથવા ધરાવવા અથવા વેચી દેવા સંબંધી કોઈ પણ કાયદાના વિધાનના અમલને ઉકત પેટા કલમ રાફી નહિ શકે.

(૩) પેટા કલમ (૧) ના પારિશ્રાદ્ધ (એ) માં સુચવવામાં આવેલી તારીખે અથવા તે પછી વસીયતનામાંથી કે કોઈ બીજી રીતે કોઈ પણ શખ્સ પેટા કલમ (૧) ની વીરુદ્ધ જઈ કોઈ પણ સ્થાવર મીલકત મેળવી અથવા તેની માલિકી ધરાવી શકે તેના કંઈ પણ કારાર થયા હશે તે નકામ ગણાશે.

અચુક ગ્રુપ એડ્રીયાહ માટે વહીવટ મંડળી

૬. (૧) પ્રધાન ગ્રેજેટમાં નોટીસથી (ગોરા ગ્રુપને માટેના લક્ષા સિવાયના બીજા) કોઈ પણ ગ્રુપ એડ્રીયાહને માટે ધારાઓની મુજબ બનેલી એક વહીવટી મંડળી સ્થાપી શકશે.

(૨) તેની વહીવટી મંડળી આપી અથવા મોટે ભાગે જે ગ્રુપને માટે ગ્રુપ એડ્રીયાહ સ્થાપવામાં આવેલો હોય તે ગ્રુપના લેડિંગની બંધી હોઈ શકશે અને તેને ધારામાં જણાવવામાં આવેલું હશે તેવા કામ અને સત્તાઓ રહેશે, અને જ્યાં લાગતો વળગતો ગ્રુપ એડ્રીયાહ આગે અથવા તેનો અચુક ભાગ સ્થાનિક સત્તાની હકમત નીચે હશે ત્યાં તેની સ્થાનિક સત્તાની ધારાથી હરા પાયેલી દેખવેખ નીચે પોતાની સત્તા અને કામ ચલાવી શકશે, અને જ્યાં લાગતો વળગતો ગ્રુપ એડ્રીયાહને કેટલોક ભાગ એક સ્થાનિક સત્તાની હકમત ના વિસ્તારમાં આવેલો હોય અને બીજાને ભાગ કોઈ બીજી સ્થાનિક સત્તાની હકમત નીચે આવેલો હોય અથવા કોઈ પણ સ્થાનિક સત્તાની હકમતની બહાર હોય તો તે પ્રધાન તરફથી નીમવામાં આવેલી સ્થાનિક સત્તાની દેખ રેખ તેને પોતાનું કામ અને સત્તા ચલાવશે.

(૩) આ કલમની રૂએ લાગતા વળગતા ગ્રુપ એડ્રીયાહને માટે વહીવટી મંડળી સ્થપાવાથી એવી વહીવટી મંડળી પાસે જે સત્તાઓ અને કામો નહીં હોય તે સત્તાઓ અને કામો તે ગ્રુપ એડ્રીયાહના સંબંધમાં કોઈ પણ સ્થાનિક સત્તા પાસેથી છીમતી લેવાશે નહિ.

(૪) પ્રધાન આ કલમની રૂએ પોતાને રહેણી સત્તાને લાગતા વળગતા પ્રાંતના એડમીનીસ્ટ્રેટર સાથે મક્કમત કરી બાદ ઉપયોગ કરશે.

અચુક લક્ષાઓમાં મ્યુનીસીપલ કારભાર બંધોબર ચલાવવ ખા

૭. (૧) પ્રધાનનો જે એવો મત થાય કે ટ્રાંસવાલનો ૧૮૮૫ ના ૩ નંબર ના કાયદાની કલમ બે ના પારિશ્રાદ્ધ (ડી) માં, અથવા ટ્રાંસવાલના ૧૯૦૫ ના મ્યુનીસીપલ એમેન્ડમેન્ટ એડાઈનન્સની કલમ દસમાં, અથવા કોઈ પણ સ્થાનિક શહેરી સત્તાની હકમત હેઠળના લક્ષામાં આવેલા (ગોરા ગ્રુપ માટેના લક્ષા સિવાયના બીજા) કોઈ પણ ગ્રુપ એડ્રીયાહમાં જે સ્થાનિક સત્તા તરફથી બંધોબર કારભાર ચલાવવામાં આવતો નથી તે લાગતા વળગતા પ્રાંતના એડમીનીસ્ટ્રેટરને તપાસ કરવાની તે વીનંતી કરી શકશે (ઉકત સ્થાનિક સત્તાને પોતાની વાત રજુ કરવાની તક આવવામાં આવશે) અને ત્યાર બાદ ઉકત એડમીનીસ્ટ્રેટર, લેખીત નોટીસથી, તેની સ્થાનિક સત્તાને, ઉકત નોટીસમાં દર્શાવવામાં આવેલું કંઈ પણ કામ, જે ઉકત સ્થાનિક સત્તાને કરવાની સત્તા હોય, અને જે એડમીનીસ્ટ્રેટરનો એવો મત હોય જે લક્ષાનો કારભાર બંધોબર ચલાવવાને જરૂરી છે, તે પુરત જ કરવાનું જો જણાવી શકશે, અને જે એવી સ્થાનિક સત્તા, જે નોટીસ મુજબ વર્તના ચુકશે તે એડમીનીસ્ટ્રેટર બને તે એ કામ કરાવી શકશે અને તેને માટે સ્થાનિક સત્તા કાયદેસર જે કરી શકે તેવું કંઈ પણ કામ કરવાની કોઈ પણ શખ્સને સત્તા આપી શકશે

(૨) આ કલમની રૂએ એડમીનીસ્ટ્રેટર લાગતી વળગતી સ્થાનિક સત્તા પાસેથી તેના તરફથી ચલેલો કંઈ પણ ખર્ચ વસુલ કરી શકશે -

(એ) જે સ્થાનિક સત્તા એ ખર્ચ ન બરે તે તેની સામે કોઈ મારફતે પગલાં લઈને; અથવા

(બી) જે સ્થાનિક સંસ્થાએ ખર્ચ નહિ બચો હોય તેની હકમત નીચેના લક્ષામાં કરે લાગુ પડનારી સવળી મીલકતોપર ખાસ કરી નાખીને; અથવા

(સી) ખર્ચ નહીં બરનારી સ્થાનિક સત્તા ડેન્-સોલિડિટી રેવન્યુ કે ડેન્-સોલિડિટી અથવા એડમીનીસ્ટ્રેટર તરફથી મળતી કોઈ પણ નાણુ મદદ કે ગ્રાન્ટ કે અન્ય રકમોમાંથી બાદ કરીને,

અથવા વસુલ કરવાની એવી ત્રણે અથવા બે રીતો લઈને અને આ કલમની રૂએ સ્થાનિક સત્તા પાસેથી આ રકમ વસુલ કરવાની છે તેનો એડમીનીસ્ટ્રેટરનું સર્ટિફિકેટ પુરાવો ગણાશે, સિવાય કે તેની સામે પ્રધાનને અપીલ કરી શકાશે, જેનો સુકનો છેવટનો ગણાશે.

આવેલા દિવાળી અંકે

જાણ	શી. ૫ ૦	૨૧૧વાર	શી. ૧૦ ૦
આરામ	૫ ૬	સંદેશ	૧૦ ૦
સવિતા	૭ ૦	વેળી	૭ ૬
ગોલમખા	૬ ૦	બે લડી મોલ	૭ ૬
હાંડી	૩ ૬	ચિત્રપટ	૭ ૬
સરતુ સાહિત્ય પંચાંગ	૨ ૬	મુંબઈ સંમાચાર	૫ ૦
મુંબઈ સમાચાર પંચાંગ	૫ ૬	મુંબઈ સંમાચાર	૫ ૦
'India, (English) 12	૧૫	હાંડે (પુસ્તક)	૭ ૬
Copies	6 ૦	Fileindia English	5 6

KAPITAN'S BOOK AGENCY,
189 Grey Street, DUBAN.
Phone 23414 Tel Add. "KAPITANS"

અઠવાડિક પંચાંગ

વાર	ખારતી	હાંડી	મુસલમાન	પારસી	સુપ્રોદય	સુશીલ
	૧૯૫૦	૨૦૦૬	૧૩૬૮	૧૩૧૯	સુપ્રોદય	ક. મી.
	ગે	ગેશાખ	સાલ	રોહે. કદની	ક. મી.	ક. મી.
શુક્ર	૫	૧૬	૪	૧૭	૫	૫-૨૦
શનિ	૬	૧૭	૫	૧૮	૬	૫-૨૧
રવિ	૭	૧૮	૬	૧૯	૭	૫-૨૨
સોમ	૮	૧૯	૭	૨૦	૮	૫-૨૩
મંગળ	૯	૨૦	૮	૨૧	૯	૫-૨૪
બુધ	૧૦	૨૧	૯	૨૨	૧૦	૫-૨૫
ગુરુ	૧૧	૨૨	૧૦	૨૩	૧૧	૫-૨૬

ગાંધીજી અને સામ્યવાદ

‘હરિજનપંથુ’માંથી — ગતાંકથી ચાલુ (૯)

તે આપણે દૂરદીપણના સહકારને તે વીચાર કરીએ. તે શું છે, તે બધી લેવાની વસ્તુ છે, કારણ કે એ બાબતમાં કેટલીક ખોટી માન્યતાઓ પોષાયેલી છે.

કેટલાક લોકો માને છે કે આ તો, એક આકર્ષક નામ નીચે, જે માણસો ના હાથમાં આપવાર મિલકત, સત્તાનાં સ્ત્રોતો, અધિકાર વગેરેનો કબજો આવી શકે છે, પણ જેને પ્રાપ્ત કરવામાં મીલકતો દાવા રજૂ કરે છે તેમના હાથમાં તે ન બતાવે તેવા માટે દબાવી કાઢી દેવામાં મિલકતો અને તેમના સારા વહીવટ તરીકે છીએ અને પ્રગતને વધારે માં વધારે લાભ અમેજ આપી શકી એ એમ છીએ. અમારા હરીદી તેમ જ સામાન્ય જનતા કોઈ આવા માટે ની કુશળતા ધરાવતા નથી. આથી પ્રગતના સિત્તવંતક તરીકે અમારે જ તે સ્ત્રોતો રાખવાં જોઈએ; નાલાયક માણસોને એ સોંપી દઈએ તે અમે જનતાથી યુક્ત ગણાઈએ.’ આવી આવી રીતે રજૂ કરવા માટે આપણે દૂરદીપણને ઊંચાણે સીદાંત ઉભો કરીએ છે. અમેજને દોષ પર પોતાની કબજો રાખી યુક્તવા માટે કેટલાંયે વર્ષો સુધી આવી જ દલીલો કરતાં. તેમને કહેવા કે, ‘અમે તેના હાથમાં સત્તા સોંપીએ? પ્રગત તો સાવ નીચર, પછાત અને અચ્છ છે. એમનામાં સંપ નથી, તરિક તરિકના નાન, જાત, ધર્મ વગેરેના અધકામો છે. તેમને નામે અવગણ કરનારા નેનાએ ધુવં છે: સત્તા માટે અંદર અંદર અમારા છે; તેઓ પોતાની જ રાજ્ય શોધવાવાળા છે. તેઓ હોંડવાનમાં શાંતી જાળવી શકશે નહીં. આથી બાળક જેવી નીચર અને અજ્ઞાન પ્રગતના વાલી તરીકે અમરથી હોંડવાનનો કબજો છોડી શકાય નહીં.’

પણ અમેજને કાંઈ હોંડવાનનો સંભવનીય મૂલ્ય કરતા નહોતા; (દેશનો તે વખતના તેઓની દૃષ્ટિએ) વાળખી ગણાય તેટલું જ મહેનતાણું બંધને કરતા હતા એમ પણ ન કહેવાય; પ્રમાણિકપણે નહોતા હતા. આથી લોકોની દૃષ્ટિએ આ દૂરદીપણની દલીલ દેશને હાથમાં રાખી યુક્તવાનું બહાનું જ બેધાનું હતું.

૧. વળી, કાષ્ટકસર રીતે નીમાયેલા દૂરદીપો વધે પણ આવા અનુભવ ધણી વાર થાય છે. સગીર ઉમરલાયક માને તે પછીયે મીલકતનો કબજો અને પિતૃવ્ય તે સોંપી દેવાને બદલે વીધ અને ટાળાટાળ કરે છે, તથા કોરજમાં એમ બતાવે છે કે સગીરમાં પોતાનું સંભાળવા નેટલી લાયકાત નથી. આવા દૂરદીપોને સગીર પાપંદી

લેણે છે અને તેમના ઉપર તેને વીચારસ રહેતો નથી.

આવા અનુભવને લીધે ખુદ ‘દૂરદી’ શબ્દ અને ‘દૂરદીપણનો સીદાંત’, બંનેની શાખ ધરી ગઈ છે, અને એ વીચાર જ કેટલાકને અણખપતો થઈ પડ્યો છે. આજના ‘પ્રગતિવાદી’ ગણાતા રાજદારીઓને વહેમ આપ્યો કે રાજાઓ, જમીનદારો, યુદ્ધિદારો તથા બીજા સત્તાશાળી લોકો પ્રત્યે મિત્રભાવ-ધારનારા ગાંધીજીએ તેમનું દિવત સાધવા માટે આ શબ્દ દાખલ કરીને હોશિયારીથી તેમનાં હાથ માં પોતાની મિલકત તથા સત્તા ન છોડવા માટે એક હથિયાર યુદ્ધી દીધું. વળી, એમ માની લેવામાં આવે છે કે અતિ ઉદાર અને સખાવત ટુતિતિનો સમજવો તે ગાંધીજીની દૃષ્ટિએ આદર્શ દૂરદી કહેવાય. દા. ત., કોઈ રાજા કે લક્ષ્મીણીએ એવા હોય જે અંગત રીતે બહુ જ સાદાછથી જીવન ચલાવતો હોય, અવારનવાર મોટાં દાનો કરતો હોય, જેણે કંઈક સારી સંસ્થાઓ સ્થાપી હોય, અથવા પોતાની મિલકત ના સારાસા બાગનું સંપ વતી રૂકતું કહ્યું હોય; વળી, તે સાથે તે નોકરચાકર પ્રત્યે બહુ માયાળુ હોય, ગરીબો પ્રત્યે રહેમદિલ હોય, સારા આતિથ્યસકાર કરતો હોય, મિત્રોને અચ્છને મદદ કરનારો હોય, અનીતિનાં મોટાં ડુપણાં થી યુક્ત હોય, અને ધર્મકર્મમાં શ્રદ્ધા ધરાવતો હોય, તો દૂરદીના તેણે પુરુષો વધે જાનવી નાખ્યા એમ કહેવાને હરકત નથી. એ પોતાના કંઈકથીએને કેવા આરામમાં રાખે છે, કમાણીના તથા મિલકતને કેટલો બાગ પોતા પાછળ ખર્ચે છે, અને કેવી રીતે કમાણી કરે છે, તે જોવાની વસ્તુ નથી.

પણ આ માન્યતાઓ આધાર વિના ની છે. ‘દૂરદી’ શબ્દ કાપદાની પરિભાષા છે; અને કાપદો વખતો વખત એમાં જે અર્થ બરે, દૂરદીનાં કર્તવ્યો અને હક્કોની જે સીમાઓ યાંધિ તે ગાંધીજીના સીદાંતમાં આવનારા દૂરદીનેયે લાગુ પડે છે, અને, તે ઉપરાંત, કાપદામાં ન આવતી છતાં નૈતિક દૃષ્ટિએ અનીચાઈ ધનતી ગમીદાઓ પણ લાગુ પડે છે. ઇ. સ. ૧૯૩૭માં ‘ગાંધીવાદ’: સમાજવાદ નામે એક લેખસાળા જે ‘હરિજનપંથુ’માં આપી હતી. તે ગાંધીજીએ જીવે ત્યારની સુધારેલી હતી. તેમાં દૂરદી પણાનો સીદાંત જે નીચે અનુજ સમજાવ્યો હતો:

“શોષણ અને વંચના અટકાવવાનો પ્રથમ ખાનગી મિલકતના પ્રથમ સાથે સંકળાયેલો છે, અને એ એ એક જ

છે એમ પણ ઘણી વાર માનવામાં આવે છે, તથા ‘ગાંધીવાદ’: સમાજ વાદની ચર્ચાઓમાં ઘણુંખરું આ પ્રથમ ઉપર જ ગરમાગરમ વાલિવાદ થાય છે સાચું પુષ્ટતાં આ બાબતમાં ગાંધીજીના વીચારો તે કદાચ ઉદ્ભવમાં ઉદ્ભવ સામ્યવાદી (જામ્યુનિસ્ટ) કરતાંયે આગળપડતા છે. એમના સીદાંત પ્રમાણે તો કોઈ પણ માણસ પાસે કોઈ પણ જાતનો પરિચ્છદ ન હોવો જોઈએ. મિલકતના ખાનગી પરિચ્છદ તેમને સહન કરે છે તેનું કારણ એ નથી કે એમને મિલકતનો કે પરિચ્છદ નો મોહ છે કે મનુષ્યજાતના ઉત્કર્ષ માટે મિલકતનો સંગ્રહ આવશ્યક છે એમ તેઓ માને છે; પણ ખાનગી સંગ્રહ વધારવા અને સંધરવાની પ્રયાનો અંત લાવવાનો કોઈ સલાયકી માર્ગ હજી તેમને સાંપડ્યો નથી. હું ધાંડું છું કે બધાંયે પંચના સમાજવાદીઓ માને છે કે મનુષ્યજાતના સુખ માટે માહમિલકતનો સંગ્રહ અને વીજીવતા હોવાં આવશ્યક જ છે. ગાંધીજી આ વાત સીદાંતરૂપે સ્વીકારતા નથી. આને પરસેવા ઉતારી અ જીવો જ રોટીયો મેળવીએ, અને આવતી કાલને માટે આવતી કાલે પરસેવા ઉતારવા તૈયાર રહીએ—એવા આદર્શમાં કોઈ સમાજ વાદીને શ્રદ્ધા નથી, ગાંધીજીને છે. પણ એ તો આદર્શની વાત થઈ. વ્યાવહારિક રીતે વીચારતાં તેઓ જાણે છે કે મનુષ્યજાત પરિચ્છદ છોડી દેવા તૈયાર થાય એવા સમય કદાચ કોઈકે કોઈકે કાળમાં આવવા સંભવ નથી. એટલે વીચારવાની વસ્તુ એટલી જ રહે છે કે ને લોકોના તાબામાં કે અધિકારમાં મોહમિલકતનો ખાંડ પ્રત્યક્ષણ હોય, તેઓ તેને કંઈ દૃષ્ટિએ રાખે, અથવા કંઈ શરતે તેમની પાસે તે રહેવા દેવા માં આવે? ગાંધીજી કહે છે કે કોઈ પણ મિલકત એક વ્યક્તિના કબજામાં હોય કે અનેક વ્યક્તિઓના બનેલા મંડળના કબજામાં હોય, અને એ કબજો તેમણે તે વખતના કાપદાની રૂબ રૂબી હોય કે ગેરકાયદે કર્યો હોય, તેઓ તે પોતાના અંગત ઉપયોગ માટે નહીં પણ સમાજના ઉપયોગ માટે અને સમાજની વતી ધરાવે છે; અર્થાત, તેઓ તે મિલકતના ‘દૂરદી’ વાલી છે એમ તેમણે તેમ જ બીજાઓ એ સમજવું જોઈએ. આ ‘દૂરદી’ શબ્દથી કેટલીક ગેરસમજ ઉત્પન્ન થયેલી છે. કારણ એ છે કે ગાંધીજી ન્યારે કંઈક જોવે છે ત્યારે જે જોવે છે તેના પુરુષાર્થ પર તેઓ બરા સુકે છે એમ સમજવાને લોકો દૃષ્ટુ ટેવાયેલા નથી. ગાંધીજીના શબ્દોને પણ રાજકીય મુત્સદ્દીઓ અને વક્તા

ઓના ન્યાયે સમજવાની જુલ કરવામાં આવે છે. અંગેજ મુત્સદ્દીઓએ ઘણી વાર કહ્યું છે કે હોંડવાનમાં બિહીશ સરકારની હસ્તી દોંડા પ્રગતના કલા-જુદાઈ અને તેમના દૂરદી તરીકે છે. પણ આપણને અનુભવ એવો થયો છે કે આ બાબા પ્રમાણે વર્તવાની તેમ ની જરૂરે દાનત નથી. એટલે કે આવી બાબા વાપરવામાં કેવળદંબ અને બાટાઈથી બરેલા શબ્દોથી આ પણને જુલાવામાં નાખવાનો જ તેમને હેતુ હોય છે એમ આપણે સમજી ગયા છીએ.... ન્યારે તેઓ ‘ગાંધીજી’ કહે છે કે જેમની પાસે મિલકત છે તેઓ તેના મલિક નહીં પણ દૂરદી છે, ભારે એ શબ્દો કેવળ વાણીનો અટકાર છે એમ સમજી લેવામાં આવે છે. આલેખ કરનારાઓનાં મન માં એવો પણ કંઈક અસ્પષ્ટ ખ્યાલ રહેલો લાગે છે કે કાપદાની રૂબ બનેલા દૂરદીઓ અને ધર્મની રૂબ બનેલા દૂરદીઓનાં કર્તવ્યોમાં કાંઈક જેદ હોય છે: જાણે બીજા પ્રકારના દૂરદીઓ મીલકતના ખરા હક્કદારો પ્રત્યેનાં કર્તવ્યો ન બતાવે અને જીવે જ મીલકતનો ઉપભોગ કરે તોયે ચાલે! આવા કોઈ જેદ ગાંધીજી સ્વીકારતા નથી. ગાંધીજીને એવી ટેવ નથી કે કોઈ સીદાંતને અમકમાં યુક્તવાનાં સાધનો ન હોય તોયે તેનું પ્રતિપાદન કરે. તેઓ માને છે કે માણસને સુખપુર્વકે નીવોદ માટે અવશ્યક હોય તે સીવાય તે પાછી સવં કબજો બોગવટો બીજા ઓની પરવાનગીથી જ કરી શકાય છે: બલે પછી એ પરવાનગી નીર્ણયતા થી કે અજાનથી અપાઈ હોય. પણ નીર્ણયતા માટે અને તેના જગ્યાએ શિકતિનું ભાન ઉત્પન્ન થાય અને અજાનનું સ્થાન હડાપણ લે તો વધારાની મીલકતનો કબજો કેવળ દૂરદીના નામે જ રહી શકે. એટલે જ નજર તે તે પ્રગતને જળવાન અને જાનવાન કરવાની છે. એ માટે કેવા પ્રકારનું જળ ઉત્પન્ન કરવું ઘટે તેનો વીચાર કરતાં જણાય છે કે જે આપણે એમ કહ્યું છે તેઓ કે જેઓ આંતરે મિલકત વીનાના છે તેમના હાથમાં મીલકત પર અધિકાર આપતાં તેઓ પણ આજના મીલકતવાળા જેવા જ જુલ અમાર ન થાય, તો પ્રગતમાં ઉત્પન્ન કરવાનું એ જળ અર્દાસામ્ય જ હોવું જોઈએ.”

તે વખતે એક યુદ્ધો જે રપટ કર્યો નહોતા. કારણ કે મને પોતાને જ તેની રપટના નહોતા. તે આ:

દૂરટ તરીકે ગણાતી મીલકતનો હક્કદાર મલિક તથા તેના ઉપભોગમાં હિદાદાર કોણ? આવા દૂરટમાં કેવા પ્રકારની મીલકતનો સમાવેશ થાય? તથા ગાંધીજીની દૃષ્ટિએ ખાનગી મીલકતનો પ્રકાર અને પ્રમાણ કેવા હોય?

આ સમજવવા હું અહીં પ્રયત્ન કરું છું. ટ્રસ્ટીપણીનો સીદ્ધાંત ખાનગી અને બીજાખાનગી મીલકતનો બેદ કરતો નથી. આદે તેના કબજામાં, આદે તે પ્રકારની આદે આદે તેના પ્રમાણમાં હોય, પદાર્થમાત્ર ટ્રસ્ટ મીલકત છે. એટલું જ નહીં પણ એમાં સ્થળ મીલકત, અને સુક્રમ (આજે સ્થળ રૂપે ન દેખાતી) મીલકતનો પણ બેદ કરવાનો નથી; તેમ જ મીલકત નહીં પરંતુ અધિકારનાં સ્થાન તમા હકશાહ એા મચ્છરની- શારીરિક શક્તિ કે હેલન કેવર જેવી આંધળી અને યુગી- બહેલી વાઈની છુદ્ધિચાતુરી પણ તેમને મળેલાં ટ્રસ્ટ જ કહેવાય. કોષ્ટ અપંગ- આક્રમમાં સાવ હામયુગ વીનાનો માણસ હોય પણ તેનામંથિ કંઈક નીચંત્રણ શક્તિ હોય તે તેવોય એ ટ્રસ્ટી જ ગણાય. ટુંકામાં, પાગલ ન યદ ગણેલા માણસમાં જે કંઈ પોતાને અધીન રહેવાની શક્તિ હોય તે સૌનો તે કેવળ એક ટ્રસ્ટી તરીકે કબજેદાર તથા વહીવટદાર છે.

હારે એ બધાનો માલીક કોણ? ગાંધીજી કહે છે—ધર. આ સર્વ જમત ધરરતું જ છે અને જે કાંઈ તેમાં સ્થળ સુક્રમ કે સજીવ, નીજીવ તરત્તો છે તે સર્વ કાંઈ તેનાં જ છે. ઘા. ત. એક કારખાનું હોય તો તેના શેરહોલ્ડરો, ડીરેક્ટરો, મેનેજીંગ એજન્ટો, વૈજ્ઞાનીકો કે મચ્છરોમાંથી કોષ્ટ એક વર્ગ કે બધા મળાનેયે તેના માલીકો છે એમ ન કહેવાય. અને પુદ સરકાર પણ એની માલીક છે એમ ન કહેવાય. એ કારખાનું મદાવવા માટે તે બધા ફાળો બનનારા જ છે; અને કારખાનું સારી રીતે ચાલે તે માટે જીવી જીવી બનતોના ફાળો આપનારાઓ તે જીવ્યાં જીવ્યાં કરત્ત્વો અને તેને અંગે અધિકારી ધરાવનારા ગણાય. દરેક પોતાનાં કરત્ત્વો પ્રામાણિકપણે જનવવાં જોઈએ અને પોતાના ઉપયોગ માટે જેટલું વાળ્યો હોય તેટલું જ મહેનતાણું લેવું જોઈએ.

જગતના સૌ કંઈ પર ધરરતું જ સ્વામીત્વ છે, કોષ્ટ મનુષ્ય કે સમગ્ર માનવજાત પણ કશાની માલીક નથી એ સીદ્ધાંત શેરહોલ્ડરો, મેનેજરો, નીજીવો કે નશાના પ્રમાણમાં ડિવિડન્ડ, કમીશન, બોનસ વગેરે મેળવવાના દાવાઓ રદ કરે છે. બનવાને મનુષ્ય તે માટે દુનીયા સરજી છે અને તેને સર્વે ચરાચર ઉપર અધિકાર બધો છે. એ સીદ્ધાંત માન્ય કરી શકાય એવો નથી. જે કાંઈ પોતાને મળ્યું હોય તેનો એ કરકસરથી જ ઉપયોગ કરવા અને પોતાને દરેક કામનો હિસાબ આપવા બંધાયેલો છે. પોતા ની સર્વ આવક, મેડખતા, શક્તિ વગેરેના કારખાનાને લાભ આપનાર (જે જરૂર હોય તે) તે તેમાંથી પોતા

નું મહેનતાણું લે; પણ તે મહેનતાણું તેની જરૂરીયાત જેટલું જ હોય શકે, તેના કામની કે જીવિકાની કોમતાના પ્રમાણમાં નહીં. ઘા. ત. જે એક હાંડો ચોટીદાર માન એક ધાંડા પર બેસી કારખાનામાંથી જતાઆવતા માકને તપાસી લેવા જેટલું જ કરી શકતો હોય, અને તે ફરજ તે પરાખર પંતથી બનવતો હોય તે તે પુરે સામાન્ય મહેનતાણું લેવાને અને તે ઉપરાંત તેની અખંતાને લીધે કંઈક વધારેની જરૂર રહેતી હોય તો તે મેળવવાને પણ પાત્ર સામાન્ય મહેનતાણું જ લઈ શકે. વળા, મેનેજીંગ એજન્ટ તે કોષ્ટ બીજી જગતનાં કામમાંથી કે બીજીથી મહેનતાણું મળતું હોય તો તે કંઈયે આ કામ માટે ન લે એમ બની શકે. પૈસાના રૂપમાં મળતા લાભ કે મહેનતાણા પરથી કોષ્ટ પણ માણ્યમની કોમિત કે કુશળતાનું માપ કાઢી શકાય નહીં.

વળા, ધર જ સૌનો માલીક છે એ સીદ્ધાંતથી દરે છે કે સરકાર, ડિરેક્ટરો કે મચ્છરો કોષ્ટનેયે સ્નેહપણે તે મીલકતનો નાશ કરવાનો અધિકાર નથી. "અમારી મીલકતનું અને આદી એ તે કરીએ" એ ઘાવને માટે અવકાશ જ નથી.

(વીપયાતર છતાં અહીં કહી દઈ તે અયોગ્ય નથી કે નૈતિક ક્ષેત્રમાં આજકાલ જે વાદ રજી કરવામાં આવે છે કે વીપયત્તિ એ સ્વીપરવા પોતાના શરીરના ઉપયોગની અંગત વ્યાપત છે, તેનો આ સીદ્ધાંતથી નીપેધ યાવ છે. મનુષ્યને મળેલી કોષ્ટ પણ શક્તિ તેની અંગત વસ્તુ નથી. જેમ કોષ્ટ સચકતા માણસ મહેનત કરવાનો ઇન્કાર ન કરી શકે, તેમ તે પોતાની શરીર, જીવિકા કે ઇન્દ્રિયાની શક્તિ વેડી નોખવાનો પણ અધિકાર રજી કરી ન શકે.)

માલિકીકરના આ ખુલાસા પછી ત્રીજો પ્રશ્ન ઉદે છે કે તો પછી આ બધી નીલકતા હિતદારો કોણ છે? એનો અભય એ કે, આવી સીદ્ધાંત એટલે કે, ઘાખલા તરીકે, એક કારખા નાના નશાના હકદારો એને ચલાવવા માં ફાળો આપનારા જ છે એમ ન કહેવાય. પણ દરેક વસ્તુનો સૌની સાથે મળાને જ ઉપયોગ કરી શકાય. અને તેમાં મનુષ્ય સીવાયના જીવેને પણ કુશામ નહીં.

એમ તો થશે કે મનુષ્યની દૃષ્ટિની મર્પોદાના પ્રમાણમાં જ આ સીદ્ધાંતનો અમલ થશે. પહેલાં તો એ સ્થાનીક ક્ષેત્રમાં જ લાયક કરાશે; ત્યાં પણ માણસ બીજા જીવો કરતાં માણસજાત ને પહેલી પસંદગી આપશે. પણ જેમ જેમ એની દૃષ્ટિ અને સાધનો તથા સાથે લાગવળ એ જશે તેમ તેમ તેના અમલનું ક્ષેત્ર વધારતું એ એની ફરજ છે; અને એ જ્યાં સુધી વધારી

શકાય ત્યાં સુધી વધારતું છે. કોષ્ટ પુરેપુરા સ્વાવલંબી અને સર્વપુણ્ય ગામડાનેયે, જે જમતના કોષ્ટ બીજા બાગમાં જીવેને હાડમારી હોય તે, પોતાની સર્વ પેદાશ પોતે જ વાપરી ખાવાનો હક નથી. અને જે તે પીડિત માણસો- પાસે આ ગામડાને ઉપયોગી યાવ એવું કહ્યું ન હોય, અથવા કહ્યું આપવાની શક્તિ જ ન હોય, તે તેનાથી પોતાની ઝીજ માટે કશી કોમિત પણ માગી શકાય નહીં.

મનુષ્યની ખાનગી મીલકત ક્યાં પ્રકારની અને કેટલી હોય શકે તેનો જવાબ આપવો હવે સહેલો છે. કામ કરનારા તરીકે જે તેને માટે સામાન્ય નીચમોથી કોષ્ટ હોય અને તેની એને જરૂર પણ હોય, તે તેને તે વીવેકપુર્વકે ઉપયોગ કરી શકે. પણ જે કોષ્ટ પણ કારણસર તેની એને જરૂર ન હોય, અને નજીકના બંધુબંધાં જરૂર પડે એમ ન હોય, તો જેને તેની જરૂર હોય તેને આપી દેવું જોઈએ, અથવા પોતાના ક્ષેત્રના સામાન્ય નીધો માં જમા કરાવી દેવું જોઈએ.

વળા આ સીદ્ધાંતને સમજ્યા પછી ગાંધીજી એક વાણ્યથી જીવીન, કમવા ન વગેરેને પુચ્ચવી લેવાની ઝીવેને તથા બીજી વાણ્યથી તેનો બદલો આપવાની નીતીનેયે કેમ વીરધ કરતા હતા તે સમજવું કઠણ નથી. જે કાલના જીવીનદારો, જીવોખપજીઓ વગેરે ટ્રસ્ટીપણીનો સીદ્ધાંત સ્વીકરતા હોય અને તે તરીકેની ફરજને જાણ જનવવા તેમાર હોય તે તેમની પાસે થી કબજેને કે વહીવટ પુચ્ચવી લેવાની આવસ્થકતાયે નથી અને વાળ્યો પણ નથી. આ સીદ્ધાંતનો તેમની પાસે સ્વીકાર કરાવવા પહેલો પ્રયત્ન જોઈએ, બદલો આપવાની સુચના એટલા માટે પરાખર નથી કે કરવેને કોષ્ટ ટ્રસ્ટીને દુર કરવામાં આવે તે તેને બદલો આપવાનો કાપડો નથી. જે તેઓ ટ્રસ્ટીનાં કરત્ત્વો બજાવવા નાખુસ હોય અને માલિકદાવો જ રજી કરતા હોય, તો તે ઘાવો સ્વીકારી શકાય જેવો ન હોવાથી, એમને હટાવી નવી બચવથા કરવી એની જોગ જ આવસ્થક યાવ છે. એટલે બધાનો પ્રશ્ન જ ઉઠતો નથી.

કીશોરલાલ મશાવવાળા.

હિંદનો પત્ર

(અમારા ખાસ અખરપત્રી તરફથી)

વડોદરા, તા. ૧૬-૪-૫૦

કરારનાં "સુક્રમ"

જા રતના વડા પ્રધાન પંડિત નેહરુ એ પાકિસ્તાનમાં કહ્યું કે "ભારત પાકિસ્તાન કરારને છેલ્લા અખિયાર દીવસના ટુંકા ગાળામાં મળેલી સીદ્ધિ સંતોષકારક છે." પંડિત નેહરુએ હાંપનાં વચ્ચે બહારે કહ્યું હતું કે તેમણે પાકિસ્તાનના વડા પ્રધાનનું આમંત્રણ સ્વીકાર્યું છે અને ૨૬ મી એપ્રિલ વધુ મંત્રણાઓ માટે તેઓ કરાંચીની બે દીવસની સુલાકાત જનાર છે. પંડિત નેહરુએ વધુમાં કહ્યું કે "નામય વડા પ્રધાન સરદાર પટેલ, કરારના સંપુર્ણ અમલકાર્યમાં પશ્ચિમ બંગાળની સરકાર સાથે સહકાર કરવા ના હેતુથી અને સામાન્ય સ્થિતિની પુનર્યાપના કરવા માટે જન્દ સરકાર તરફથી કલકત્તા ગયા છે. અને તેમની સુલાકાતનું અમાર સુધીમાં 'સાંઈ ઘળ' આવ્યું છે." તેમણે કહ્યું હતું કે "દોહલી કરાર પર સહીઓ થઈ હતી ત્યારબાદ ભારત સરકારે તરત જ કરારના અમલ માટે પગલાં લેવાં શરૂ કર્યાં હતાં. પશ્ચિમ બંગાળ અને આસામ, જેમને ખાસ કરીને કરારો સાથે લાગવળ છે, તેમને કરારના અમલ માટે વીનંતી કરવામાં આવી હતી." તે ઉપરાંત બીજાં બધું

રાજ્યોના પંત પ્રધાનો અને મીઠ કમીશનરોને પણ પંડિત નેહરુએ કરાર ના અમલ માટે અપીલ કરી હતી અને તેમનો સહકાર માગ્યો હતો.

ગઇ તા. ૧૦ મી એપ્રિલે નાણું-કચેરીએ કરાર પ્રમુખે આપકરી સત્તાવાળાકોને જકાતી નીચંત્રણે બળમાં બનાવવાની, હીજરતીએને કોષ્ટપણ પ્રકારનો ત્રાસ ન થાય તે ભલામી અને તેમના પ્રયે નમરતાઇબંધી વર્તણે રાખવાની સુચના કરી હતી. કેલ્યાં જકાતી યાણું પર સંપક અધિકારીની નીમણુંક થઈ છે અને બીજાં મુખો પર અધીકારીઓને નીમણુંકની વીમારણ થઈ રહી છે. પાકિસ્તાન સરકારે પણ આપકારી અધીકારીઓને હિજરતી એ પુરતાં જકાતી નીચંત્રણે બળમાં બનાવવાની સુચના આપી હોવાના તથા આ સુચનાનો બંજ કરનાર સામે કડક પગલાં લેવાની ચેતવણી અધિકારી ઓને આપી હોવાનાં સમાચાર ખાંપ યાવ છે. પાકિસ્તાન સરકારે એમ પણ જણાવ્યું છે કે, જીવ્યાં નીમણે તજે આપકારી અધિકારીઓને જાત લાખતાજનવતા માલીકને પાછો આપવા માં આવશે.

“ભારત તથા પાકીસ્તાનના અખ- બારીબચને કરારના અખલમાં સંપૂર્ણ સહાવ આપવાને નીધોર રૂપરૂપ છે અદકત કષો છે, અને તેમના તથા પાકીસ્તાન વચ્ચેના પ્રશ્નો પ્રત્યેના સામાન્ય વલણમાં ઘણો પકડો થયો છે. આવતી મેની શરૂઆતમાં અખિલ ભારત તંત્રી પરીપદની સંયુક્ત બેઠક દીલ્હી ખાતે મોહાવવાની વીચારણા છે. સંધિ તંત્રી પરીપદે બંને દેશો વચ્ચે શુભનીષ્ઠા અને મીઠાશ પુનરચા- પીત કરવા સહક્રમ વાતાવરણ પેદા કરવાના ઇરાદાથી બનાવેલા અદેવાલ રચુ કરવાની ટીકા કે અભિપ્રાય આ- પવાની અને સમાચારોની રહુચ્યાતની બાબતમાં અખબારોની નીચી મોઝે માર્ગદર્શનરૂપ યદ પડે એવી યોજના ધરી છે. એક દેશમાંથી બીજા દેશમાં જતા હિન્દુસ્તાની સંખ્યામાં સારો ભેગો ઘટાડો થયો છે. પશ્ચિમ બંગાળ થી પુર્વ પાકીસ્તાન જતા મુસ્લિમ હિન્દુસ્તાની સંખ્યા દીવસના ૧૦,૦૦૦ ની હતી. હવે એ સંખ્યા ૧૨,૦૦૦ સુધી નીચે ઉતરી છે. ભારત ના બીજા વીભાગોમાંથી પશ્ચિમ પા- કીસ્તાન બહુ મુસ્લિમોની હિન્દુસ્ત અલગ બંધ થયું છે. પુર્વ બંગાળ આજના હાલ હિન્દુસ્તાની સંખ્યા દીવસના ૨૦,૦૦૦ સુધી પહોંચી હતી, હવે આ સંખ્યા ૯૦૦૦ થી ૧૧,૦૦૦ પર આવી છે.”

કલકત્તામાં સરદાર

નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભ ખાઇ પહેલે કલકત્તામાં કોંગ્રેસ કાર્યકરો ની સભામાં સંબોધન કરતાં પુર્વ બંગાળમાંથી તાજેતરમાં આવી આવેલા કોંગ્રેસ કાર્યકરોને પોતાના પ્રદેશમાં પાછા જવાનો અને ત્યાંની લઘુમતી કોમમાં વીશ્વાસ ઉત્પન્ન કરવાનાં કાર્ય માં સહાયતા યતનો અનુરોધ કર્યો હતો. આ સભા સરકારી મહેલમાં મળી હતી, અને તેમાં બસો જેટલા કોંગ્રેસ કાર્યકરોની હાજરી હતી. હાજર રહેલાઓમાં પશ્ચિમ બંગાળ પ્રાંતીક સમીતીના અને જ્યુદી જ્યુદી હલ્લા કોંગ્રેસ સમીતીઓના પ્રમુખો અને મંત્રીઓ પણ હતા.

સરદારે કોંગ્રેસ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે ભારત—પાકીસ્તાન સમજુતીના અમલ માટે પુર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ બંને ખાતેથી લઘુમતીઓની હિન્દુસ્તાની સંયુક્ત બેઠકો. એમ ન યદ શકે તો જે જે માટે દીલ્હીના કરાર કરવામાં આજ્યા છે તે જેટું નીપજી જશે. સર- દારશીએ લઘુમાં તેમને પુર્વ બંગાળ ખાતે આવેલા નીરાશ્રીતોના સંપર્ક સાધી તેમને પાછા પુર્વ બંગાળ ખાતે જવાનું સમજાવવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે, “પુર્વ બંગાળની સરકાર, દીલ્હીના કરાર અનુસાર તેમને જરૂરી રક્ષણ આપવા

ની ખાત્રી આપશે એવી તેમને ખત્રી છે સરદારશીએ ભારતમાં પણ આ સમજુતીના પુરેપુરા અમલ થયેલો બનેવાને ભારત સરકાર મક્કમ નીરધાર ધરાવે છે તેમ પણ જણાવ્યું હતું.”

અખબારોનો ફાળો

અખિલ હાંદે તંત્રી પરીપદના પ્રમુખ શ્રી. સી. આર. ધીનીવાસને છાપાનેંગ બહાર પાડેલ એક નીવેદનમાં જણાવ્યું છે કે “અખિલ હાંદે તંત્રી પરીપદ તેમજ પાકીસ્તાન તંત્રી પરીપદની ખરી સમીતીઓની એક સંયુક્ત બેઠક ને માસની તા. ૪ થી અને પગીએ નવી દીલ્હી ખાતે મળશે. આ બેઠકમાં અમલના સુદાઓની વીચારણા ચલાવવા ની હોશ અખિલ હાંદે તંત્રી પરીપદની ખરી સમીતીના તમામ સભ્યોને અચુક હાજર રહેવા હું વીનતી કરું છું. તેમ જ ભારત અને પાકીસ્તાન વચ્ચે શુભ લાગણીભર્યાં સંબંધો જળવળી રાખવા માટે પોતાના કામતી ફાળો આપવા દેશના તમામ અખબારોને અપીલ કરું છું.”

“અત્યાર સુધી પાકીસ્તાન અને ભારતમાંથી જે હેવાલો મળ્યા છે તે ખરે જ આવા કાર્યને ઉત્તેજન આ- પનારો છે. બંને દેશના વડા પ્રધાનો વચ્ચે થયેલા કરારોના પાલન માટે ત્વરીત પગલાં લેવાઈ રહ્યાં છે અને દેખીતાં હાંદિક પરિણામો પણ જણાઈ રહ્યાં છે. રાહદારી સમાધાનથી ઉપરથીત યમેહું મંત્રીનું વાતાવરણ બંને રાજ્યોમાં ફેલાઈ ગયું છે, તેમ જ યોગ્ય વાતાવરણના સર્જન માટે પાકીસ્તાનના વર્તમાનપત્રોએ કરારને સદળ બનાવવા સહકાર આપવાની ખાત્રી આપી છે. તેથી મને ખરે જ આનંદ થયો છે. બંને દેશોમાં વીશ્વાસ હું વાતાવરણ સર્જવાં તેમજ ફરી પાછા મૈત્રીભર્યાં સંબંધો બાંધવા માટે સરકારના પ્રયત્નોને સહકાર આપવા વડા પ્રધાને એ અપીલ કરી છે તેને ભારતના વર્તમાનપત્રોએ તો યોગ્ય જવાબ વાળ્યો છે.”

ભારતનો નીરધાર

“પાકીસ્તાન નેહર લીલાકત કરાર નો અમલ કરે કે, ન કરે તો પણ ભારતે તો તેનો અમલ કરવાનો નીશ્ચય કર્યો છે, “એમ ઉત્તર પ્રદેશના પંત પ્રધાન પંડીત ગોવિંદ વલ્લભ પંતે આ- નેરોજ ઉદ્ડું પત્રકારો સમક્ષ જણાવ્યું હતું. પંડીત પંતે કહ્યું કે, “જો આપણે પ્રમાણિકપણે અને સત્યાહતપુર્વકે કરારનો અમલ કરીશું અને પાકીસ્તાન નહાં કરે તો પાકીસ્તાને તેમ કરવા ની ફરજ પાડવાનું આપણું પગલું નીતિક દ્રષ્ટિએ આપ પુરુસર અણસરે. પરંતુ તેને અપણું જ આપણી ફરજ માંથી મ્યત થાયજું તો પાકીસ્તાનની ટીકા કેવી રીતે કરી શકીશું ?” પંતે આજના પુર્વ બંગાળના બનાવોને

પરીણામે રાજ્યના પશ્ચિમ હલ્લામાં બનેલા બનાવોને ઉલ્લેખ કરી રાજ્ય નું બીજા મઝહબી પણું જળવી રાખવા નો તેમનો દંદ નીશ્ચય અદકત કષો હતો. તેમણે કહ્યું કે, “બીજામઝહબી લોકશાહી એ આપણો અધર નીશ્ચય છે પાકીસ્તાનમાં ગમે તે બને તો પણ આપણે આપણા માર્ગથી ચલતી યથુ નહાં” પંડીત પંતે હાલની ઘડીએ અખબારો જાહેરમત ઘડતાં

વડા પ્રધાન શ્રી. ટેબરે આપેલું આજ્ઞાસન

“આજે આખી દુનિયા કટોકટીમાં થી પસાર યદ રહી છે. આપણા ભારતમાં કામીબર અને બંગાળ ની પરિસ્થિતિ વીકટ છે. આજનું પાકીસ્તાની વલણ આપણને યુજબ ચીંતા ઉપજાવી રહ્યું છે. પાડ માને પ્રશ્નોને કે સૌરાષ્ટ્રમાંથી પાકીસ્તાને વીદ્યા લીધી છે, પરંતુ એ વીદાય ક્રેમ આરજી હકુમતને કારણે યદ છે એમ માનવું કે કહેવું ખોટું છે. એ વાત કહેવી એ હાંદેને મોટો ધોષો આપશે.” સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી. ટેબરભાઇએ, તેમના ગોધીલવાડના પ્રવાસ દરમીયાન બાવનગરમાં પ્રવચન કરતા અર્ધ સાંજે ઉપરોક્ત શબ્દો ઉચ્ચાર્યાં હતાં.

“નવા તંત્રીની સુઠર ઉપારત સજા તાં સુધી હાલની ઝુંપડીને આજ આંધરો ના”

ગઈ કાલે શ્રી. ટેબરભાઇ અને આવી પહેલંચતા તેમનું બન્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સાંજે આજાદ નેદાનમાં તેમનું જાહેર પ્રવચન યોજવામાં આવતા, મુખ્ય પ્રધાનોને સાંભળવા માટે મોટી માનવ નેદની એકઠી યઈ હતી. તેમણે આ પ્રસંગે આગળ મોહતા કહ્યું કે, “આને ક્રેમ માથુસને બીજા માથુસ પર વીશ્વાસ રહ્યો નથી. એટલું જ નહિ પરંતુ આણે તો માનવી પોતાના પડખાણનો પણ વીશ્વાસ કરી શકતો નથી. ગઈ કાલે જેઓ મીત્રા હતા—એકબીજાને માટે પ્રાણ પાથરવા તૈયાર હતા તે હજારનન મિત્રા આજે ક્યારે ફુરમન બની ગેસરી, ક્યારે મથાંદાના વાડા તોડશે તે આજે કહેવું મુશ્કેલ છે”

“મહિનાઓ બાદ હું અહાં આણું છું હારે તંત્ર અને પ્રજા વચ્ચે શું શું ઉણપો છે તથા શું શું સુરક્ષકોએ તે બેનાવાની મેં કોશીશ કરી છે. હું જાણું છું કે સૌરાષ્ટ્રની પ્રજાના સનમાં અમને મદદતરો પ્રશ્ન તંત્રના ધાળાઈ રહ્યો છે. પ્રજા તરફથી તે સહાય અને સહકાર મળતા જેએએ તે નથી મળતા તેનું કારણ અંકુશો ઉડી બન્ય તે પ્રજાના દેહમાં નવા પ્રકારની આશા જન્મને અને લઘુમાં આજે જે બેએ તે પથ ફર થાય પરંતુ હાલની

કોવાથી તેમની વધી ગયેલી જવાબ- દારીઓની યાદ આપી હતી. જે પ્રજા નો સીદાંતાના પ્રચારકોનો વિરોધ કરવા ની તેમણે મુસ્લિમોને સલાહ આપી હતી. અંતમાં પંડીત પંતે કહ્યું કે, “મુસ્લિમો. પાસેથી વહાદારીની સાખીતી માખતી એ ખોટું છે. હું જાણું છું કે, તેઓ તેમની માતૃ ભૂમીને વહાદાર છે.”

ભારતની અને દુનિયાની પરિસ્થિતિ બેતા અંકુશો ઉડાવવાનું શક્ય નથી. છતાંપણ એક અખતરો કરવા ધાર્યો છે કે જે માગે તેને “બી” વર્ગનું લાઇસન્સ આપવું. એ લાઇસન્સ મુજબ લાઇસન્સ ધરાવનાર માથુસ છ માસ ચાલે તેટલું આજાદ ગમે ત્યાંથી લાવી શકે. આ રીતની વ્યવસ્થાને જો ફુરપોગ નહિ થાય તો બનવથીત રીતે અંકુશો ઉડી જશે.”

આજીદ અંગે બેલતા તેમણે કહ્યું કે, “સો વર્ષમાં પશુ કલ્પના નહાંતી કરી તેવું સુંદર તંત્ર જર્મનીમાં રચાયું હતું. હિટલરે આ આખી પ્રજાને શીસ્ત બદ બનાવી હતી આ દુનિયા સાંગે ઉત્તર મરતકે ઉભી રહે તેવી અર્થરચના પણ કરી હતી. આ જવાન અને ઇટલીની મહત્તા પણ તેવીજ હતી. આજે એ બધા દેશો પોતાની આજીદ જળવી શક્યા નથી. એટલે કે આજીદ સાચવી રાખવાનું કાર્ય ક્રેમ લરકરતું છે તે વાત સાચી નથી. આજીદ તો માત્ર એજ પ્રજા સાચવી શકે કે જેનું ચારિત્ર્ય ઉચું હોય.”

“જુનાગઢની આજીદ ક્રેમ આજી કહુકમતે લીધી તે વાત સાચી નથી. જે હાંદે સરકારનું લકર કાઠીયાવાડમાં ન આવ્યું હોત અને હાંદે સરકારની મનાવરો દીવ પાસનાં દરીયામાં ન ફરતી હોત તો આરજી કહુકમત કેવી રીતે અને ક્યાં રમપાઈ તેનો પહેલેથી છેલ્લે સુધીના હું સાક્ષી છું એટલે આ વાત હું આજે નીશ્ચયાસપુર્વકે કહી શકું છું.”

દુષકાળની આડે

“જુનાગઢ પછી તરતજ સૌરાષ્ટ્રનું એકમ રચાયું અને આપણે રશીર ન થયા ત્યાં તો દુષકાળનું મોઝું ફરી વળ્યું એટલે સૌરાષ્ટ્રનું એકમ રચાતા આર્થીક કટોકટીનો અંત આવશે તેવી પ્રભુએ જે આશા રાખી હતી, તે આશા પુરી યદ શકી નહિ. દુષકાળ ના કારમા ગાળા દરમીયાન આપણુ તંત્રે ધણીજ સારી સેવા બનાવી એટલે જ દુષકાળની એ કારમી મુશ્કેલીબતી પરિસ્થિતિમાંથી આપણે સહીસલામત રીતે પાર ઉતરી શક્યાં.”

અરસા દરમીયાન હું સારાંશમાં ગામડે ગામડે ફરો દતો એ વખતે દુઃખદાયકી બરિલા યામણા ચહેરાઓ એ જોયા છે. આ આકતમંથી પણ આપણે પાર ઉતર્યા."

ખામીભયું તંત્ર

વહીવટી તંત્ર એ જો મોલતા તેમણે જણાવ્યું કે, "એ આપણું તંત્ર મજબુત નહિ હોમ તે તો તંત્ર ધંટી ના પડતી જેમ છાતી પર આવી પડશે અને બધાજ જમીનદોરત પડશે. આપણે સમજવું જોઈએ કે હાલવું તંત્ર એ આઝાદ ભારત વધવું તંત્ર નથી પરંતુ વચગામી છે. આ તંત્રનું સર્જન કોણ જુદીજ પરિસ્થિતિ માં થયું હતું. તે તંત્રનું સર્જન ખીટીય શાહીવાદની ડુકમાં માત્ર કામદો અને બવરયા બળવવા માટે થયું હતું જે માત્ર ચહેરાંજ થયું હતું અને ગામડાં માં કે જ્યાં ૮૦ ટકા વસ્તી છે ત્યાં સુધી પહોંચ્યું ન હતું. આજે આપણે એ તંત્રને ફર કરીએ તો આપણી પાસે બીજું કંઈ તંત્ર છે? પંડીત જવાહરલાલજી અને સરદારસાહેબ અને સહુ પ્રાન્તના પ્રધાનોએ નકકર સત્ય સમજે છે કે જે તંત્ર ચાલીશ કરોડની વસ્તી સુધી પહોંચે નહિ તે કદી પણ સફળ થાય નહિ. એવું તંત્ર ન સર્જાય ત્યાં સુધી જે કાંઈ શોધવળું જ્યું છે તેને બચાવી લેવું એ ઇચ્છાનાજ છે."

"આપણે સુંદર મકાનો ન બાંધી શકાયે તેાં સુધી હાલના તંત્ર રૂપી ઝુંપડીને ચીનગારી મુકી દેવી એ વાહીયાત છે. હું તંત્રની બહુજ પ્રશંસા કરું છું એ તંત્રને બહેકાવવા માટે કહું છું તેમ માનતી નહિ પરંતુ હું ઇચ્છું છું તેમ પરિસ્થિતિને જોઈ જીજ્ઞાસી વીચાર કરી."

સેવાની કદર કરો

હાલના તંત્રને વખોટી ક્રાંતનારા દીકાકારોને રદીયો આપતા તેમણે કહ્યું કે, "એ સહેલું અનાજ ખવરાવીયે છોએ તેવી દીકા કરવાન હરકોઈ માનવી તૈયાર છે. પરંતુ કોઈપણ માણસ આગળ આવીને એમ કેમ કહેવો નથી કે અનાજ મેળવી આપવામાં હું મદદ કરીશ. દુષ્કાળના કારણે ગાળામાં પણ સોરાઇનું પશુપન બચી ગયું, એક પણ માણસ મર્યો નહિ તેનો મથ કોને શોધે જાય છે? એ તંત્રને એટલે કે અમલદારોને દાણે જાય છે." કારણ કે એ લોકો સી. પી. અને દક્ષિણના પ્રદેશોમાં ઘાસ ખરીદવા ગયા હતા. આપણે જો એવા તંત્રની કદર નહિ કરીયે તો આપણે ન્યાયી નહિ મજાણીએ, જે પ્રખ્ પોતાના વફાદાર સેવકોની કદર કરી શકતી નથી તે પ્રજા કોઈ પણ દીવસ વફાદાર સેવકો પ્રાપ્ત કરી શકતી નથી. આપણા પ્રધાનો અને અમલદારો એ રીતે આજે ન્યામની તુળામા તોળાવવા છે.

અંતમાં વહેમાતરમ ગવાયા બાદ સભાનું સાંતીપુર્વક વીસર્જન થયું હતું.

નીવાસિતાનાં પ્રશ્નો

રાત્રે ન્યુ હોલમાં થી. ડેખરભાઇ એ કલેક્ટરની હાજરીમાં, નીવાસિતાની મુશ્કેલીઓ સાંભળી, નીવાસિતાનાં ફેટલાક પ્રશ્નોની પતાવટ કરી હતી. શ્રી. ડેખરભાઇની બાવનગરની આ મુલાકાત દરમીયાન ફેટલાક ગામડાંના ખેડૂતો પણ પોતાની મુશ્કેલીઓ રજૂ કરવા આવ્યા હતા, જેમની ફરીયાદો સાંભળ્યા બાદ ઘટવું કરવાનું આધાસન આપ્યું હતું. તા. ૬ઠીએ શ્રી. ડેખરભાઇ કલેક્ટરની સાથે ગોહીલવાડના વળા, સોનગઢ, ચમારડી, જોરાગઢ, શીહોર અને આસવાસના પ્રદેશની જનતાના સુખદુઃખ સાંભળવા ઉપડી ગયા હતાં.

મરણ

ડરખનના સોમાભાઇ ગોર્વીદજી જેઓ, જોહાનીસખગં, દરવા ગયા હતાં, એમનું, એકાગીક હૃદય બંધ પડી જવાથી. એ. શનિવારે તા. ૨૬ એપ્રિલ ના બપોરે એ વાગે જોહાનીસખગંમાં અવસાન થઈ ગયું. મી. ઇ. ગોર્વીદજી અને મી. રજીડોબાઇ રામભાઇ પટેલ, જોહાનીસખગંમાં જે મીરાંએ, સ્વ. સોમાભાઇ ગોર્વીદજીની અન્તિમ ક્રીયાં મદદ આપી હતી, એમને એમનો આભાર દર્શાવવા ઇચ્છે છે.

આભાર

મારા વહાલા પુત્ર વિનોદરાયનાં દુઃખદ અવસાનની સ્મશાન યાત્રામાં આવીને તેમજ દિવેજી બંધુઓ તરફ થી તાર, લેહીશિન કારા, તેમજ રૂબરૂમાં પધારીને દિલસોજી પ્રદર્શિત કરી હતી, તેમજ ધી સુરત હીંદુ એજ્યુકેશનલ સોસાયટીએ શાળા બંધ કરી, મારા પ્રત્યે જે હમદર્દી બનાવી હતી. તે સર્વે બાઇઓ તેમજ બહેનોનો આ પત્ર કારા અંત કરણ પુર્વક ઉડા આભાર માનું છું.

લી.—ઉકાભાઇ ડાબાબાઇ હેડ માસ્તર ધી સુરત એજ્યુકેશનલ સોસાયટી. ડરખન.

આશ્રમ બજાનાવહી

ગાંધીજીના આશ્રમમાં ગવાતા સુંદર બજાનો સમઢ થી. ૧-૩

૨૦૦૬ નું પંચાગ

ચુવરાતી પ્રેસ ના મોટા નવા વર્ધનાં પંચાગ કીમત. ૩/૬

શ્રી. ડાંસવાલ દેગમ પ્રાંતિક પ્રજા પતિ મંડળનું વાર્ષિક સન્મેલન

શ્રી. ડાંસવાલ દેગમ પ્રાંતિક પ્રજા પતિ મંડળનું વાર્ષિક સન્મેલન તા. ૨૧-૫-૩૦ ના રવીવારે ૧-૫ વાગે ડાવલ મુકામે શ્રીમાન વલ્લભભાઇ જીવજી જીના મકાનમાં શ્રીમાન ડાબાભાઇ મકનજીના પ્રમુખપદે મળશે, એ પ્રસંગે દરેક સભ્યોને વેળાસર પધારવા વીનંતી છે.

વીપવ વીચારણી ૨૧-૫-૩૦ ના રવીવારે સવારે ૧૦ વાગે એજ સ્થળે મળશે એ પ્રસંગે દરેક સભ્યો એ હાજર રહેવા વીનંતી છે.

ચહેલી મારીક શી અને દાનની રકમો સમેલન પહેલાં મોકલી આપવા વીનંતી છે. કામંકમ.

- (૧) મીનીટ અને મંત્રીનો રીપોટ
- (૨) હીસાબ, (૩) દરાવ, (૪) ચુટવળી,
- (૫) પરચુરણ.

લી. મંત્રી શ્રી. ડાં. ટે. પ્રા. પ્ર. મંડળ, રામભાઇ દરસનજી પી. એ. બોક્સ ૪૫, ડાવલ.

P. O. Box 45, Davol. Tvl.


ગોરા	
સ્વીન્દ્રનાથ ડાંગર ફૂટ સુંદર	નવલકયા,
બે ભાગની કીમત	૧-૩-૦
આરોગ્યની આવી	૧ ૦
અથકાતા વાચરા	મીતી
નારીની	
કલાખી	૭ ૩
અદલા બેલી	૫ ૬

અમારાં નવાં પુસ્તકો

સેતુબંધ	૫ ૦
નિરાલખા	૫ ૦
કચ્છ	૪ ૩
ચતુર સુભય	૩ ૩
નીકેપના	૭ ૦
આપણા ઘર સંસાર	૪ ૩
૩૫ કોપા (બે ભાગ સથે)	૧૩ ૦
હંડે પહોર	૭ ૦
પ્રાચિના	૫ ૦
ગીતા હૃદય	૩ ૦
સુવર્ણ યુગ	૨ ૦
કોપકા સંગ્રહ	૨ ૦
જી જી જી	૩ ૩
રંગ લીલા	૨ ૩
રૂપાબી ગાય	૨ ૬
સંત દેવીદાસ	૨ ૬
બારી બહાર	૩ ૦
બકતરાજ હનુમાન	૨ ૦
તુરજ્ઞાં	૪ ૩
દવાને છેલ્લો ધુટ્ટો	૫ ૦
બળવાન બનો	૨ ૦
મીત હોરી અને જીભ નાટકો	૨ ૩
આપણી કોંગ્રેસ	૫ ૦
ઉત્તરા	૭ ૦
લખના બેષ	૫ ૦
મીએનું આરોગ્ય	૩ ૦
મહાસભાના પ્રયુગો	૩ ૩
મામ વિચારણા	૨ ૦
સરહદ પાર સુભાય	૫ ૦
પુષ્પવાટિકા	૨ ૦
આર્થ ધર્મ નીતિદાર	૨ ૦
પતીમંદીર	૩ ૦
પરકમ્મા	૫ ૩
બહુ યકરી	૭ ૦
ધરતી	૫ ૦
ગીતાજલી	૫ ૦
મુનો સેવક	૩ ૦

"Indian Opinion", P. Bag, Phoenix, Natal.

"ગોલ્ડ સેલ્ડ" ક્વોલિટી



હાઇ-ક્લાસ ડીસલે કાઉન્ટરો અને શો કેસીસ રીફાઇનર કાઉન્ટરો વોલ યુનીટસ, ડીસલે શીટ્સ, શીશ ક્રાપરસ વિ. વિ. નવાં સચિત પ્રેલોગ મામાવો.

એસોસીએટેડ શોપફીટર્સ લીમીટેડ
 ૧૧૧ સાથે એસોસીએટેડ શોપફીટર્સ, (ભામડ, સા. અ. શોપફીટર્સ, લિમિટેડ. જ્યોના હાઈ ક્લાસ ડિસલે કેસિસ બનાવનારાઓ છે અને તેના ઉપર સુવર્ણ માં પ્રેલોગ છે, તેઓ જોડાયેલા છે.
 104 Marshall Street, (Facing Ecom House) Johannesburg
 Phone 35 4211/2 P. O. Box 6501

केटलाक वायवा लायक पुस्तको

शी. नं.	शी. नं.	शी. नं.	शी. नं.
प्रणेता छप	८	बार अध्याय अने भाव'य	५
गोदीनी	८	शान्ति	७
अधुकरविनोबा भावेना अनेक विषयो	८	लावधुय	५
१५२ यजेता प्रथमनेना अ'अद	१	सुप्रसिद्ध लेखक मेघाश्रीनी नेवेले	११
पावन भा. १-२ प्रत्येकनी	८	अपराधी	११
६६३नी पुरायु	५	गुणसंतोषा नय भाग १-२	७
६६३नी सधयरी	५	प्रत्येकनी	७
१३३ना अटका वाता अ'अद	३	तुलसी केशरी सागाळक नववक्या	७
जस्य सुकती	७	आणा लक्ष्या	५
परिधाय	७	नववीक्या भाग. १	३
गोदीनी आयु अने वीळ वाता	८	पुरातन ज्योत	५
वीरनी वाता भा. १-२ सेटनी	११	योडेवा द्वार	८
६६३ना अने वीळ वाता	११	वेवीशाण	८
दिवाळ अ'दिर	१	सोडठ तारा उठेता पाशुी	१०
स्वाभ्याय भा. १-२ (साहित्य)	१	शब्दाशुी	१
(नयना वेपिने अ'अद) सेटनी	११	आहार अने आरोग्य'युत साहित्य	१०
शासनमती वेपिनेना अ'अद	१	आहार अने पोषण	२
साभर सभाद	७	अ'कीम यटोपाध्याय दृढ	७
सोरोडी जवाहीर	७	कृष्ण कांत'द' विव	६
सोरोडी भाषा	१	कंपाल कुंडवा	७
दीराकशुी वातामि	३	अनोरभा	७
दस्य वीळा	१	इशाराशुी	७
काका साहेब कावेलकर दृढ	३	प्रेमाक्षम नेवेव भा. १-२	११
दोहाभाता	१	पम'दी (धुमकेत)	४
इभरुय थाना	५	सोरोडूनी रसधार	४
छपता तडेवादे	५	भाग १ २ ३ ४ ५ ना सेटमां	४
मोतसारी दिवावे	२	विविध रसधाण पीरगती आ सेद	४
कनप्रधालाल सुनरी दृढ	३	नी कीमत	१५
माधु ररते	८	इ'अंतक्यामे नानाबाध गंठ	२
हेने वांठ	८	स'सार (मेघाशुी)	१
प'सशुीक नादके	६	पथासवण' पडी	७
शोभ कर्षाशुी	६	भाय निभाळि (नयवणीयु)	७
स्वभ क'अ	१०	हान्दी	६
नववीक्या	७	सुभाषना सेनानीया	३
रमजुलाल देशाई दृढ	७	सुभाभा यरीर	३
अ'अदी	७	ई'नीराने पजे (नेदर)	५
कीतीन भा १-२	११	ल'अशुी	७
श'धीत इदय अने स'कुंठता	८	वेष्मिना कुव	२
शोभना	८		
स्वर्भाई	७		
गुलाब अने क'दक रमनबाव देशाई	११		
शरद आशु दृढ नेवेले	११	नया पुस्तको	
क'अना	८	इपनाथ :- गावली कांती	८
क'अनाथ	५	नववक्या. कीमत	८/-
जस्य वातामि	२	साधुश्री सुंदर भायशुळ' नेवेले.	१०/-
इला	८	सधासाराशुी सागाळक कांती	१०/-
अनुप'धा	१०	नववक्या	१०/-
अयु'ल'भारती	१५	छुई पा'क्षय :- नण्णीता कांस पीरानीक'तु	५/-
काशीनाथ	५	छपन खीन.	५/-
अ'अनाथ	५	नेडम कथुरी :- श्री वीरानीक'तु	छपन
यरीर'दून	१३	यरीर	६/-
छपी	७	स'सार धर्म. वे. श्रीशौरनाथ	मथर
विशय	७	वावा. डी. ६	०
इमा	८	ससुणी कांती. श्रीशौरनाथ.	५
नवीना	१०	मशयवाला	डी. ५
अ'अदी	७	आयुनी जांभी	३-०
सुनरा	१		
		लेखक काका साहेब	
		आ आदीरेशी गणरी.	
		भाडी छपन कथा	
		ज्याहरबाव नेदर. कीमत २०	

अभारो नवा पुस्तको

परक'मा (मेघाशुीयुत)	६
शादननाजनी स'गावे	५
विद्रोही आत्मा (अलीवखान)	८
माशी भाषिण	७
मातातु छेय (परव'लक)	६
आसातुपीन भा. १ २ सेटनी	१८
मेघ आ'द (कथनकाया)	७
कथा क'अ (मेघ अ'द)	७
भाग १-२-३ सेटनी	१४

राईसोथना पुस्तको

सुप नदी रहवेना (सुभाषनी कांती सागे पोकार) नववक्या	७
द्रष्टि परीवर्तन	५
मे नववक्या	५
सागर कथाया	८
वर्धा शिशु शोभना	२
मेवेरीया (तेना हाखेला अने कथाय)	१
साभर सभाद (लेखक लुवे वन')	१
पहेले पाण	६
मेघ धनुष	६
साल्मा' (गांधी युवनी नेवेले)	६
साल् सन्यासी (धुमकेत)	१०
कथा हागीरीत' शिशु भा. १-२	१
आभांभी लललतना इ'नर शीभवाय	१
छे अयना शीभाय छे. प्रत्येकनी	६
राईसोथ अने शीक्षु	२
कांती व्हेन (वाता)	५

रायशुरा दृढ

इदनी रमजट	५
-----------	---

दात योवडाने दायेरो १ ०
रसभस्ती १ ०

(वावध पुस्तको)

नय ध'डोनेश्रीया	४
दि'डोने कोमी वीकाण	६
रशीयात' पठर	१
लाभिकरेअल भाग १-२ सेटनी	१८
आणकोने पांधव	१
अदवेव देशाधनी डायरी	१
भाग. पहेले	१०
भाग आंते.	१२
भाग नीने	११
आयु-भासीमा (अत गांधी)	१
दीडही डायरी	१०
गांधीय	१०

आणको भाटे

१० थी १२ वर्षना आणको भाटे	८
१३ पुस्तकोने सेट.	८
कीमत पा. १-०-०	
८ थी १० वर्षना आणको भाटे	८
१५ पुस्तकोने सेट	८
कीमत पा. १-५-०	
१२ थी १८ वर्षना युवक युवती भाटे	८
आड सुंदर पुस्तकोने सेट	८
कीमत १४/-	
दीदी	५
वीयु	५
आयु	५

रीपब्लीक न'अर

अभारो ता. २६-१-५० ना गहार
पडेता भारत रीपब्लीक न'अर; अनेक
सहेदाया; इराया; लेजे वीजेर
वायवा लायक सामग्रीची भरपुर छे.
कीमत २/३
पारिजेन साधे

Indian Opinion. P. Bag, Phoenix.

बच्चोंके लीये

महात्मा बुध	१
चन्द्र गुप्त	१
कौशा चला हेसकी जाल	१
नवीस्तकी वहागीण	१
श्रीवाजी	१
अशोक	१
देश प्रेमकी कहानीया	१
ईदा धर्मकीआख्यागीकायें	१
(धर्मकी कहानीया)	१
समाजवाद-धुंजीवाद	१
पंरी राजनेतीक समस्यायें	१२
मेरी कहानी (प. नेदहका चरीत्र)	१०
गांधी विचार दौठन	२

Obtainable From:
'Indian Opinion'
P. Bag,
Phoenix, Natal.



"Tell me,

Doctor . . . if they all kill germs,
how can one antiseptic be safer than another?"

Some antiseptics lose most of their potency in the presence of blood. Some, though very powerful, require very careful diluting to be safe on human tissues. The safe antiseptic for untrained use has high germicidal efficiency even in the presence of blood. It is non-poisonous, does not stain, it is gentle on tissues. These are some of the reasons why


DETTOL
THE MODERN ANTISEPTIC

RECKITT & COLMAN (AFRICA) LTD, P.O. BOX 1097, CAPE TOWN

THESE ARE
THE BLADES
FOR SMOOTHER
SHAVES

Because Minora Blades are made of the finest steel they give you better, smoother shaves. You save more money too, Minora last longer but they only cost 6d for four

Look for them in the Bright Red, White and Yellow packet.



Minora
THE RIGHT BLADE FOR YOUR RAZOR

Three good reasons why you should use Sunbeam

1. It gives a brighter, more pleasing shine.
2. The shine lasts longer on the floor.
3. It makes your home clean, inviting-looking.



Always ask for

SUNBEAM POLISH
FOR FLOORS AND FURNITURE

9d + 1/6

Shines . . . and shines . . . and shines



NUGGET
BOOT POLISH

Obtainable in Black, Military Tan, Light Brown, Dark Brown, Toney Red, Ox Blood, Transparent.

Tel. Add: "Charotar" Telephone: 33-9885.

**MANCHESTER TRADING
CO. LTD.**

ESTABLISHED 1923

Wholesale Soft & Fancy Goods Merchants

Direct Importers.

47, Commissioner Street,
JOHANNESBURG.**LIFE INSURANCE**

Are you adequately insured?

Have you provided for your dependants?

Prepare for the future

Life Insurance gives peace of mind for the unknown future.

Insure with "THE OLD MUTUAL" your friend for Life—

The S.A. Mutual Life Assurance Society, which has best Bonus record in the WORLD.

Representative:—

DAYABHAI PATELP.O. Box 1760,
JOHANNESBURG.Phones:— } Business 33-0711
Residence 33-5961**DIAMONDS****QUERIDO DIAMOND Co.**

48 Walter Wise's Building,

4th Floor Joubert Street, JOHANNESBURG

Tel. 22-3400.

P.O. Box 3417

"SEE US WITHOUT OBLIGATION"

DIAMOND SPECIALISTS**OUR MOTTO: 'A SQUARE DEAL'****SPRINGBOK COLLEGE**P.O. BOX 8243,
JOHANNESBURG.

New and up-to-date courses for Standards VI, VII, J.C., Senior Certificate and Matriculation. Languages, Maths, Science, Physiology, Commerce, History, Geography, Etc, Etc.

**ALL LECTURES DRAWN UP
BY EXPERTS.**

Write To-day For Full Particulars.

**LOOK BEFORE YOU LEAP, BUT LEAP AHEAD
WITH THE SPRINGBOK.**

PHONE 33-7944 P.O. BOX 4889.

TEL. ADDRESS: "ARVIND."

HEAD OFFICE:

409, KRUGER ST., LOUIS TRICHARDT.

PHONE 64. PO BOX 106.

TEL. ADD: "KANJEE."

H. K. GOKAL,

WHOLESALE

GENERAL MERCHANT AND DIRECT IMPORTER.

OUR MOTTO: "SERVICE THAT SATISFIES."

43 Market Street,

JOHANNESBURG.

ફોન ૩૩-૭૯૪૪. બોક્સ ૪૮૮૯.

ટેલીગ્રાફિક એડ્રેસ: "અર્વિન્ડ."

હેડ ઓફીસ:

૪૦૯, ક્રુગર સ્ટ્રીટ, લુઇસ ટ્રીચાર્ડ

ફોન: ૬૪. પી. બો. બોક્સ ૧૦૬

ટેલીગ્રાફિક એડ્રેસ: "કાનજી"

એચ. કે. ગોકળ,

— હોલસેલ વેપારી —

— જનરલ મરચન્ટ અને આયાત કરનાર —

૪૩ મારકેટ સ્ટ્રીટ, જોહાનીસબર્ગ.

BOOKS FOR SALE

MY LIFE AND MISSION—Swami Vivekananda	8	8	INDIA SPEAKING (Various contributions on economic, political, cultural and social problems of modern India)	15	0
INDIAN STATESMEN (Dewans and Prime Ministers With Portraits)	7	6	THE HEART OF HINDUSTAN—Sir S. Radhakrishnan	3	6
INDIAN-JUDGES (Biographical and critical sketches with portraits)	7	0	MAHATMA GANDHI (The Man and his Mission, an enlarged and up to date edition of Gandhiji's life, —By various writers	5	0
TEMPLES, CHURCHES AND MOSQUES —Yakub Hasan	8	6	LIFE OF SRI RAMAKRISHNA	15	0
EMINENT AMERICANS WHOM INDIA SHOULD KNOW—Jabez T. Sunderland	11	0	SHAKESPEARE'S TRAGEDIES (King Lear, Macbeth, Hamlet and Othello—William Miller	3	6
THE KNIGHT ERRANT—Sita Chowdhury	8	6	SOVIET ATTITUDE TOWARDS CHINA Facts and Facts—Stanley Powell	7	6
THE BHAGAVAD GITA—The Lord's Song— (An English Translation)—Annie Besant	1	0	AMONG THE GREAT (Conversation with Romain Rolland, Mahatma Gandhi, Bertrand Russell, Rabindranath Tagore and Sri Aurobindo)—Dilip Kumar Roy	1	5
60 YEARS OF CONGRESS—Dr. Pattabji Sitaramayya	1	3	TWO HISTORICAL TRIALS IN RED FORT —An account of the trial of the Officers of the I.N.A.	19	0
WHAT IS WRONG WITH INDIAN ECONOMIC LIFE? —Dr. V. K. R. V. Rao	8	0	GUIDE TO THE PROBLEM OF INDIA —R. Palme Dutt	6	6
THE U.K.C.C. AND INDIA—A. N. Agarwala	5	6	WHY CRIPPS FAILED (Documented account from the Indian Nationalist point of view)—M. Subrahmanyan	2	6
OUR INDIA (Children's stories by various writers, illustrated) —Minoo Masani	2	6	GANDHI-JINNAH TALKS (Text of Correspondence and other relevant matter)	2	
A DISCIPLINE FOR NON-VIOLENCE (Pamphlet for guidance for Westerners) —Richard B. Gregg	1	0	INDIAN SCIENTISTS (Biographical Sketches An account of their researches, discoveries and inventions	7	6
COTTAGE INDUSTRIES AND THEIR ROLE IN INDIAN ECONOMY—Prof. Rao	2	6	A SHORT LIFE OF SWAMI VIVEKANANDA	2	6
SHAW—WELLS—KEYNES ON STALIN—WELLS TALK (Verbatim Record)	8	6	A SHORT LIFE OF SRI RAMAKRISHNA	2	6
GOLDEN NUMBER OF "INDIAN OPINION", 1914 (Souvenir of the Passive Resistance Movement in S.A., 1906.1914)	4	0	PRACTICE AND PRECEPTS OF JESUS —J. C. Kumarappa	8	6
THE DHAMMAPADA OR THE WAY OF TRUTH	1	3	LIFE AND GOSPEL OF VIVEKANANDA —Romain Rolland	13	6
THE DELIVERANCE (A picture of the palpitating life of the joint family)	8	0	WOMEN AND SOCIAL INJUSTICE—M. K. Gandhi	10	0
MAULANA ABUL KALAM AZAD—Mahadev Desai	6	0	GANDHIJI'S CORRESPONDENCE WITH THE GOVERNMENT (1922-44)—M. K. Gandhi	5	9
SATYAGRAHA IN SOUTH AFRICA—M. K. Gandhi	11	0	THE STORY OF MY EXPERIMENTS WITH TRUTH —M. K. Gandhi	15	0
SEVEN MONTHS WITH MAHATMA GANDHI Being an inside view of the Non-co-operation Movement (1921.22)—Krisnadhas	8	0	CHRISTIAN MISSIONS IN INDIA (Their place in India)—M. K. Gandhi	5	0
ROLLAND AND TAGORE, Letters of two eminent writers	8	6	STORY OF SATARA—Major B. D. Basu, (I.M.S.)	15	0
GANDHIJI AS WE KNOW HIM—Intimate and delightful incidents by various writers	8	0	GANDHI AND GANDHISM (A remarkable study of Gandhi showing the methods and principles, Volumes I and II—B. Pattabji Sitaramayya, both	15	0
PUBLIC FINANCE AND OUR POVERTY —J. C. Kumarappa	3	6	INDIAN CHRISTIANS (Biographical and critical sketches of poets, publicists of the Church)	7	6
TALES OF BENGAL—Santa Chatterjee and Sita Chatterjee	7	0	THE STORY OF BARDOLI—Mahadev Desai	6	0
HISTORY OF THE REIGN OF SHAH ALUM —W. Franklin	7	6	NON-VIOLENCE IN PEACE AND WAR —M. K. Gandhi	17	6
THE LIFE OF RAMAKRISHNA—An exhaustive account of the Master's wonderful life—Romain Rolland	7	6	TALES FROM SANSKRIT DRAMATISTS (The famous plays of Bhasa, Sudraka, Kalidasa, Sri Harsha, Bhavabhuti and Visakhadatta)	5	0
INDIAN STATES' PROBLEM (Gandhiji's Writings and Utterances)—M. K. Gandhi	10	0	INDIAN TALES OF FUN, FOLLY and Folk lore	5	0
FOUNDATIONS OF PEACE (Critical study of the conditions which precipitated two world wars—K. T. Shah	15	0	FAMOUS PARSIS	7	6
BAPU—MY MOTHER—Manubehn Gandhi	2	0			

Obtainable from:

"INDIAN OPINION"

P/Bag, Phoenix, Natal

UNION OF SOUTH AFRICA
GROUP AREAS BILL

SOUTH-AFRICAN-PUBLIC-LIBRARY
9 MAY 1950

To provide for the establishment of group areas, for the control of the acquisition of immovable property and the occupation of land and premises, and for matters incidental thereto.

(Introduced by the MINISTER OF THE INTERIOR.)

BE IT ENACTED by the King's Most Excellent Majesty, the Senate and the House of Assembly of the Union of South Africa, as follows:—

1. In this Act, unless the context otherwise indicates—

- (i) "acquire" in relation to immovable property, means to become the owner of such property in any manner whatsoever; (xix)
- (ii) "board" means the Land Tenure Advisory Board established by section *twenty-four* (xvii)
- (iii) "company" includes any private company, any company referred to in section *sixteen* and any foreign company as defined in section *two hundred and twenty-nine* of the Companies Act, 1926 (Act No. 46 of 1926); (viii)
- (iv) "controlled area" means any area which is not a group area or a scheduled native area, location, native village, coloured persons settlement, mission station or communal reserve referred to in paragraph (c) of sub-section (3) of section *three*, and includes, except for the purposes of section *ten*, any specified area referred to in section *eleven*: Provided that any group area which is not in terms of a proclamation under paragraph (a) of sub-section (1) of section *three* a group area for occupation, shall form part of the controlled area for the purposes of the provisions of this Act relating to the occupation of land or premises in the controlled area, and that any group area which is not in terms of a proclamation under paragraph (b) of the said sub-section a group area for ownership, shall form part of the controlled area for the purposes of the provisions of this Act relating to the acquisition of immovable property in the controlled area; (i)
- (v) "controlled interest," in relation to any company means—
 - (a) a majority of its shares; or
 - (b) shares representing more than half its share capital; or
 - (c) shares of a value in excess of half the aggregate value of all its shares; or
 - (d) shares entitling the holders thereof to more than half its profits or assets; or
 - (e) shares entitling the holders thereof to a majority or preponderance of votes; or
 - (f) any claim arising from a loan, for an amount in excess of half its share capital, or debentures for such an amount; or
 - (g) the power to exercise, directly or indirectly, by holding any interest, whether or not of the nature referred to in paragraphs (a) to (f) and including (f) in any other company, or otherwise, any control whatsoever over the activities or assets of the company; (ii)
- (vi) "disqualified company", in relation to immovable property, land or premises, means a company wherein a controlling interest is held or deemed to be held by or on behalf or in the interest of a person who is a disqualified person in relation to such property, land or premises; (x)
- (vii) "disqualified person", in relation to immovable property, land or premises in any group area, means a person who is not a member of the group specified in the relevant proclamation under section *three*, and in relation to any immovable property, land or premises in the controlled area, means a person who is not a member of the same group as the owner of such property, land or premises, or if the owner is a statutory body other than a municipality in the province of the Cape of Good Hope, of the same group as the majority of the members of such body or in the case of any such municipality, of the same group as the majority of the members of the council thereof, or if the owner is a company, of the same group as any person by whom or on whose behalf or in whose interest a controlling interest is held or deemed to be held in such company; (xi)
- (viii) "group" means either the white group, the coloured group or the native group referred to in section *two*, and includes, to the extent required to give effect to any relevant proclamation under sub-section (2) of the said section, any group of persons who have under the said section been declared to be a group; (iii)
- (ix) "group area" means any area proclaimed under section *three*; (iv)

"immovable property" includes any real right in immovable property and any right which would upon registration be such a real right and any lease or sub-lease of immovable property (other than a lease or sub-lease of immovable property in an area which is a specified area in terms of section *eleven*), but does not include a mortgage bond over immovable property; (xii)

- (xi) "inspector" means an inspector appointed under section *thirty-one*; (vii)
- (xii) "land" includes any portion of land; (v)
- (xiii) "local authority" means any institution or body contemplated in paragraph (vii) of section *eighty-five* of the South Africa Act, 1909; (xvi)
- (xiv) "marriage" includes a union, recognized as a marriage (whether or not of a monogamous nature) in native law or custom or under the tenets of the religion of either of the parties to the union; (vi)
- (xv) "Minister" means the Minister of the Interior: Provided that in relation to any group area for the native group or for any group defined under sub-section (2) of section *two* consisting of members of the native group, any area which is a reclassified area in terms of the Native Trust and Land Act, 1936 (Act No. 1 of 1936), any area referred to in sub-section (1) of section *eight* of the Natives (Urban Areas) Consolidation Act, 1945 (Act No. 25 of 1945), and to any immovable property, land or premises in any such area, any reference to the Minister in paragraph (b) of sub-section (3) of section *three*, section *six*, sub-section (1) of section *seven*, sections *fourteen*, *twenty*, *twenty-six*, *twenty-seven*, *thirty-two* and *thirty-three*, sub-section (4) of section *thirty-six*, and sub-section (4) of section *thirty-six*, shall be a reference to the Minister of Native Affairs; (ix)
- (xvi) "permit" means a permit issued or deemed to be issued under the relevant provision of section *forty-two*; (xiii)
- (xvii) "person" shall not be limited in its meaning by reason of any special reference to a disqualified person, a disqualified company, a private company, a company referred to in section *sixteen* or a statutory body; (x.)
- (xviii) "premises" includes any room or apartment in a building; (xiv)
- (xix) "statutory body" means any council, board or body established by or under any law (xviii)

2. (1) For the purpose of this Act, there shall be the following groups:—

- (a) a white group, in which shall be included any person who in appearance, obviously is, or who by general acceptance and repute is a white person, other than a person, who although in appearance obviously a white person, is by general acceptance and repute a coloured person, or who is in terms of sub-paragraphs (ii) and (iii) of paragraphs (b) and (c), or of the said sub-paragraphs read with paragraph (c) of this sub-section and paragraph (a) of sub-section (2), a member of any other group;
- (b) a native group, in which shall be included—
 - (i) any person who in fact or by general acceptance and repute is a member of an aboriginal race or tribe of Africa, other than a person who is, in terms of sub-paragraph (ii) or (iii) of paragraph (c) a member of the coloured group;
 - (ii) any person who habitually associates with persons who are in terms of sub-paragraph (i) members of the native group, as a member of any community of such persons, other than a person who is, in terms of sub-paragraph (iii) of paragraph (c) a member of the coloured group; and
 - (iii) any woman to whichever race, tribe or class she may belong, between whom and a person who is in terms of sub-paragraph (i) or (ii) a member of the native group, there exists a marriage or who cohabits with such a person;
- (c) a coloured group in which shall be included—
 - (i) any person who is not a member of the white group or of the native group;
 - (ii) any person who habitually associates with persons who are in terms of sub-paragraph (i) members of the coloured group, as a member of any community of such persons, other than a person who is in terms of sub-paragraph (iii) of paragraph (b), a member of the native group; and
 - (iii) any woman, to whichever race, tribe or class she may belong, between whom and a person who is in terms of sub-paragraph (i) or (ii) a member of the coloured group, there exists a marriage, or who cohabits with such a person; and
- (d) any group of persons which is under sub-section (2) declared to be a group.
 - (2) The Governor-General may by proclamation in the Gazette—
 - (a) define any ethnical, linguistic, cultural or other group of persons who are members either of the native group or of the coloured group; and

- (b) declare the group so defined to be a group for the purposes of this Act or of such provisions thereof as may be specified in the proclamation, and either generally or in respect of one or more group areas, or in respect of the controlled area or of any portion thereof so specified, or both in respect of one or more group areas and of the controlled area or any such portion thereof.
- (3) A proclamation under paragraph (a) of sub-section (2) may provide that only persons who have in accordance with regulation been registered on application, or who have been registered under any other law, as members of the group referred to in the proclamation, shall be members thereof.
- (4) A member of the native group or of the coloured group who is or becomes a member of any group defined under paragraph (a) of sub-section (2) shall, to the extent required to give effect to any proclamation under paragraph (b) of the said sub-section, be deemed not to be a member of the native group or of the coloured group, as the case may be.
3. (1) The Governor-General may, whenever it is deemed expedient, by proclamation in the *Gazette*—
- (a) declare that as from a date specified in the proclamation, which shall be a date not less than one year after the date of the publication thereof, the area defined in the proclamation shall be an area for occupation by members of the group specified therein; or
- (b) declare that, as from a date specified in the proclamation, the area defined in the proclamation shall be an area for ownership by members of the group specified therein.
- (2) Proclamations under paragraphs (a) and (b) of sub-section (1) may be issued also in respect of the same area.
- (3) No proclamation shall be issued under this section—
- (a) except with the prior approval in each case by resolution of both Houses of Parliament: Provided that any such proclamation may be issued without such approval—
- (i) if it is issued before the expiration of a period of five years from the commencement of this Act, in respect of an area in the province of the Cape of Good Hope or of Natal; or
- (ii) if it is issued in respect of an area in the province of the Transvaal for the coloured group or a group defined under sub-section (2) of section two, consisting of members of the coloured group, the whole or the greater part of which consists of an area assigned or set apart, as at the commencement of this Act, under paragraph (d) of section two of Law No. 3 of 1885 of the Transvaal or section ten of the Municipal Amending Ordinance, 1905 (Ordinance No. 17 of 1905) of the Transvaal, or of land described in sub-section (10) of section one hundred and thirty-one of the Precious and Base Metals Act, 1908 (Act No. 35 of 1908) of the Transvaal;
- (b) unless in each case the Minister consulted the Administrator of the province concerned, and in the case of an area for a group other than the white group situated wholly or partly on land which, in terms of any law relating to mining, is proclaimed land or deemed to be proclaimed land, also the Minister of Mines, and in the case of an area situated wholly or partly within a controlled area as defined in section one of the Natural Resources Development Act, 1947 (Act No. 51 of 1947), also the Natural Resources Development Council established by section two of the said Act;
- (c) by which there would be included in any group area the whole or any part of—
- (i) any land situated in an area which is a scheduled-native area or a released area in terms of the Native Trust and Land Act, 1936 (Act No. 18 of 1936);
- (ii) any location, native village or native hostel referred to in section two of the Natives (Urban Areas) Consolidation Act, 1945 (Act No. 25 of 1945), or any area approved for the residence of natives under paragraph (h) of sub-section (2) of section nine of the said Act;
- (iii) a coloured persons settlement as defined in section one of the Coloured Persons Settlement Act, 1946 (Act No. 7 of 1946),
- (iv) any mission station or communal reserve to which the provisions of the Mission Stations and Communal Reserves Act, 1909 (Act No. 29 of 1909) of the Cape of Good Hope, or of the said Act read with section sixteen of the Coloured Mission Stations and Reserves Act, 1949 (Act No. 12 of 1949), apply; or
- (v) any area which is a national park in terms of the National Parks Act, 1926 (Act No. 56 of 1926), or any land which forms part of such a park.
4. (1) As from the date specified in the relevant proclamation under paragraph (a) of sub-section (1) of section three, and notwithstanding anything contained in any special or other statutory provision relating to the occupation of land or premises, no disqualified person shall occupy and no person shall allow any disqualified person to occupy any land or premises in any group area to which the proclamation relates, except under the authority of a permit.
- (2) The provisions of sub-section (1) shall not render it unlawful for any disqualified person to occupy land or premises in any group area—
- (a) as a *bona fide* servant or employee of the State, a statutory body or any person (other than a disqualified company or a company referred to in section sixteen); lawfully occupying the land or premises;
- (b) as a *bona fide* visitor of any person lawfully residing on the land or premises or as a *bona fide* guest in an hotel;
- (c) as a *bona fide* patient in a hospital, nursing home, asylum, or similar institution, or an inmate of a prison, work colony, inebriate home or similar institution; or
- (d) as the husband wife, minor child or dependant of any person (including a servant or employee) lawfully occupying such land or premises: Provided that the provisions of this paragraph shall apply in respect of any group area only if the Governor-General has by proclamation in the *Gazette*, declared them to apply in respect of that group area, and only to the extent and subject to the conditions (if any) which may be specified in the proclamation.
- (3) Any provision in the title deed of any immovable property situate in any group area referred to in sub-section (1) prohibiting or restricting the occupation, or use of such property by persons who are members of the group (or which that area has been established shall lapse as from the date referred to in the said sub-section, and no such provision shall thereafter be inserted in the title deed of any such property.
5. (1) If any group area is in terms of paragraph (b) of sub-section (1) of section three a group area for ownership—
- (a) no disqualified person and no disqualified company shall, on or after the relevant date specified in the proclamation, acquire any immovable property situate within that area, whether or not in pursuance of any agreement or testamentary disposition entered into or made before that date, except under the authority of a permit: Provided that the provisions of this paragraph shall not render unlawful any acquisition of immovable property by a statutory body;
- (b) no disqualified company which is on the said date the holder of any immovable property situate within that area, shall hold that property after the expiration of a period of ten years from the said date, except under the authority of a permit;
- (c) no company which on or after the said date becomes or again becomes a disqualified company, shall hold any immovable property situate within that area which it has on or after the said date acquired otherwise than in pursuance of a permit, except under the authority of a permit;
- (d) any provision in the title deed of any immovable property situate in that area prohibiting or restricting the acquisition of such property by persons who are members of the group for which that area has been established, shall lapse as from the said date, and no such provision shall thereafter be inserted in the title deed of any such property.
- (2) Sub-section (1) shall apply notwithstanding anything contained in any special or other statutory provision relating to the acquisition or holding of immovable property, but the said sub-section shall not affect the application of any statutory provision relating to the acquisition, holding or disposal of any right to prospect for or mine any mineral.
- (3) Any agreement or any provision in a testamentary disposition entered into or made on or after the date referred to in paragraph (a) of sub-section (1), by which any person purports to acquire or hold or would acquire or hold any immovable property in contravention of sub-section (1), shall be null and void.
6. (1) The Minister may by notice in the *Gazette*, establish for any group area (other than an area for the white group), a governing body to be constituted in accordance with regulation.
- (2) Such governing body may consist wholly or mainly of members of the group for which the group area has been established, and shall have such powers and functions as may be prescribed by regulations, and shall exercise its powers and functions, where the group area concerned is wholly or partly within the area of jurisdiction of a local authority, subject to such supervision (if any) by that local authority as may be prescribed by regulation, and where the group area concerned is partly within the area of jurisdiction of one local authority, and partly within the area of jurisdiction of any other local authority or wholly outside the area of jurisdiction of any local authority, subject to such supervision (if any) by a local authority designated by the Minister, as may be so prescribed.
- (3) The establishment of a governing body under this section shall not divest any local authority, in respect of the group area concerned, of any powers or functions not vested in such governing body.
- (4) The Minister shall exercise his powers under this section after consultation with the Administrator of the province concerned.
7. (1) The Minister may if he is of opinion that any area referred to in paragraph (d) of article two of Law No. 3 of 1885 of the Transvaal, or in section ten of the Municipal Amending Ordinance, 1905 (Ordinance No. 17 of 1905) of the Transvaal or any group area (other than an area for the white group) which is situate within the area of jurisdiction of an urban local authority, is not properly administered by that local authority, request the Administrator of the province concerned to cause an enquiry to be held (at which the said local authority shall be afforded an opportunity of being heard) and thereafter the said Administrator may, by notice in writing, call upon such local authority, forthwith to carry out any work defined in the said notice which the said local authority has power to carry out and

which is, in the opinion of the Administrator, necessary for the proper administration of that area, and if such local authority fails to comply with that notice the Administrator may himself cause that work to be carried out and may for that purpose authorize any person to perform any act which the said local authority could lawfully perform.

(2) The Administrator may recover from the local authority concerned any expenditure incurred by him under this section—

- (a) by action in a competent court against the local authority in default; or
- (b) by levying a special rate upon all rateable property within the area-of jurisdiction of the local authority in default; or
- (c) by deducting from any subsidy, grant or other moneys payable out of the Consolidated Revenue Fund or by the Administrator to the local authority in default,

or by all three or any two of such methods of recovery, and the Administrator's certificate shall be proof of the amount due by the local authority under this section, subject to an appeal to the Minister, whose decision shall be final.

8. (1) No person shall, except under the authority of a permit enter into any agreement, whether in his own behalf or on behalf or in the interest of any other person, in terms whereof any disqualified person or any disqualified company acquires or purports to acquire or would acquire any immovable property situate in the controlled area.

(2) Sub-section (1) shall not apply in respect of the acquisition, in accordance with the provisions of the Native Trust and Land Act, 1936 (Act No. 16 of 1936) or of the Natives Urban Areas Consolidation Act, 1945 (Act No. 25 of 1945), of immovable property by or from a native as defined in the said Act.

(3) For the purposes of sub-section (1) a sheriff, deputy-sheriff, messenger of the court, trustee, executor, liquidator, curator or administrator dealing with immovable property in his capacity as such, or any other person dealing with immovable property in a representative capacity, shall be deemed to be acting on behalf or in the interest of the person in whose name the property is registered.

(4) Any agreement entered into in contravention of sub-section (1) shall be null and void.

9. (1) If at the commencement of this Act a company of any group holds immovable property in the controlled area and thereafter becomes a company of another group, its hall not hold that property, except under the authority of a permit.

(2) If after the commencement of this Act a company of any group acquires immovable property in the controlled area, and thereafter becomes a company of another group, it shall not hold that property, except under the authority of a permit, unless it lawfully acquired the property from a member or company of such other group.

(3) For the purposes of this section a company shall be a company of a group, if a controlling interest in that company is held or deemed to be held by or on behalf or in the interest of a member of that group.

10. (1) No disqualified person shall occupy and no person shall allow any disqualified person to occupy any land or premises in the controlled area, except under the authority of a permit.

(2) The provisions of sub-section (1) shall not render it unlawful for any disqualified person to occupy any land or premises—

- (a) in pursuance of any right conferred by or under any statute;
- (b) under any agreement entered into or under any testamentary disposition made on or before the 24th day of April, 1950, or in the case of land or premises which have by virtue of any proclamation under section *thirty-three*, ceased to be subject to the operation of a proclamation under section *eleven*, under any agreement entered into or under any testamentary disposition made while the land or premises were subject to the operation of such last-mentioned proclamation, or under any renewal of any such agreement to which any party thereto is in terms thereof entitled;
- (c) by virtue of any prescriptive title acquired at or before the commencement of this Act;
- (d) under any arrangement entered into under the Housing Act, 1920 (Act No. 35 of 1920) or under any regulations made under the Housing (Emergency Powers) Act, 1945 (Act No. 45 of 1945), if he is a member of the same group as the class of persons for which the dwelling or other building in question is intended;
- (e) as a *bona fide* servant or employee of the State, a statutory body or any person (other than a disqualified company, or a company referred to in section *sixteen*) lawfully occupying the land or premises;
- (f) as the *bona fide* visitor of any person lawfully residing on the land or premises or as a *bona fide* guest in an hotel;
- (g) as a *bona fide* patient in a hospital, nursing home, asylum, or similar institution, or an inmate of a prison, work colony, inebriate home, or similar institution; or
- (h) as the husband, wife, minor child or dependant of any person (including a servant or employee) lawfully occupying such land or premises.

(3) The Governor-General may by proclamation in the *Gazette* exclude any area defined in the proclamation, for the period specified therein, from the provisions of sub-section (1).

11. (1) The Governor-General may by proclamation in the *Gazette* declare that the provisions of sections *twelve* and *thirteen*

shall, as from a date specified in the proclamation (in the said section, referred to as the specified date) apply in any portion of the controlled area so specified (in the said sections referred to as a specified area).

(2) As from such date, the provisions shall, notwithstanding anything contained in any special or other statutory provision relating to the occupation of land or premises, apply in any such portion of the controlled area, and the provisions of section *ten* shall, while the first-mentioned provisions so apply, be suspended in respect of that portion of the controlled area.

(3) Upon the establishment of any group area, the relevant proclamation under this section shall cease to have any effect in respect of so much of any such portion of the controlled area as may be comprised by or included in that group area.

12. (1) As from the specified date, no person who is a member of any group shall occupy and no person shall allow any such person to occupy any land or premises in a specified area which was not lawfully occupied and is not under section *thirteen* deemed to have been occupied at the said date by a person who is a member of the same group, except under the authority of a permit.

(2) The provisions of paragraphs (e), (f), (g) and (h) of sub-section (2) of section *ten* shall *mutatis mutandis* apply in respect of the occupation of land or premises in a specified area.

13. (1) (a) If after the specified date any building is erected or completed on any land or premises situated in a specified area elsewhere than in an area defined by proclamation under paragraph (a) of sub-section (3), or if at the said date any building, land or premises in a specified area are unoccupied, such building, land or premises shall, if any person other than a body corporate is the owner thereof, subject to the provisions of sub-sections (2), (3), (4), (5) and (7), for the purposes of section *twelve* be deemed to have been occupied at the specified date by the person who is the owner thereof.

(b) If a body corporate is the owner of such building, land or premises, or if at the said date such building, land or premises are not lawfully occupied, the Minister shall, subject to the provisions of sub-section (3), on the written application of the owner, determine the group by a member of which the building, land or premises shall for the said purposes be deemed to have been occupied at the specified date.

(2) If after the specified date any building on land or premises situated in a specified area elsewhere than in an area defined by proclamation under paragraph (a) of sub-section (3), is demolished and any other building erected in its stead on the same site, or any such building is extended, the building so erected or extended shall, subject to the provisions of sub-sections (3), (4), (5) and (7), for the purposes of section *twelve* be deemed to have been occupied at the specified date by the person who last lawfully occupied the demolished or extended building before the demolition or extension.

(3) (a) The Governor-General may by proclamation in the *Gazette* define any area in a specified area for the purposes of paragraph (b).

(b) The Minister shall, on the written application of the owner of any building which is completed, erected (whether or not in the stead of a demolished building) or extended in an area defined in any such proclamation, after the date of publication thereof, or of any land or premises in any such area which is or are unoccupied or not lawfully occupied on the said date, determine the group by a member of which such building, land or premises shall, for the purposes of section *twelve*, be deemed to have been occupied at the specified date.

(c) Until a determination is made under paragraph (b) in respect of any building referred to therein, such building shall, for the purposes of section *twelve*, be deemed to have been unoccupied at the specified date.

(d) If in terms of any determination under paragraph (b) any building, land or premises, is deemed to have been occupied by a member of the native group or of the coloured group, and a group consisting of members of such group is after such determination established under sub-section (2) of section *two*, the Minister may, on like application, withdraw the determination and under the said paragraph determine that such building, land or premises shall be deemed to have been occupied by a member of such last-mentioned group.

(4) Any dwelling or other building in a specified area which has been constructed under the Housing Act, 1920 (Act No. 35 of 1920) or under any regulations made under the Housing (Emergency Powers) Act, 1945 (Act No. 45 of 1945), shall for the purposes of section *twelve* be deemed to have been occupied at the specified date by a person who is a member of the same group as the class of persons for which such dwelling or building is intended.

(5) If the title deed of any building, land or premises in a specified area contains any condition which prohibits or restricts the occupation thereof by persons of one or more groups, the Minister shall not make any determination under sub-section (3) which would be contrary to any such condition.

(6) The Minister may, whenever for any reason he deems it expedient to do so, postpone the making of a determination under sub-section (2) or paragraph (b) of sub-section (3) for such period as he may deem fit.

(7) If any permit is issued in respect of the occupation of any land or premises in a specified area, such land or premises shall,

unless, it is specifically otherwise stated in the permit, as from the commencement of such occupation in pursuance of the permit, for the purposes of section *twelve* be deemed to have been occupied at the specified date by a person who is a member of the same group as the person in respect of whose occupation the permit is issued.

(8) (a) If at the specified date there exists any determination under sub-section (2) or paragraph (b) of sub-section (4) of section *six* of the Asiatic Land Tenure Act, 1946 (Act No. 28 of 1946), in respect of any building, land or premises in a specified area, and such building, land or premises remain unoccupied or the erection or extension of such building, has not been completed, such determination shall be deemed to have been made under the relevant provisions of this section: Provided that any reference in the determination to a person who is not an Asiatic, shall be deemed to be a reference to a member of the white group, and any reference therein, to a person who is an Asiatic, shall be deemed to be a reference to a member of the coloured group.

(b) If at the said date there exists any permit under section *eight* of the said Act authorizing the occupation of land or premises in a specified area, and such land or premises are not occupied in pursuance of the permit, the permit shall be deemed to have been issued under the relevant provision of section *fourteen* of this Act.

14. (1) The Minister may, subject to the provisions of sub-section (2), in his discretion, on written application made therefor—

(a) direct that a permit be issued, subject to such conditions as he may determine, to be signed by an officer thereto appointed by him, authorizing—

(i) the acquisition or holding of immovable property in a group area or in the controlled area; or

(ii) the occupation of or the granting of permission to occupy any land or premises in a group area, in the controlled area or in a specified area referred to in section *twelve*; and

(b) direct that the conditions of a permit be amended or that it shall be available for a portion only of the land or premises in respect of which it has been issued.

(2) The Minister shall not direct that any permit be issued under sub-section (1)—

(a) authorizing the acquisition or holding of immovable property or the occupation of land or premises in a group area unless he is of opinion that the refusal of the permit would cause undue hardship or that the issue of the permit would be in the interest of the group for which the group area has been established; or

(i) authorizing any person to acquire, hold or occupy any land or premises contrary to any provision in the title deed which prohibits or restricts the acquisition, holding or occupation of the land or premises by persons belonging to any group or class.

(3) In directing that a permit be issued or that the conditions thereof be amended under sub-section (1) and in making a determination under section *thirteen*, the Minister may take into consideration the relative needs of any group concerned, in regard to housing, the amenities of life and educational and recreational facilities, trading and industrial undertakings, the situation of the immovable property, land or premises in relation to other property, land or premises owned or occupied by members of any group, and any other matters which in his opinion are relevant to the question whether or not any such permit should be issued or an amendment of the conditions thereof should be made or how any such determination should be made.

(4) A permit authorizing the holding of immovable property or the occupation of land or premises, may be issued for an indefinite or a specified period or until withdrawn at the discretion of the Minister.

(5) A permit authorizing the acquisition of immovable property by a company referred to in section *sixteen* may be issued—

(a) in respect of any particular immovable property; or

(b) in respect of immovable property in any area specified in the permit; or

(c) in respect of immovable property in general; and

(d) in the cases referred to in paragraphs (b) and (c), either for a specified period or until withdrawn at the discretion of the Minister: Provided that upon the expiration of any such period or the withdrawal of the permit, the conditions of the permit shall continue to apply in respect of any immovable property acquired under the authority thereof.

(6) A permit authorizing the occupation of any land or premises in the controlled area by any employee of a company referred to in paragraph (a) of sub-section (2) of section *four* or in paragraph (c) of sub-section (2) of section *ten*, or the granting of permission to any such employee to occupy such land or premises, may be issued in respect of any individual employee or in respect of any class of employees specified in the permit, and in the latter case either for a specified period or until withdrawn at the discretion of the Minister.

(7) There shall be payable to the Minister in respect of every application for a permit which is submitted within two years after the date of any previous application relating to the same land or premises, or any portion of such land or premises, which has been refused, a fee of twenty-five pounds: Provided that the Minister may after consideration of any such application, in his discretion, refund to the

applicant out of moneys to be appropriated by Parliament for the purpose, an amount equal to the amount so paid or any portion thereof as he may deem fit.

(8) Any permit shall lapse if, in the case of a permit authorizing the acquisition of immovable property by agreement, the agreement is not entered into, or if, in the case of a permit authorizing the occupation of land or premises, the land or premises are not occupied, in pursuance of the permit, within a period of six months after the issue thereof or within such further period as the Minister may allow on an application lodged with him prior to the expiration of such first-mentioned period.

(9) If any land or premises in respect of which a permit has been issued under sub-paragraph (ii) of paragraph (a) of sub-section (1) is occupied or used contrary to any condition subject to which the permit was issued, the Minister may, after not less than one month's notice to the holder of the permit, revoke the permit.

15. (1) Whenever a private company holds any immovable property, any share in or debenture of that company held by or pledged to a person who or a company which is a disqualified person or a disqualified company in relation to that property (other than a banking institution as defined in the Banking Act, 1942 (Act No. 38 of 1942)), or by or to any person on behalf or in the interest of such a person or company, shall be forfeited to the State.

(2) It shall be the duty of the secretary and every director of any company referred to in sub-section (1), which holds any immovable property, to notify the registrar of companies whenever any person who or company which is a disqualified person or disqualified company in relation to that property or any other person on behalf or in the interest of such a person or company, holds any share in or debenture of such first-mentioned company.

(3) The provisions of sub-section (1) and (2) shall not apply in respect of any shares in or debentures of a private company—

(a) which are held immediately after the commencement of this Act by a disqualified person or a disqualified company, or immediately after the date specified in the relevant proclamation under paragraph (b) of sub-section (1) of section *three* by a person who or a company which, as a result of such proclamation, becomes a disqualified person or a disqualified company in relation to such immovable property held by such private company, while such shares or debentures are held by such person or company; or

(b) which are held by a disqualified person, if he inherited them from a disqualified person who lawfully held them; or

(c) which are held by a disqualified person who or a disqualified company which lawfully holds any other shares in or debentures of that company, if such person or company acquired such first-mentioned shares or debentures from a disqualified person who or a disqualified company which lawfully held them:

Provided that nothing in this sub-section contained shall affect the application of sub-sections (1) and (2) in respect of any shares or debentures unlawfully held at the commencement of this Act.

(4) If any share in or a debenture of any company has been forfeited under sub-section (1), the secretary of the company shall make such entries in any register, book or document under the control of the company and issue such document as the registrar of companies may direct for the purpose of giving effect to the forfeiture.

(5) For the purpose of this section no person shall, by reason of the establishment of a group area, be a disqualified person in relation to immovable property in that area, unless that area is in terms of a proclamation under paragraph (b) of sub-section (1) of section *three*, a group area for ownership.

16. (1) No company which has issued any shares or share warrants or debentures entitling the bearer thereof to any rights in regard thereto, and no company wherein a controlling interest is held by or on behalf or in the interest of any such company, shall acquire immovable property, situated in the controlled area or in any group area, except under the authority of a permit.

(2) If any company referred to in sub-section (1) holds any immovable property in the controlled area, the Minister may, after not less than three months' notice in writing to the company, declare the company, by notice in the *Gazette*, to be a company wherein a controlling interest shall, for the purposes of section *ten*, be deemed to be held by a member of a group specified in the notice, and thereupon the company shall for the said purposes be deemed to be such a company, and it shall further for the said purposes be deemed that no controlling interest in the company is held by or on behalf or in the interest of any member of any other group.

17. (1) If it appears to the Minister that there is reason to presume that a controlling interest in any company is held by or on behalf or in the interest of any member of any group, he may by notice in writing call upon that company to furnish him, within a period specified in the notice, with such particulars in regard to the control of that company, as may be so specified.

(2) If the company fails to comply with any such notice within the said period or within such further period as the Minister may allow, or the said notice has been complied with, and the Minister is satisfied that a controlling interest in the company was at the date of such notice held by or on behalf or in the interest of any member of any group, he may by notice in the *Gazette* declare that for the purposes of this Act, it shall be a company wherein a controlling interest is held by or on behalf or in the interest of a member of that group, and thereupon the company shall for the said purposes

be deemed to be such a company, and it shall further for the said purposes be deemed that no controlling interest in the company is held by or on behalf or in the interest of any member of any other group.

(3) The company shall be notified of such declaration and may, within a period of two months after a date specified in the notification, apply to any provincial division of the Supreme Court having jurisdiction for an order setting aside the notice referred to in sub-section (2), and the court may set aside the notice if the company proves that it is not a company wherein a controlling interest was, either at the date of the notice under sub-section (1) or at the date of the notice under sub-section (2), held by or on behalf or in the interest of any member of the group in question.

(4) The operation of a notice under sub-section (3) shall, in respect of immovable property, shares or debentures held by or pledged to the company at the date of the notice, be suspended until the expiration of the period referred to in sub-section (3), or if an application is made under the said paragraph, until the application has been disposed of.

(5) A notice under sub-section (1) or (3) shall, in the case of a foreign company (as defined in section two hundred and twenty-nine of the Companies Act, 1926 (Act No. 46 of 1926)), be deemed to have been effectually given—

(a) if served upon a person who is, in regard to the company concerned, authorized as provided in paragraph (c) of sub-section (1) of section two hundred and one of the said Act; or

(b) where there is no such person in the Union, if given in the manner which, in the opinion of the Minister, is best calculated to bring it to the knowledge of the company concerned.

18. Any condition or provision in any document whatsoever, empowering or purporting to empower any disqualified person or any disqualified company to exercise any influence upon the transfer of immovable property, shall be null and void: Provided that where at the time such condition or provision was made, the person or company concerned was not a disqualified person or a disqualified company, as the case may be, in relation to the property in question, it shall be revived if such person or company ceases to be a disqualified person or a disqualified company in relation to that property.

19. No person shall acquire or hold on behalf or in the interest of any person any immovable property which such other person may not lawfully acquire or hold in terms of this Act.

20. (1) If any immovable property—

(a) is acquired or held in contravention of any provision of this Act or in pursuance of any agreement which is null and void in terms of this Act, or is dealt with or used contrary to any condition of a permit under the authority of which it has been acquired or is held; or

(b) has at the commencement of this Act been acquired or is at the said commencement held in contravention of any provision of any law repealed by this Act or in pursuance of any agreement which is null and void in terms of any such provision, or is dealt with or used contrary to any condition of a permit or any term of a certificate issued under any such provision, under the authority of which it was acquired or held,

the Minister may, after not less than three months' notice in writing to the person concerned, cause the property to be sold either out of hand upon the terms and conditions agreed to by the person concerned and approved by the Minister, or by public auction upon such terms and conditions as the Minister may determine.

(2) The costs of such sale (including a sale out of hand) shall be a first charge upon the proceeds thereof and any balance shall be applied towards the payment of any debt which the payment is secured by such property, in its legal order of priority, and any balance left thereafter shall be paid—

(a) in the case of property referred to in paragraph (b) or (c) of subsection (1) of section five of this Act or in section three of the Asiatic Land Tenure Act, 1946 (Act No. 28 of 1946), to the company concerned; and

(b) in any other case, unless the Minister otherwise directs, into the Consolidated Revenue Fund:

Provided that if the property has been acquired or is held in contravention of section nineteen of this Act, the proceeds thereof shall not be applied directly or indirectly towards the payment of any debt to the person on whose behalf or in whose interest the property has been acquired or is held.

(3) A copy of every notice under sub-section (1) shall be transmitted to the officer in charge of the deeds registry concerned, and the said officer shall, upon receipt thereof, note thereon the day and hour of its receipt, and note in the appropriate registers that such a notice has been given in respect of the immovable property in question.

(4) Subject to the provisions of sub-section (5), the said officer shall not after receipt by him of any such notice register any transfer, lease or mortgage or other encumbrance of such immovable property, except a transfer in pursuance of a sale under sub-section (1).

(5) If any such notice is withdrawn, a notice of the withdrawal shall be transmitted to the said officer, and upon receipt of such notice or upon the transfer of the immovable property in pursuance of a sale under sub-section (1), any entry made under sub-section (3) shall be cancelled.

(6) The Minister and any officer designated by him for the purpose, shall have power to do whatever may be necessary to effect the transfer of any property sold under sub-section (1) to the purchaser thereof.

(7) If the owner of the property fails to produce the title deed thereof, the officer in charge of the deeds registry shall nevertheless pass transfer of the property and note the transfer on the duplicate title deed filed in his office and in the appropriate registers.

(8) The provisions of this section shall apply notwithstanding anything to the contrary contained in the Administration of Estates Act, 1913 (Act No. 24 of 1913), the Companies Act, 1926 (Act No. 46 of 1926), the Farmers' Assistance Act, 1935 (Act No. 48 of 1935) or the Insolvency Act, 1936 (Act No. 24 of 1936).

21. (1) A Surveyor-General may at the request of any person and upon payment by such person to the Surveyor-General of such fee as may be prescribed by regulation, issue to that person a certificate, in such form as may be so prescribed, stating that any land described therein, within his area of jurisdiction, is situated within the controlled area or within any group area so described.

(2) A certificate issued under sub-section (1) shall in all courts of law and public offices in the Union be *prima facie* evidence of the facts stated therein.

22. No officer in charge of any deeds registry shall register any transfer of any immovable property situated in the controlled area or in any group area, if the transferee may not lawfully acquire and hold such immovable property in terms of this Act.

(1) No officer entrusted by law with the issue of any licence to carry on any business, trade or occupation shall issue or renew any such licence unless the person applying therefor proves that the proposed holder of such licence and the person or persons who will be in actual control of the business, trade or occupation to be licensed may lawfully carry on the business, trade or occupation on the premises whereon it is to be carried on.

(2) Any person whatever may within two months after the issue or renewal of any such licence, and any applicant for such a licence or the renewal thereof whose application has been refused under sub-section (1), may, within two months after the refusal, note an appeal against the decision of the officer concerned to the magistrate of the district wherein the premises referred to in sub-section (1) are situate.

(3) The magistrate may on dealing with such appeal—

(a) hear any evidence which such officer heard;

(b) cancel any licence issued by such officer or order such officer to accept, for the purposes of the application for the issue or renewal of a licence, that the proof required by sub-section (1) has been given; and

(c) make *mutatis mutandis* such order as to the costs of the appeal as he could have made if the appeal had been a civil trial in his court.

(4) Such cost shall be taxable, *mutatis mutandis* in the same manner as costs incurred in connection with such a trial.

(5) The decision of the magistrate on any such appeal shall be subject to an appeal to the provincial division of the Supreme Court having jurisdiction, as if it were a civil judgment of a magistrate's court.

24. (1) There is hereby established a board to be known as the Land Tenure Advisory Board, which shall consist of not more than seven members appointed by the Minister.

(2) One of the members shall be designated by the Minister as the chairman and one as vice-chairman of the Board.

(3) A member of the board shall be appointed for such period, not exceeding five years, as the Minister may determine at the time of his appointment and any member whose office become vacant (otherwise than under sub-section (4)), shall be eligible for reappointment.

(4) A member of the board shall cease to hold his office—

(a) if his estate is sequestrated or if a notice with reference to him is published under sub-section (1) of section ten of the Farmers' Assistance Act, 1935 (Act No. 48 of 1935);

(b) if he becomes of unsound mind or is convicted of an offence and sentenced to imprisonment without the option of a fine;

(c) if he is absent from three consecutive meetings without the permission of the chairman; or

(d) if he is removed from his office by the Minister on the ground of incapacity or misbehaviour.

(5) A casual vacancy on the Board shall be filled by the appointment of a member for the unexpired portion of the period for which the member whose office has become vacant, has been appointed.

(6) A member of the board (other than a person who is in the full-time employment of the State and in receipt of a salary from public funds) shall, and any such lastmentioned person may, receive such remuneration and allowances as the Minister in consultation with the Minister of Finance, may determine.

25. (1) The meetings of the board shall, subject to the provisions of sub-section (2), be held at such times and places as the board may fix.

(2) The chairman may at any time call a special meeting of the board to be held at such time and place as he may direct.

(3) A quorum for a meeting of the board shall be three of the members thereof.

(4) Whenever the chairman is absent or unable to fulfil his duties, the vice-chairman shall act as chairman during such absence or inability, and in the absence from any meeting of the board of the

chairman and the vice-chairman, the members present at that meeting may elect one of their number to preside at that meeting.

(5) The decision of the majority of the members present at a meeting of the board shall be the decision of the board: Provided that in the event of an equality of votes, the person presiding at the meeting shall have a casting vote in addition to his deliberative vote.

26. The Minister shall not make any determination under section *thirteen*, or issue or revoke any permit under section *fourteen*, or amend any of its conditions, unless he has considered a report made by the board under section *twenty-seven* in regard thereto.

27. (1) The board shall enquire into and by means of a written report advise the Minister in regard to—

(a) the desirability or otherwise of issuing, amending or withdrawing—

(i) any proclamation under sub-section (2) of section *two*; or

(ii) any proclamation under sub-section (1) of section *three*, sub-section (3) of section *ten*, sub-section (1) of section *eleven* or sub-section (3) of section *thirteen* in respect of any area;

(b) any determination to be made under section *thirteen*;

(c) the issue or amendment of the conditions of any permit under section *fourteen*; and

(d) any matter relating to the administration of this Act which the Minister may refer to it.

(d) any matter relating to the administration of this Act which the Minister may refer to it.

(2) Before advising the Minister as to any proclamation under sub-section (1) of section *three* or as to any matter referred to in paragraph (b) or (c) of sub-section (1); the board shall publish in a newspaper circulating in the district in which the area concerned will be or the land or premises concerned are situated, as the case may be, at least once in each of two consecutive weeks, a notice setting forth the matter which is being investigated (including in the case of any such area, the proposed situation or the approximate proposed situation thereof or the place within the district where a plan showing such situation may be inspected) and inviting all persons who have an interest therein to lodge with the board at an address specified in the notice and within a period so specified (which shall not be less than ten days after the last publication of the notice) any representations in writing which they may wish to make to the board in connection with such matter.

(3) The publication of a notice referred to in sub-section (2) shall not, unless the Minister so directs, be required in respect of the issue of a permit, if the board is satisfied that the issue of the permit is not necessary under the provisions of this Act or that a permit previously issued in respect of the same land or premises, or any portion thereof, has lapsed by virtue of the provisions of sub-section (7) of section *fourteen*.

(4) If the Minister so directs, the board shall comply with the provisions of sub-section (2) also in regard to any proclamation under sub-section (3) of section *ten*, sub-section (1) of section *eleven* or sub-section (3) of section *thirteen*, or to any matter referred to in sub-paragraph (i) of paragraph (a) or paragraph (d) of sub-section (1), or shall follow such other procedure for bringing the matter (including any matter to be dealt with by any such proclamation) to the notice of interested persons, as the Minister may determine.

28. (1) The board may—

(a) for the purpose of any enquiry conducted by it, summon any person who in its opinion may be able to give material information concerning the subject of the enquiry or who it suspects or believes has in his possession or custody or under his control any book, document or thing which has any bearing upon the subject of the enquiry, to appear before it at a time and place specified in the summons, to be interrogated or to produce that book, document or thing, and the board may retain for examination any book, document or thing so produced;

(b) call and by its chairman administer an oath to, or accept an affirmation from, any person present at the enquiry who was or might have been summoned in terms of this section, and may interrogate him or allow him to be interrogated by any person to whose application the enquiry relates or any person who has lodged representations in pursuance of the notice under sub-section (2) or (4) of section *twenty-seven* or on behalf of any such person by any person entitled to appear as an advocate or attorney in a court of law in the Union, and require him to produce any book, document or thing in his possession or custody or under his control: Provided that in connection with the interrogation of any such first-mentioned person, or the production of any such book, document or thing, the law relating to privilege, as applicable to a witness subpoenaed to give evidence or to produce any book, document or thing before a court of law, shall apply;

(c) at all reasonable times enter upon and inspect any land or premises for the purpose of any investigation conducted by it, or authorise any person nominated by the chairman of the board so to enter upon and inspect such land or premises.

(2) A summons for the attendance before the board of any person or for the production of any book, document or thing shall be in writing signed by the chairman or the secretary of the board and shall be served by registered post.

29. (1) The board may authorize any member thereof, or any committee appointed by it consisting of two or more of its members, or (with the approval of the Minister) of one or more of its members and one or more other persons, to conduct any enquiry which the board may deem necessary for the proper carrying out of its functions, and any member or committee so authorized shall for the purpose of such enquiry exercise all the powers conferred and perform all the duties imposed upon the board in respect of any such enquiry conducted by it.

(2) In appointing a committee under sub-section (1), the board shall designate one of the members thereof who is a member of the board, to be the chairman.

(3) A summons under section *twenty-eight* read with sub-section (1) for the attendance before any member of the board or before any committee conducting an enquiry under the said sub-section, or for the production of any book, document or thing, may be signed by such member or by the chairman of the committee, as the case may be.

30. The Minister may assign to the board an officer in his department to be the secretary, and such other officers in his department as may be necessary to enable the board to carry out its functions.

31. (1) The Minister shall, subject to the law governing the public service, appoint such inspectors (one of whom shall be the chief inspector) as may be necessary for the purpose of ascertaining such facts as may be required by the Minister, the board, any officer in charge of a deeds registry or any officer referred to in section *twenty-three*, in connection with the application of this Act, and of ascertaining whether the provisions of this Act and of any other statute prohibiting or restricting the ownership, acquisition or occupation of land by any class of persons are being complied with:

(2) Any such inspector may for any such purpose—

(a) without previous notice, at any time during the day or night, enter upon any premises whatsoever and make such examination and enquiry as may be necessary;

(b) at any time and at any place require from any person who has the possession, custody or control of any book, record or other document, the production thereof, then and there at a time and place fixed by the inspector;

(c) examine and make extracts from and copies of any book, record or document, and require from any person an explanation of any entries therein, and seize any such book, record or document, as in his opinion may afford evidence of a contravention or evasion of any provision referred to in sub-section (1);

(d) question either alone or in the presence of any other person as he thinks fit, with respect to any matter relevant to any such purpose, any person whom he finds on any premises entered under this section;

(e) require any person who has reasonable grounds for believing to be in possession of information relevant to any such purpose; to appear before him at a time and place fixed by him and then and there question that person concerning any matter relevant to any such purpose.

(3) An inspector exercising any power under paragraph (d) or (e) of sub-section (2) shall keep a record of any statement made to him, and the person who made the statement shall be entitled to a copy of the statement as so recorded.

(4) Any person who is questioned under paragraph (d) or (e) of sub-section (2) shall be entitled to all the privileges of which a person giving evidence before a court of law is entitled.

(5) Every person occupying or residing upon any premises entered by an inspector under sub-section (2) or employed by any such person, shall at all times furnish such facilities as are required by the inspector for the purpose of exercising his powers under the said sub-section.

(6) An inspector entering any premises under sub-section (2) may be accompanied by an interpreter or any member of the South African Police.

(7) Every such inspector shall be furnished with a certificate signed by an officer thereto designated by the Minister stating that he has been appointed as an inspector under this section, and any inspector exercising any power conferred upon him by this section shall on demand produce such certificate.

32. (1) No inspector and no interpreter or member of the South African Police referred to in sub-section (6) of section *thirty-one*, shall disclose any information in relation to the financial or business affairs of any person, firm or business, acquired in the exercise of his powers or in the performance of his duties, to any person, except—

(a) to the Minister or a member of the board or any committee thereof or an officer in the public service for the purposes of the performance of any duty in connection with any matter investigated under the said section; or

(b) for the purpose of the performance of his duties; or

(c) for the purpose of the institution of any legal proceedings or when required to do so before a court or under any law.

(2) No member of the board or of any committee thereof and no such officer shall disclose any information received by him under sub-section (1), to any person, except for a purpose referred to in paragraph (b) or (c) of the said sub-section.

33. Whenever the Governor-General or the Minister, as the case may be, is by this Act authorized to issue any proclamation or notice, he may in like manner, whenever it is deemed expedient, withdraw or amend such proclamation or notice.

34. (1) Any person who—
- (a) contravenes the provisions of sub-section (1) of section *four*, paragraph (b), (b) or (c) of sub-section (1) of section *five*, sub-section (1) of section *eight*, section *nine*, sub-section (1) of section *ten*, sub-section (1) of section *twelve*, sub-section (1) of section *sixteen* or section *nineteen*; or
 - (b) contravenes or fails to comply with any condition of a permit; or
 - (c) contravenes or fails to comply with the provisions of sub-section (4) of section *fifteen*, sub-section (5) of section *thirty-one* or section *thirty-two*; or
 - (d) having been summoned or called under section *twenty-eight* or under the said section read with section *twenty-nine*, fails without sufficient cause to attend at the time and place specified in the summons or to remain in attendance until excused from further attendance, or refuses to be sworn or to affirm as a witness; or
 - (e) refuses or fails, without sufficient cause, to answer fully and satisfactorily to the best of his knowledge and belief any relevant question lawfully put to him at an enquiry under section *twenty-eight* or under the said section read with section *twenty-nine*, or to produce any book, document or thing in his possession or custody which he has been lawfully required to produce at such enquiry; or
 - (f) having been sworn or having made an affirmation at any such enquiry, gives an answer to any relevant question lawfully put to him or makes relevant statement, which is false in any material particular, knowing such answer or statement to be false; or
 - (g) falsely holds himself out to be an inspector; or
 - (h) refuses or fails, without sufficient cause, to answer fully and satisfactorily to the best of his knowledge and belief any relevant question lawfully put to him by an inspector in the exercise of his powers; or
 - (i) gives an answer to any such question or makes any relevant statement to an inspector, which is false in any material particular, knowing such answer or statement to be false; or
 - (j) hinders or obstructs the chairman, the secretary or any member of the board or of a committee thereof, or any person nominated under paragraph (c) of sub-section (1) of section *twenty-eight* or under the said paragraph read with section *twenty-nine*, or any inspector, in the exercise of his powers or functions under this Act,

shall be guilty of an offence, and liable on conviction, in the case of an offence referred to in paragraph (a), (b) or (f), to a fine not exceeding two hundred pounds or to imprisonment for a period not exceeding two years, or to both such fine and imprisonment, and in the case of an offence referred to in any other paragraph, to a fine not exceeding one hundred pounds or to imprisonment for a period not exceeding one year or to both such fine and imprisonment.

(2) The court which convicts any person of a contravention of sub-section (1) of section *four*, sub-section (1) of section *ten* or sub-section (1) of section *twelve*, may order the person convicted to vacate the land or premises to which the conviction relates, on or before a date to be specified in such order but not less than fourteen days after the date of the conviction.

(3) Any person who fails to comply with an order made under sub-section (2), shall be guilty of an offence and liable on conviction to a fine not exceeding fifty pounds or to imprisonment for a period not exceeding six months, or to both such fine and imprisonment, and to a further fine not exceeding five pounds for every day during which the failure to comply with such order continued.

35. (1) A person who in appearance obviously is a white person shall for the purposes of this Act be presumed to be a member of the white group until the contrary is proved.

(2) A person who in fact or by general acceptance and repute is a member of an aboriginal race or tribe of Africa shall for the purposes of this Act be presumed to be a member of the native group until the contrary is proved.

(3) A person who is not in appearance obviously a white person and who is not in fact or by general acceptance and repute a member of an aboriginal race or tribe of Africa shall for the purposes of this Act be presumed to be a member of the coloured group until the contrary is proved.

(4) Whenever in any proceedings under this Act, whether civil or criminal, it is alleged by or on behalf of the Minister or any officer in charge of a deeds registry or in any indictment or charge

that any company is a company wherein a controlling interest is held by a member of any group, that company shall be presumed to be such a company, until the contrary is proved.

36. (1) The Governor-General may make regulations—

- (a) as to the registration of any persons as members of any group referred to in any proclamation under sub-section (2) of section *two*;
- (b) as to the manner in which any governing body referred to in sub-section (1) of section *six*, is to be constituted (including the election of all or some of its members), the powers and functions of such governing body (including the power to levy rates and charges), the supervision to be exercised over such governing body by any local authority referred to in sub-section (2) of the said section, and the powers and functions of such local authority in any group area concerned;
- (c) prescribing the form of a certificate under section *twenty-one* and the fee payable in respect thereof;
- (d) prescribing requirements to be complied with in connection with the registration of immovable property for the purpose of ensuring compliance with the provisions of this Act; and
- (e) generally, as to all matters which he considers it necessary or expedient to prescribe in order that the purposes of this Act may be achieved.

(2) Different regulations may be made in respect of different groups and of different areas or provinces of the Union.

(3) The regulations may provide for legal presumptions in regard to membership of any group established under sub-section (2) of section *two*, and may prescribe penalties for any contravention thereof or failure to comply therewith, not exceeding a fine of fifty pounds or imprisonment for a period of six months.

(4) No regulations shall be made under paragraph (b) of sub-section (1), unless the Minister has consulted the Administrator of the province concerned.

37. (1) The provisions of this Act, in so far as they relate to the board or to inspectors, shall come into operation in the Union upon a date to be fixed by the Governor-General by proclamation in the *Gazette*, and in so far as they relate to any other matter, they shall come into operation in each province of the Union upon a date to be fixed for that province by the Governor-General by proclamation in the *Gazette*: Provided that in the case of the province of the Cape of Good Hope, the Governor-General may either fix a date for the province or by one proclamation or by more than one proclamation issued at different times, fix different dates for different areas within the said province.

(2) Any reference in this Act to its commencement shall be construed in accordance with the provisions of sub-section (1).

38. (1) Sections *ten* to and including *fifteen* and paragraphs (b) to and including (f) of sub-section (1) of section *sixteen* of the Asiatic Land Tenure Act, 1946 (Act No. 28 of 1946), sections *fourteen*, *fifteen* and *sixteen* of the Asiatic Land Tenure Amendment Act, 1949 (Act No. 53 of 1949), and section *four* of the Asiatic Land Tenure Amendment Act, 1950 (Act No. 15 of 1950), are hereby repealed as from the date fixed by the proclamation first referred to in section *thirty-seven*.

(2) Any reference in the first-mentioned Act or in any other law to the Land Tenure Advisory Board established by section *ten* of the said Act, shall, as from the said date, be deemed to be a reference to the board.

(3) The laws specified in the First Schedule are hereby amended to the extent set out in the second column of that Schedule, with effect as from the date fixed under section *thirty-seven* for the province of Natal, except in so far as any relevant provision referred to in the said column relates to land or premises in the province of Transvaal or in the territories referred to as the Northern Districts in section *three* of the Northern Districts Annexation Act, 1902 (Act No. 1 of 1902) of Natal.

(4) The laws specified in the Second Schedule are hereby repealed and amended to the extent set out in the second column of that Schedule, with effect as from the date fixed under section *thirty-seven* for the province of Transvaal, except in so far as any relevant provision referred to in the said column relates to land or premises in the province of Natal, with the exclusion of the said territories.

(5) As from the date fixed under section *thirty-seven* for any province of the Union, or for any area in the province of the Cape of Good Hope, the provisions of sub-section (1) of section *one* of the Natives Land Act, 1913 (Act No. 27 of 1913) shall cease to apply in respect of land in that province or area which is situated in the controlled area or in any group area.

39. This Act shall be called the Group Areas Act, 1950.

First Schedule

Law amended.	Extent of amendment.
Transvaal Asiatic Land Tenure Amendment Act, 1936 (Act No. 30 of 1936).	The repeal of paragraphs (e) and (f) of sub-section (1), and sub-sections (4) and (5) of section fourteen.
Asiatic Land Tenure Act, 1946 (Act No. 28 of 1946).	The repeal of sections one to and including four sections six to and including nine bis, and sections sixteen, seventeen and thirty-nine.
Asiatic Land Tenure Amendment Act, 1949 (Act No. 53, 1949)	The repeal of sections six to and including thirteen, and sections sixteen, seventeen and eighteen.
Asiatic Land Tenure Amendment Act, 1950 (Act No. 15 of 1950).	The repeal of section three.

Second Schedule

Law repealed or amended.	Extent of repeal or amendment.
Law No. 3 of 1885 of the Transvaal.	The repeal of the whole.
The Asiatic (Land and Trading) Amendment Act (Transvaal), 1919 (Act No. 37 of 1919).	The repeal of the whole, except section one, so much of section eleven as defines and expression used in section one and twelve. The amendment of section twelve by the substitution for the words "Asiatics (Land and Trading) Amendment Act (Transvaal)" of the words "Gold Law (Coloured Persons) Amendment Act." The amendment of the long title by the deletion of the words "with reference to the prohibition of ownership of land by Asiatics and," and the substitution for the words "and trading by them" of the words "by coloured persons."
Asiatic (Cape Malay) Amendment Act, 1924, (Act No. 12 of 1924).	The deletion in sub-section (1) of section one, of the words "Law No. 3 of 1885 of the Transvaal, of section two of the Asiatics (Land and Trading) Amendment Act (Transvaal), 1919 (Act No. 37 of 1919) or" and of the word "other."

Law repealed or amended	Extent of repeal or amendment
Asiatics in the Northern Districts of Natal Act, 1927 (Act No. 33 of 1927).	The repeal of section fourteen.
Transvaal Asiatic Land Tenure Act, 1932 (Act No. 35 of 1932).	The repeal of sections seven, eight and nine.
Transvaal Asiatic Land Tenure Amendment Act, 1936 Act No. 30 of 1936.	The repeal of sections one, eight, nine, ten and eighteen. The deletion of paragraphs (e) and (f) of sub-section (1), and sub-sections (4) and (5) of section fourteen.
Asiatic Land Tenure Act, 1946 (act No. 28 of 1946).	The repeal of sections one, five, six, seven, eight, nine bis, sections sixteen, to and including nineteen, sections twenty-five to and including thirty-two and sections thirty-seven and thirty-nine.
Asiatic Land Tenure Amendment Act, 1949 (Act No. 53, 1949).	The repeal of sections one to and including five, sections ten to and including thirteen, and sections sixteen to and including nineteen.
Asiatic Land Tenure Amendment Act, 1950 Act No. 15 of 1950.	The repeal of sections one and two.

UNION OF SOUTH AFRICA

GROUP AREAS BILL

To provide for the establishment of group areas, for the control of the acquisition of immovable property and the occupation of land and premises, and for matters incidental thereto.

(Introduced by the MINISTER OF THE INTERIOR.)

BE IT ENACTED by the King's Most Excellent Majesty, the Senate and the House of Assembly of the Union of South Africa, as follows:—

Definitions

1. In this Act, unless the context otherwise indicates—

- (i) "acquire" in relation to immovable property, means to become the owner of such property in any manner whatsoever; (xix)
- (ii) "board" means the Land Tenure Advisory Board established by section *twenty-four* (xvii)
- (iii) "company" includes any private company, any company referred to in section *sixteen* and any foreign company as defined in section *two hundred and twenty-nine* of the Companies Act, 1926 (Act No. 46 of 1926); (viii)
- (iv) "controlled area" means any area which is not a group area or a scheduled native area, location, native village, coloured persons settlement, mission station or communal reserve referred to in paragraph (c) of sub-section (3) of section *three*, and includes, except for the purposes of section *ten*, any specified area referred to in section *eleven*; Provided that any group area which is not in terms of a proclamation under paragraph (a) of sub-section (1) of section *three* a group area for occupation shall form part of the controlled area for the purposes of the provisions of this Act relating to the occupation of land or premises in the controlled area, and that any group area which is not in terms of a proclamation under paragraph (b) of the said sub-section a group area for ownership, shall form part of the controlled area for the purposes of the provisions of this Act relating to the acquisition of immovable property in the controlled area; (i)
- (v) "controlled interest," in relation to any company means—
 - (a) a majority of its shares; or
 - (b) shares representing more than half its share capital; or
 - (c) shares of a value in excess of half the aggregate value of all its shares; or
 - (d) shares entitling the holders thereof to more than half its profits or assets; or
 - (e) shares entitling the holders thereof to a majority or preponderance of votes; or
 - (f) any claim arising from a loan, for an amount in excess of half its share capital, or debentures for such an amount; or
 - (g) the power to exercise, directly or indirectly, by holding any interest, whether or not of the nature referred to in paragraphs (a) to and including (f) in any other company, or otherwise, any control whatsoever over the activities or assets of the company; (ii)
- (vi) "disqualified company", in relation to immovable property, land or premises, means a company wherein a controlling interest is held or deemed to be held by or on behalf of or in the interest of a person who is a disqualified person in relation to such property, land or premises; (x)
- (vii) "disqualified person", in relation to immovable property, land or premises in any group area, means a person who is not a member of the group specified in the relevant proclamation under section *three*, and in relation to any immovable property, land or premises in the controlled area, means a person who is not a member of the same group as the owner of such property, land or premises, or if the owner is a statutory body other than a municipality in the province of the Cape of Good Hope, of the same group as the majority of the members of such body or in the case of any such municipality, of the same group as the majority of the members of the council thereof, or if the owner is a company, of the same group as any person by whom or on whose behalf or in whose interest a controlling interest is held or deemed to be held in such company; (xi)
- (viii) "group" means either the white group, the coloured group or the native group referred to in section *two*, and includes, to the extent required to give effect to any relevant proclamation under sub-section (2) of the said

section, any group of persons who have under the said section been declared to be a group; (iii)

- (ix) "group area" means any area proclaimed under section *three*; (iv)
- (x) "immovable property" includes any real right in immovable property and any right which would upon registration be such a real right and any lease or sub-lease of immovable property (other than a lease or sub-lease of immovable property in an area which is a specified area in terms of section *eleven*), but does not include a mortgage bond over immovable property; (xii)
- (xi) "inspector" means an inspector appointed under section *thirty-one*; (vii)
- (xii) "land" includes any portion of land; (v)
- (xiii) "local authority" means any institution or body contemplated in paragraph (vi) of section *eighty-five* of the South Africa Act, 1909; (xvi)
- (xiv) "marriage" includes a union, recognized as a marriage (whether or not of a monogamous nature) in native law or custom or under the tenets of the religion of either of the parties to the union; (vi)
- (xv) "Minister" means the Minister of the Interior: Provided that in relation to any group area for the native group or for any group defined under sub-section (2) of section *two* consisting of members of the native group any area which is a reclassified area in terms of the Native Trust and Land Act, 1936 (Act No. 1 of 1936), any area referred to in sub-section (1) of section *eight* of the Natives (Urban Areas) Consolidation Act, 1945 (Act No. 25 of 1945), and to any immovable property, land or premises in any such area, any reference to the Minister in paragraph (b) of sub-section (3) of section *three*, section *six*, sub-section (1) of section *seven*, sections *fourteen*, *twenty*, *twenty-six*, *twenty-seven*, *thirty-two* and *thirty-three*, sub-section (4) of section *thirty-five* and sub-section (4) of section *thirty-six*, shall be a reference to the Minister of Native Affairs; (ix)
- (xvi) "permit" means a permit issued or deemed to be issued under the relevant provision of section *fourteen*; (xiii)
- (xvii) "person" shall not be limited in its meaning by reason of any special reference to a disqualified person, a disqualified company, a private company, a company referred to in section *sixteen* or a statutory body; (xv)
- (xviii) "premises" includes any room or apartment in any building; (xiv)
- (xix) "statutory body" means any council, board or body established by or under any law (xviii).

Groups For The Purposes Of This Act

2. (1) For the purpose of this Act, there shall be the following groups:—

- (a) a white group, in which shall be included any person who in appearance, obviously is, or who by general acceptance and repute is a white person, other than a person, who although in appearance obviously a white person, is by general acceptance and repute a coloured person, or who is in terms of sub-paragraphs (ii) and (iii) of paragraphs (b) and (c), or of the said sub-paragraphs read with paragraph (c) of this sub-section and paragraph (a) of sub-section (2), a member of any other group;
- (b) a native group, in which shall be included—
 - (i) any person who in fact or by general acceptance and repute is a member of an aboriginal race or tribe of Africa, other than a person who is, in terms of sub-paragraph (ii) or (iii) of paragraph (c) a member of the coloured group;
 - (ii) any person who habitually associates with persons who are in terms of sub-paragraph (i) members of the native group, as a member of any community of such persons, other than a person who is, in terms of sub-paragraph (ii) of paragraph (c) a member of the coloured group; and
 - (iii) any woman to whichever race, tribe or class she may belong, between whom and a person who is in terms of sub-paragraph (i) or (ii) a member of the native group, there exists a marriage or who cohabits with such a person;
- (c) a coloured group in which shall be included—
 - (i) any person who is not a member of the white group or of the native group;
 - (ii) any person who habitually associates with persons who are in terms of sub-paragraph (i) members of the coloured group, as a member of any community of such persons, other than a person who is in terms of sub-paragraph (iii) of paragraph (b), a member of the native group; and
 - (iii) any woman, to whichever race, tribe or class she may belong, between whom and a person who is in terms of sub-paragraph (i) or (ii) a member of the coloured group,

- there exists a marriage, or who cohabits with such a person; and
- (d) any group of persons which is under sub-section (2) declared to be a group.

(2) The Governor-General may by proclamation in the

Gazette—

- (a) define any ethnical, linguistic, cultural or other group of persons who are members either of the native group or of the coloured group; and
- (b) declare the group so defined to be a group for the purposes of this Act or of such provisions thereof as may be specified in the proclamation, and either generally or in respect of one or more group areas, or in respect of the controlled area or of any portion thereof so specified, or both in respect of one or more group areas and of the controlled area or any such portion thereof.

(3) A proclamation under paragraph (a) of sub-section (2) may provide that only persons who have in accordance with regulation been registered on application, or who have been registered under any other law, as members of the group referred to in the proclamation, shall be members thereof.

(4) A member of the native group or of the coloured group who is or becomes a member of any group defined under paragraph (a) of sub-section (2) shall, to the extent required to give effect to any proclamation under paragraph (b) of the said sub-section, be deemed not to be a member of the native group or of the coloured group, as the case may be.

Establishment Of Group Areas

3. (1) The Governor-General may, whenever it is deemed expedient, by proclamation in the Gazette—

- (a) declare that as from a date specified in the proclamation, which shall be a date not less than one year after the date of the publication thereof, the area defined in the proclamation shall be an area for occupation by members of the group specified therein; or
- (b) declare that, as from a date specified in the proclamation, the area defined in the proclamation shall be an area for ownership by members of the group specified therein.

(2) Proclamations under paragraphs (a) and (b) of sub-section (1) may be issued also in respect of the same area.

(3) No proclamation shall be issued under this section—

- (a) except with the prior approval in each case by resolution of both Houses of Parliament: Provided that any such proclamation may be issued without such approval—
- (i) if it is issued before the expiration of a period of five years from the commencement of this Act, in respect of an area in the province of the Cape of Good Hope or of Natal; or
- (ii) if it is issued in respect of an area in the province of the Transvaal for the coloured group or a group defined under sub-section (2) of section two, consisting of members of the coloured group, the whole or the greater part of which consists of an area assigned or set apart, as at the commencement of this Act, under paragraph (d) of section ten of the Municipal Amending Ordinance, 1905 (Ordinance No. 17 of 1905) of the Transvaal, or of land described in sub-section (10) of section one hundred and thirty-one of the Precious and Base Metals Act, 1908 (Act No. 35 of 1908) of the Transvaal;
- (b) unless in each case the Minister consulted the Administrator of the province concerned, and in the case of an area for a group other than the white group situate wholly or partly on land which, in terms of any law relating to mining, is proclaimed land or deemed to be proclaimed land, also the Minister of Mines, and in the case of an area situated wholly or partly within a controlled area as defined in section one of the Natural Resources Development Act, 1947 (Act No. 51 of 1947), also the Natural Resources Development Council established by section two of the said Act;
- (c) by which there would be included in any group area the whole or any part of—
- (i) any land situated in an area which is a scheduled native area or a released area in terms of the Native Trust and Land Act, 1936 (Act No. 18 of 1936);
- (ii) any location, native village or native hostel referred to in section two of the Natives (Urban Areas) Consolidation Act, 1945 (Act No. 25 of 1945), or any area approved for the residence of natives under paragraph (h) of sub-section (2) of section nine of the said Act;
- (iii) a coloured persons settlement as defined in section one of the Coloured Persons Settlement Act, 1946 (Act No. 7 of 1946);
- (iv) any mission station or communal reserve to which the provisions of the Mission Stations and Communal Reserves Act, 1909 (Act No. 29 of 1909) of the Cape of Good Hope, or of the said Act read with section sixteen of the Coloured Mission Stations and Reserves Act, 1949 (Act No. 12 of 1949), apply; or

- (v) any area which is a national park in terms of the National Parks Act, 1926 (Act No. 56 of 1926), or any land which forms part of such a park.

Occupation In Group Areas

4. (1) As from the date specified in the relevant proclamation under paragraph (a) of sub-section (1) of section three, and notwithstanding anything contained in any special or other statutory provision relating to the occupation of land or premises, no disqualified person shall occupy and no person shall allow any disqualified person to occupy any land or premises in any group area to which the proclamation relates, except under the authority of a permit.

(2) The provisions of sub-section (1) shall not render it unlawful for any disqualified person to occupy land or premises in any group area—

- (a) as a *bona fide* servant or employee of the State, a statutory body or any person (other than a disqualified company or a company referred to in section sixteen), lawfully occupying the land or premises;
- (b) as a *bona fide* visitor of any person lawfully residing on the land or premises or as a *bona fide* guest in an hotel;
- (c) as a *bona fide* patient in a hospital, nursing home, asylum, or similar institution, or an inmate of a prison, work colony, inebriate home or similar institution; or
- (d) as the husband wife, minor child or dependent (including a servant or employee) lawfully occupying such land or premises: Provided that the provisions of this paragraph shall apply in respect of any group area only if the Governor-General has by proclamation in the Gazette, declared them to apply in respect of that group area, and only to the extent and subject to the conditions (if any) which may be specified in the proclamation.

(3) Any provision in the title deed of any immovable property situate in any group area referred to in sub-section (1) prohibiting or restricting the occupation or use of such property by persons who are members of the group for which that area has been established shall lapse as from the date referred to in the said sub-section, and no such provision shall thereafter be inserted in the title deed of any such property.

Acquisition Of Immovable Property In Group Areas

5. (1) If any group area is in terms of paragraph (b) of sub-section (1) of section three a group area for ownership—

- (a) no disqualified person and no disqualified company shall, on or after the relevant date specified in the proclamation, acquire any immovable property situate within that area, whether or not in pursuance of any agreement or testamentary disposition entered into or made before that date, except under the authority of a permit: Provided that the provisions of this paragraph shall not render unlawful any acquisition of immovable property by a statutory body;
- (b) no disqualified company which is on the said date the holder of any immovable property situate within that area, shall hold that property after the expiration of a period of ten years from the said date, except under the authority of a permit;
- (c) no company which on or after the said date becomes or again becomes a disqualified company, shall hold any immovable property situate within that area which it has on or after the said date acquired otherwise than in pursuance of a permit, except under the authority of a permit;
- (d) any provision in the title deed of any immovable property situate in that area prohibiting or restricting the acquisition of such property by persons who are members of the group for which that area has been established, shall lapse as from the said date, and no such provision shall thereafter be inserted in the title deed of any such property.

(2) Sub-section (1) shall apply notwithstanding anything contained in any special or other statutory provision relating to the acquisition or holding of immovable property, but the said sub-section shall not affect the application of any statutory provision relating to the acquisition, holding or disposal of any right to prospect for or mine any mineral.

(3) Any agreement or any provision in a testamentary disposition entered into or made on or after the date referred to in paragraph (a) of sub-section (1), by which any person purports to acquire or hold or would acquire or hold any immovable property in contravention of sub-section (1), shall be null and void.

Governing Body For Certain Group Areas

6. (1) The Minister may by notice in the Gazette, establish for any group area (other than an area for the white group) a governing body to be constituted in accordance with regulation.

(2) Such governing body may consist wholly or mainly of members of the group for which the group area has been established and shall have such powers and functions as may be prescribed by regulation, and shall exercise its powers and functions, where the group area concerned is wholly or partly within the area of jurisdiction of a local authority, subject to such supervision (if any) by that local authority as may be prescribed by regulation, and where the group area concerned is partly within the area of jurisdiction of one local authority, and partly within the area of jurisdiction of any other

local authority or wholly outside the area of jurisdiction of any local authority, subject to such supervision (if any) by a local authority designated by the Minister, as may be so prescribed.

(3) The establishment of a governing body under this section shall not divest any local authority, in respect of the group area concerned, of any powers or functions not vested in such governing body.

(4) The Minister shall exercise his powers under this section after consultation with the Administrator of the province concerned.

Measures To Ensure Proper Municipal Administration In Certain Areas

7. (1) The Minister may, if he is of opinion that any area referred to in paragraph (d) of article two of Law No. 3 of 1885 of the Transvaal, or in section ten of the Municipal Amending Ordinance, 1905 (Ordinance No. 17 of 1905) of the Transvaal or any group area (other than an area for the white group) which is situate within the area of jurisdiction of an urban local authority, is not properly administered by that local authority, request the Administrator of the province concerned to cause an enquiry to be held (at which the said local authority shall be afforded an opportunity of being heard) and thereafter the said Administrator may, by notice in writing, call upon such local authority, forthwith to carry out any work defined in the said notice which the said local authority has power to carry out and which is, in the opinion of the Administrator, necessary for the proper administration of that area, and if such local authority fails to comply with that notice the Administrator may himself cause that work to be carried out and may for that purpose authorize any person to perform any act which the said local authority could lawfully perform.

(2) The Administrator may recover from the local authority concerned any expenditure incurred by him under this section—

- (a) by action in a competent court against the local authority in default; or
- (b) by levying a special rate upon all rateable property within the area of jurisdiction of the local authority in default; or
- (c) by deducting from any subsidy, grant or other moneys payable out of the Consolidated Revenue Fund or by the Administrator to the local authority in default.

or by all three or any two of such methods of recovery, and the Administrator's certificate shall be proof of the amount due by the local authority under this section, subject to an appeal to the Minister, whose decision shall be final.

Restrictions On Certain Agreements Relating To Immovable Property In Controlled Area

8. (1) No person shall, except under the authority of a permit enter into any agreement, whether in his own behalf or on behalf or in the interest of any other person, in terms whereof any disqualified person or any disqualified company acquires or purports to acquire or would acquire any immovable property situate in the controlled area.

(2) Sub-section (1) shall not apply in respect of the acquisition, in accordance with the provisions of the Native Trust and Land Act, 1936 (Act No. 16 of 1936) or of the Natives Urban Areas Consolidation Act, 1945 (Act No. 25 of 1945), of immovable property by, or from a native as defined in the said Act.

(3) For the purposes of sub-section (1) a sheriff, deputy-sheriff, messenger of the court, trustee, executor, liquidator, curator or administrator dealing with immovable property in his capacity as such, or any other person dealing with immovable property in a representative capacity, shall be deemed to be acting on behalf or in the interest of the person in whose name the property is registered.

(4) Any agreement entered into in contravention of sub-section (1) shall be null and void.

Restrictions On Holding Of Immovable Property In Controlled Area By Companies

9. (1) If at the commencement of this Act a company of any group holds immovable property in the controlled area and thereafter becomes a company of another group, its hall not hold that property, except under the authority of a permit.

(2) If after the commencement of this Act a company of any group acquires immovable property in the controlled area, and thereafter becomes a company of another group, it shall not hold that property, except under the authority of a permit, unless it lawfully acquired the property from a member or company of such other group.

(3) For the purposes of this section a company shall be a company of a group, if a controlling interest in that company is held or deemed to be held by or on behalf or in the interest of a member of that group.

Restrictions On Occupation Of Land In Controlled Area

10. (1) No disqualified person shall occupy and no person shall allow any disqualified person to occupy any land or premises in the controlled area, except under the authority of a permit.

(2) The provisions of sub-section (1) shall not render it unlawful for any disqualified person to occupy any land or premises—

- (a) in pursuance of any right conferred by or under any statute;

- (b) under any agreement entered into or under any testamentary disposition made on or before the 24th day of April, 1950, or in the case of land or premises which have by virtue of any proclamation under section thirty-three, ceased to be subject to the operation of a proclamation under section eleven, under any agreement entered into or under any testamentary disposition made while the land or premises were subject to the operation of such last-mentioned proclamation, or under any renewal of any such agreement to which any party thereto is in terms thereof entitled;

- (c) by virtue of any prescriptive title acquired at or before the commencement of this Act;

- (d) under any arrangement entered into under the Housing Act, 1920 (Act No. 35 of 1920) or under any regulations made under the Housing (Emergency Powers) Act, 1945 (Act No. 45 of 1945), if he is a member of the same group as the class of persons for which the dwelling or other building in question is intended;

- (e) as a bona fide servant or employee of the State, a statutory body or any person (other than a disqualified company, or a company referred to in section sixteen) lawfully occupying the land or premises;

- (f) as the bona fide visitor of any person lawfully residing on the land or premises or as a bona fide guest in an hotel;

- (g) as the bona fide patient in a hospital, nursing home, asylum, or similar institution, or an inmate of a prison, work colony, infirmary home, or similar institution; or

- (h) as the husband, wife, minor child or dependant of any person (including a servant or employee) lawfully occupying such land or premises.

(3) The Governor-General may by proclamation in the Gazette exclude any area defined in the proclamation, for the period specified therein, from the provisions of sub-section (1).

Application Of Sections 12 And 13

11. (1) The Governor-General may by proclamation in the Gazette declare that the provisions of sections twelve and thirteen shall, as from a date specified in the proclamation (in the said sections referred to as the specified date) apply in any portion of the controlled area so specified (in the said sections referred to as a specified area)

(2) As from such date, the provisions shall, notwithstanding anything contained in any special or other statutory provision relating to the occupation of land or premises, apply in any such portion of the controlled area, and the provisions of section ten shall, while the first-mentioned provisions so apply, be suspended in respect of that portion of the controlled area.

(3) Upon the establishment of any group area, the relevant proclamation under this section shall cease to have any effect in respect of so much of any such portion of the controlled area as may be comprised by or included in that group area.

Restriction On Occupation Of Land Or Premises In Area Specified Under Section 11

12. (1) As from the specified date, no person who is a member of any group shall occupy and no person shall allow any such person to occupy any land or premises in a specified area which was not lawfully occupied and is not under section thirteen deemed to have been occupied at the said date by a person who is a member of the same group, except under the authority of a permit.

(2) The provisions of paragraphs (c), (f), (g) and (h) of sub-section (2) of section ten shall *mutatis mutandis* apply in respect of the occupation of land or premises in a specified area.

Buildings Erected Or Completed After Specified Date, And Buildings, Land Or Premises Unoccupied At That Date

13. (1) (a) If after the specified date any building is erected or completed on any land or premises situated in a specified area elsewhere than in an area defined by proclamation under paragraph (a) of sub-section (3), or if at the said date any building, land or premises in a specified area are unoccupied, such building, land or premises shall, if any person other than a body corporate is the owner thereof, be subject to the provisions of sub-sections (2), (3), (4), (5) and (7), for the purposes of section twelve be deemed to have been occupied at the specified date by the person who is the owner thereof.

(b) If a body corporate is the owner of such building, land or premises, or if at the said date such building, land or premises are not lawfully occupied, the Minister shall, subject to the provisions of sub-section (3), on the written application of the owner, determine the group by a member of which the building, land or premises shall for the said purposes be deemed to have been occupied at the specified date.

(2) If after the specified date any building on land or premises situated in a specified area elsewhere than in an area defined by proclamation under paragraph (a) of sub-section (3), is demolished and any other building erected in its stead on the same site, or any such building is extended, the building so erected or extended shall, subject to the provisions of sub-sections (3), (4), (5) and (7), for the purposes of section twelve be deemed to have been occupied at the

specified date by the person who last lawfully occupied the demolished or extended building before the demolition or extension.

- (3) (a) The Governor-General may by proclamation in the *Gazette* define any area in a specified area for the purposes of paragraph (b).
 (b) The Minister shall, on the written application of the owner of any building which is completed, erected (whether or not in the stead of a demolished building) or extended in an area defined in any such proclamation, after the date of publication thereof, or of any land or premises in any such area which is or are unoccupied or not lawfully occupied on the said date, determine the group by a member of which such building, land or premises shall, for the purposes of section *twelve*, be deemed to have been occupied at the specified date.
 (c) Until a determination is made under paragraph (b) in respect of any building referred to therein, such building shall, for the purposes of section *twelve*, be deemed to have been unoccupied at the specified date.
 (d) If in terms of any determination under paragraph (b) any building, land or premises, is deemed to have been occupied by a member of the native group or of the coloured group, and a group consisting of members of such group is after such determination established under sub-section (2) of section *two*, the Minister may, on like application, withdraw the determination and under the said paragraph determine that such building, land or premises shall be deemed to have been occupied by a member of such last-mentioned group.
 (4) Any dwelling or other building in a specified area which has been constructed under the Housing Act, 1920 (Act No. 35 of 1920) or under any regulations made under the Housing (Emergency Powers) Act, 1945 (Act No. 45 of 1945), shall for the purposes of section *twelve* be deemed to have been occupied at the specified date by a person who is a member of the same group as the class of persons for which such dwelling or building is intended.
 (5) If the title deed of any building, land or premises in a specified area contains any condition which prohibits or restricts the occupation thereof by persons of one or more groups, the Minister shall not make any determination under sub-section (3) which would be contrary to any such condition.
 (6) The Minister may, whenever for any reason he deems it expedient to do so, postpone the making of a determination under sub-section (2) or paragraph (b) of sub-section (3) for such period as he may deem fit.
 (7) If any permit is issued in respect of the occupation of any land or premises in a specified area, such land or premises shall, unless it is specifically otherwise stated in the permit, as from the commencement of such occupation in pursuance of the permit, for the purposes of section *twelve* be deemed to have been occupied at the specified date by a person who is a member of the same group as the person in respect of whose occupation the permit is issued.

- (8) (a) If at the specified date there exists any determination under sub-section (2) or paragraph (b) of sub-section (4) of section *six* of the Asiatic Land Tenure Act, 1946 (Act No. 28 of 1946), in respect of any building, land or premises in a specified area, and such building, land or premises remain unoccupied or the erection or extension of such building has not been completed, such determination shall be deemed to have been made under the relevant provisions of this section: Provided that any reference in the determination to a person who is not an Asiatic, shall be deemed to be a reference to a member of the white group, and any reference therein, to a person who is an Asiatic, shall be deemed to be a reference to a member of the coloured group.
 (b) If at the said date there exists any permit under section *eight* of the said Act authorizing the occupation of land or premises in a specified area, and such land or premises are not occupied in pursuance of the permit, the permit shall be deemed to have been issued under the relevant provision of section *fourteen* of this Act.

Permits And Determinations

14. (1) The Minister may, subject to the provisions of sub-section (2), in his discretion, on written application made therefor—
 (a) direct that a permit be issued, subject to such conditions as he may determine, to be signed by an officer thereto appointed by him, authorizing—
 (i) the acquisition or holding of immovable property in a group area or in the controlled area; or
 (ii) the occupation of or the granting of permission to occupy any land or premises in a group area, in the controlled area or in a specified area referred to in section *twelve*; and
 (b) direct that the conditions of a permit be amended or that it shall be available for a portion only of the land or premises in respect of which it has been issued.
 (2) The Minister shall not direct that any permit be issued under sub-section (1)—
 (a) authorizing the acquisition or holding of immovable property or the occupation of land or premises in a group area unless he is of opinion that the refusal of the permit would cause

undue hardship or that the issue of the permit would be in the interest of the group for which the group area has been established; or

- (b) authorizing any person to acquire, hold or occupy any land or premises contrary to any provision in the title deed which prohibits or restricts the acquisition, holding or occupation of the land or premises by persons belonging to any group or class.
 (3) In directing that a permit be issued or that the conditions thereof be amended under sub-section (1) and in making a determination under section *thirteen*, the Minister may take into consideration the relative needs of any group concerned, in regard to housing, the amenities of life and educational and recreational facilities, trading and industrial undertakings, the situation of the immovable property, land or premises in relation to other property, land or premises owned or occupied by members of any group, and any other matters which in his opinion are relevant to the question whether or not any such permit should be issued or an amendment of the conditions thereof should be made or how any such determination should be made.
 (4) A permit authorizing the holding of immovable property or the occupation of land or premises, may be issued for an indefinite or a specified period or until withdrawn at the discretion of the Minister.
 (5) A permit authorizing the acquisition of immovable property by a company referred to in section *sixteen* may be issued—
 (a) in respect of any particular immovable property; or
 (b) in respect of immovable property in any area specified in the permit; or
 (c) in respect of immovable property in general; and
 (d) in the cases referred to in paragraphs (b) and (c), either for a specified period or until withdrawn at the discretion of the Minister: Provided that upon the expiration of any such period or the withdrawal of the permit, the conditions of the permit shall continue to apply in respect of any immovable property acquired under the authority thereof.
 (6) A permit authorizing the occupation of any land or premises in the controlled area by any employee of a company referred to in paragraph (a) of sub-section (2) of section *four* or in paragraph (c) of sub-section (2) of section *ten*, or the granting of permission to any such employee to occupy such land or premises, may be issued in respect of any individual employee or in respect of any class of employees specified in the permit, and in the latter case either for a specified period or until withdrawn at the discretion of the Minister.
 (7) There shall be payable to the Minister in respect of every application for a permit which is submitted within two years after the date of any previous application relating to the same land or premises, or any portion of such land or premises, which has been refused, a fee of twenty-five pounds: Provided that the Minister may after consideration of any such application, in his discretion, refund to the applicant out of moneys to be appropriated by Parliament for the purpose, an amount equal to the amount so paid or any portion thereof as he may deem fit.
 (8) Any permit shall lapse if, in the case of a permit authorizing the acquisition of immovable property by agreement, the agreement is not entered into, or if, in the case of a permit authorizing the occupation of land or premises, the land or premises are not occupied, in pursuance of the permit, within a period of six months after the issue thereof or within such further period as the Minister may allow on an application lodged with him prior to the expiration of such first-mentioned period.
 (9) If any land or premises in respect of which a permit has been issued under sub-paragraph (ii) of paragraph (a) of sub-section (1) is occupied or used contrary to any condition subject to which the permit was issued, the Minister may, after not less than one month's notice to the holder of the permit, revoke the permit.

Shares And Debentures Of Private Companies

15. (1) Whenever a private company holds any immovable property, any share in or debenture of that company held by or pledged to a person who or a company which is a disqualified person or a disqualified company in relation to that property (other than a banking institution as defined in the Banking Act, 1942 (Act No. 38 of 1942)), or by or to any person on behalf or in the interest of such a person or company, shall be forfeited to the State.
 (2) It shall be the duty of the secretary and every director of any company referred to in sub-section (1), which holds any immovable property, to notify the registrar of companies whenever any person who or company which is a disqualified person or disqualified company in relation to that property or any other person on behalf or in the interest of such a person or company, holds any share in or debenture of such first-mentioned company.
 (3) The provisions of sub-section (1) and (2) shall not apply in respect of any shares in or debentures of a private company—
 (a) which are held immediately after the commencement of this Act by a disqualified person or a disqualified company, or immediately after the date specified in the relevant proclamation under paragraph (b) of sub-section (1) of section *three* by a person who or a company which, as a result of such proclamation, becomes a disqualified person or a disqualified company in relation to any immovable property held by

such private company, while such shares or debentures are held by such person or company; or

- (b) Which are held by a disqualified person, if he inherited them from a disqualified person who lawfully held them; or
- (c) which are held by a disqualified person who or a disqualified company which lawfully holds any other shares in or debentures of that company, if such person or company acquired such first-mentioned shares or debentures from a disqualified person who or a disqualified company which lawfully held them:

Provided that nothing in this sub-section contained shall affect the application of sub-sections (1) and (2) in respect of any shares or debentures unlawfully held at the commencement of this Act.

(4) If any share in or a debenture of any company has been forfeited under sub-section (1), the secretary of the company shall make such entries in any register, book or document under the control of the company and issue such document as the registrar of companies may direct for the purpose of giving effect to the forfeiture.

(5) For the purpose of this section no person shall, by reason of the establishment of a group area, be a disqualified person in relation to immovable property in that area, unless that area is in terms of a proclamation under paragraph (b) of sub-section (1) of section three, a group area for ownership.

Companies With Bearer Shares Or Debentures

16. (1) No company which has issued any shares or share warrants or debentures entitling the bearer thereof to any rights in regard thereto, and no company wherein a controlling interest is held by or on behalf or in the interest of any such company, shall acquire immovable property, situated in the controlled area or in any group area, except under the authority of a permit.

(2) If any company referred to in sub-section (1) holds any immovable property in the controlled area, the Minister may, after not less than three months' notice in writing to the company, declare the company, by notice in the *Gazette*, to be a company wherein a controlling interest shall, for the purposes of section ten, be deemed to be held by a member of a group specified in the notice, and thereupon the company shall for the said purposes be deemed to be such a company, and it shall further for the said purposes be deemed that no controlling interest in the company is held by or on behalf or in the interest of any member of any other group.

Declaration As To Controlling Interest In Companies

17. (1) If it appears to the Minister that there is reason to presume that a controlling interest in any company is held by or on behalf or in the interest of any member of any group, he may by notice in writing call upon that company to furnish him, within a period specified in the notice, with such particulars in regard to the control of that company, as may be so specified.

(2) If the company fails to comply with any such notice within the said period or within such further period as the Minister may allow, or the said notice has been complied with, and the Minister is satisfied that a controlling interest in the company was at the date of such notice held by or on behalf or in the interest of any member of any group, he may by notice in the *Gazette* declare that for the purposes of this Act, it shall be a company wherein a controlling interest is held by or on behalf or in the interest of a member of that group, and thereupon the company shall for the said purposes be deemed to be such a company, and it shall further for the said purposes be deemed that no controlling interest in the company is held by or on behalf or in the interest of any member of any other group.

(3) The company shall be notified of such declaration and may, within a period of two months after a date specified in the notification, apply to any provincial division of the Supreme Court having jurisdiction for an order setting aside the notice referred to in sub-section (2), and the court may set aside the notice if the company proves that it is not a company wherein a controlling interest was, either at the date of the notice under sub-section (1) or at the date of the notice under sub-section (2), held by or on behalf or in the interest of any member of the group in question.

(4) The operation of a notice under sub-section (3) shall, in respect of immovable property, shares or debentures held by or pledged to the company at the date of the notice, be suspended until the expiration of the period referred to in sub-section (3), or if an application is made under the said paragraph, until the application has been disposed of.

(5) A notice under sub-section (1) or (3) shall, in the case of a foreign company (as defined in section two hundred and twenty-nine of the Companies Act, 1926 (Act No. 46 of 1926)), be deemed to have been effectually given—

- (a) if served upon a person who is, in regard to the company concerned, authorized as provided in paragraph (c) of sub-section (1) of section two hundred and one of the said Act; or
- (b) where there is no such person in the Union, if given in the manner which, in the opinion of the Minister, is best calculated to bring it to the knowledge of the company concerned,

Certain Provisions In Regard To Immovable Property To Be Null And Void

18. Any condition or provision in any document whatsoever, empowering or purporting to empower any disqualified person or any disqualified company to exercise any influence upon the transfer of immovable property, shall be null and void: Provided that where at the time such condition or provision was made, the person or company concerned was not a disqualified person or a disqualified company, as the case may be, in relation to the property in question, it shall be revived if such person or company ceases to be a disqualified person or a disqualified company in relation to that property.

Acquisition And Holding Of Property For Other Person

19. No person shall acquire or hold on behalf or in the interest of any person any immovable property which such other person may not lawfully acquire or hold in terms of this Act.

Disposition Of Property Illegally Held

20. (1) If any immovable property—

- (a) is acquired or held in contravention of any provision of this Act or in pursuance of any agreement which is null and void in terms of this Act, or is dealt with or used contrary to any condition of a permit under the authority of which it has been acquired or is held; or
- (b) has at the commencement of this Act been acquired or is at the said commencement held in contravention of any provision of any law repealed by this Act or in pursuance of any agreement which is null and void in terms of any such provision, or is dealt with or used contrary to any condition of a permit or any term of a certificate issued under any such provision, under the authority of which it was acquired or held,

the Minister may, after not less than three months' notice in writing to the person concerned, cause the property to be sold either out of hand upon the terms and conditions agreed to by the person concerned and approved by the Minister, or by public auction upon such terms and conditions as the Minister may determine.

(2) The costs of such sale (including a sale out of hand) shall be a first charge upon the proceeds thereof and any balance shall be applied towards the payment of any debt which the payment is secured by such property, in its legal order or priority, and any balance left thereafter shall be paid—

- (a) in the case of property referred to in paragraph (b) or (c) of subsection (1) of section five of this Act or in section three of the Asiatic Land Tenure Act, 1946 (Act No. 28 of 1946), to the company concerned; and
- (b) in any other case, unless the Minister otherwise directs, into the Consolidated Revenue Fund:

Provided that if the property has been acquired or is held in contravention of section nineteen of this Act, the proceeds thereof shall not be applied directly or indirectly towards the payment of any debt to the person on whose behalf or in whose interest the property has been acquired or is held.

(3) A copy of every notice under sub-section (1) shall be transmitted to the officer in charge of the deeds registry concerned, and the said officer, shall, upon receipt thereof, note thereon the day and hour of its receipt, and note in the appropriate registers that such a notice has been given in respect of the immovable property in question.

(4) Subject to the provisions of sub-section (5), the said officer shall not after receipt by him of any such notice register any transfer, lease or mortgage or other encumbrance of such immovable property, except a transfer in pursuance of a sale under sub-section (1).

(5) If any such notice is withdrawn, a notice of the withdrawal shall be transmitted to the said officer, and upon receipt of such notice or upon the transfer of the immovable property in pursuance of a sale under sub-section (1), any entry made under sub-section (3) shall be cancelled.

(6) The Minister and any officer designated by him for the purpose, shall have power to do whatever may be necessary to effect the transfer of any property sold under sub-section (1) to the purchaser thereof.

(7) If the owner of the property fails to produce the title deed thereof, the officer in charge of the deeds registry shall nevertheless pass transfer of the property and note the transfer on the duplicate title deed filed in his office and in the appropriate registers.

(8) The provisions of this section shall apply notwithstanding anything to the contrary contained in the Administration of Estates Act, 1913 (Act No. 24 of 1913), the Companies Act, 1926 (Act No. 46 of 1926), the Farmers' Assistance Act, 1935 (Act No. 48 of 1935) or the Insolvency Act, 1936 (Act No. 24 of 1936).

Issue Of Certificates By Surveyors-General

21. (1) A Surveyor-General may at the request of any person and upon payment by such person to the Surveyor-General of such fee as may be prescribed by regulation, issue to that person a certificate, in such form as may be so prescribed, stating that any land described therein, within his area of jurisdiction, is situated within the controlled area or within any group area so described.

(2) A certificate issued under sub-section (1) shall in all courts of law and public offices in the Union be *prima facie* evidence of the facts stated therein.

Restriction Upon Registration Of Immovable Property

22. No officer in charge of any deeds registry shall register any transfer of any immovable property situated in the controlled area or in any group area, if the transferee may not lawfully acquire and hold such immovable property in terms of this Act.

Trading Licences Not To Be Issued Except Upon Production Of Certain Proof

23. (1) No officer entrusted by law with the issue of any licence to carry on any business, trade or occupation shall issue or renew any such licence unless the person applying therefor proves that the proposed holder of such licence and the person or persons who will be in actual control of the business, trade or occupation to be licensed may lawfully carry on the business, trade or occupation on the premises whereon it is to be carried on.

(2) Any person whatever may within two months after the issue or renewal of any such licence, and any applicant for such a licence or the renewal thereof whose application has been refused under sub-section (1), may, within two months after the refusal, note an appeal against the decision of the officer concerned to the magistrate of the district wherein the premises referred to in sub-section (1) are situated.

(3) The magistrate may on dealing with such appeal—

- hear any evidence which such officer heard;
- cancel any licence issued by such officer or order such officer to accept, for the purposes of the application for the issue or renewal of a licence, that the proof required by sub-section (1) has been given; and
- make *mutatis mutandis* such order as to the costs of the appeal as he could have made if the appeal had been a civil trial in his court.

(4) Such cost shall be taxable, *mutatis mutandis* in the same manner as costs incurred in connection with such a trial.

(5) The decision of the magistrate on any such appeal shall be subject to an appeal to the provincial division of the Supreme Court having jurisdiction, as if it were a civil judgment of a magistrate's court.

Establishment Of Land Tenure Advisory Board

24. (1) There is hereby established a board to be known as the Land Tenure Advisory Board, which shall consist of not more than seven members appointed by the Minister.

(2) One of the members shall be designated by the Minister as the chairman and one as vice-chairman of the Board.

(3) A member of the board shall be appointed for such period, not exceeding five years as the Minister may determine at the time of his appointment and any member whose office become vacant (otherwise than under sub-section (4)), shall be eligible for reappointment.

(4) A member of the board shall cease to hold his office—

- if his estate is sequestrated or if a notice with reference to him is published under sub-section (1) of section *ten* of the Farmers' Assistance Act, 1935 (Act No. 48 of 1935);
- if he becomes of unsound mind or is convicted of an offence and sentenced to imprisonment without the option of a fine;
- if he is absent from three consecutive meetings without the permission of the chairman; or
- if he is removed from his office by the Minister on the ground of incapacity or misbehaviour.

(5) A casual vacancy on the Board shall be filled by the appointment of a member for the unexpired portion of the period for which the member whose office has become vacant, has been appointed.

(6) A member of the board (other than a person who is in the full-time employment of the State and in receipt of a salary from public funds) shall, and any such lastmentioned person may, receive such remuneration and allowances as the Minister in consultation with the Minister of Finance, may determine.

Meetings And Quorum

25. (1) The meetings of the board shall, subject to the provisions of sub-section (2), be held at such times and places as the board may fix.

(2) The chairman may at any time call a special meeting of the board to be held at such time and place as he may direct.

(3) A quorum for a meeting of the board shall be three of the members thereof.

(4) Whenever the chairman is absent or unable to fulfil his duties, the vice-chairman shall act as chairman during such absence or inability, and in the absence from any meeting of the board of the chairman and the vice-chairman, the members present at that meeting may elect one of their number to preside at that meeting.

(5) The decision of the majority of the members present at a meeting of the board shall be the decision of the board: Provided that in the event of an equality of votes, the person presiding at the meeting shall have a casting vote in addition to his deliberative vote.

Supplement to 'Indian Opinion', 12th May, 1950

Consideration By Minister Of Reports Of Board

26. The Minister shall not make any determination under section *thirteen*, or issue or revoke any permit under section *fourteen*, or amend any of its conditions, unless he has considered a report made by the board under section *twenty-seven* in regard thereto.

Functions Of Board

27. (1) The board shall enquire into and by means of a written report advise the Minister in regard to—

- the desirability or otherwise of issuing, amending or withdrawing—
 - any proclamation under sub-section (2) of section *two*; or
 - any proclamation under sub-section (1) of section *three*, sub-section (3) of section *ten*, sub-section (1) of section *eleven* or sub-section (3) of section *thirteen* in respect of any area;
- any determination to be made under section *thirteen*;
- the issue of or amendment of the conditions of any permit under section *fourteen*; and
- any matter relating to the administration of this Act which the Minister may refer to it.

(2) Before advising the Minister as to any proclamation under sub-section (1) of section *three* or as to any matter referred to in paragraph (b) or (c) of sub-section (1); the board shall publish in a newspaper circulating in the district in which the area concerned will be or the land or premises concerned are situated, a notice setting forth the matter which is being investigated (including in the case of any such area, the proposed situation or the approximate proposed situation thereof or the place within the district where a plan showing such situation may be inspected) and inviting all persons who have an interest therein to lodge with the board at an address specified in the notice and within a period so specified (which shall not be less than ten days after the last publication of the notice) any representations in writing which they may wish to make to the board in connection with such matter.

(3) The publication of a notice referred to in sub-section (2) shall not, unless the Minister so directs, be required in respect of the issue of a permit, if the board is satisfied that the issue of the permit is not necessary under the provisions of this Act or that a permit previously issued in respect of the same land or premises, or any portion thereof, has lapsed by virtue of the provisions of sub-section (7) of section *fourteen*.

(4) If the Minister so directs, the board shall comply with the provisions of sub-section (2) also in regard to any proclamation under sub-section (3) of section *ten*, sub-section (1) of section *eleven* or sub-section (3) of section *thirteen*, or to any matter referred to in sub-paragraph (i) of paragraph (a) or paragraph (d) of sub-section (1), or shall follow such other procedure for bringing the matter (including any matter to be dealt with by any such proclamation) to the notice of interested persons, as the Minister may determine.

Powers Of The Board

28. (1) The board may—

- for the purpose of any enquiry conducted by it, summon any person who in its opinion may be able to give material information concerning the subject of the enquiry, or who it suspects or believes has in his possession or custody or under his control any book, document or thing which has or may have any bearing upon the subject of the enquiry, to appear before it at a time and place specified in the summons, to be interrogated and to produce that book, document or thing, and the board may retain for examination any book, document or thing so produced;
- by its chairman administer an oath to, or accept an affirmation from, any person present at the enquiry who was or might have been summoned in terms of this section, and may interrogate him or allow him to be interrogated by any person to whose application the enquiry relates or of any person who has lodged representations in pursuance of the notice under sub-section (2) or (4) of section *twenty-seven* or on behalf of any such person by any person entitled in or as an advocate or attorney in a court of law in the Union, and require him to produce any book, document or thing in his possession or custody or under his control. Provided that in connection with the interrogation of any such firstmentioned person, or the production of any such book, document or thing, the law relating to privilege, as applicable to a witness subpoenaed to give evidence or to produce any book, document or thing before a court of law, shall apply;

(2) A summons for the attendance before the board of any person or for the production of any book, document or thing shall be in writing signed by the chairman or the secretary of the board and shall be served by registered post.

Investigations By Individual Members And Committees Of Board

29. (1) The board may authorize any member thereof, or any committee appointed by it consisting of two or more of its members, or (with the approval of the Minister) of one or more of its members and one or more other persons, to conduct any enquiry which the board may deem necessary for the proper carrying out of its functions, and any member or committee so authorized shall for the purpose of such enquiry exercise all the powers conferred and perform all the duties imposed upon the board in respect of any such enquiry conducted by it.

(2) In appointing a committee under sub-section (1), the board shall designate one of the members thereof who is a member of the board, to be the chairman.

(3) A summons under section *twenty-eight* read with sub-section (1) for the attendance before any member of the board or before any committee conducting an enquiry under the said sub-section, or for the production of any book, document or thing, may be signed by such member or by the chairman of the committee, as the case may be.

Assignment Of Officers To Board

30. The Minister may assign to the board an officer in his department to be the secretary, and such other officers in his department as may be necessary to enable the board to carry out its functions.

Appointment And Powers Of Inspectors

31. (1) The Minister shall, subject to the law governing the public service, appoint such inspectors (one of whom shall be the chief inspector) as may be necessary for the purpose of ascertaining such facts as may be required by the Minister, the board, any officer in charge of a deeds registry or any officer referred to in section *twenty-three*, in connection with the application of this Act, and of ascertaining whether the provisions of this Act and of any other statute prohibiting or restricting the ownership, acquisition or occupation of land by any class of persons are being complied with.

(2) Any such inspector may for any such purpose—

- (a) without previous notice, at any time during the day or night, enter upon any premises whatsoever and make such examination and enquiry as may be necessary;
- (b) at any time and at any place require from any person who has the possession, custody or control of any book, record or other document, the production thereof, then and there at a time and place fixed by the inspector;
- (c) examine and make extracts from and copies of any book, record or document, and require from any person an explanation of any entries therein, and seize any such book, record or document, as in his opinion may afford evidence of a contravention or evasion of any provision referred to in sub-section (1);
- (d) question either alone or in the presence of any other person as he thinks fit, with respect to any matter relevant to any such purpose, any person whom he finds on any premises entered under this section;
- (e) require any person who he has reasonable grounds for believing to be in possession of information relevant to any such purpose; to appear before him at a time and place fixed by him and then and there question that person concerning any matter relevant to any such purpose.

(3) An inspector exercising any power under paragraph (d) or (e) of sub-section (2) shall keep a record of any statement made to him, and the person who made the statement shall be entitled to a copy of the statement as so recorded.

(4) Any person who is questioned under paragraph (d) or (e) of sub-section (2) shall be entitled to all the privileges of which a person giving evidence before a court of law is entitled.

(5) Every person occupying or residing upon any premises entered by an inspector under sub-section (2) or employed by any such person, shall at all times furnish such facilities as are required by the inspector for the purpose of exercising his powers under the said sub-section.

(6) An inspector entering any premises under sub-section (2) may be accompanied by an interpreter or any member of the South African Police.

(7) Every such inspector shall be furnished with a certificate signed by an officer thereto designated by the Minister stating that he has been appointed as an inspector under this section, and any inspector exercising any power, conferred upon him by this section shall on demand produce such certificate.

Observation Of Secrecy

32. (1) No inspector and no interpreter or member of the South African Police referred to in sub-section (6) of section *thirty-one*, shall disclose any information in relation to the financial or business affairs of any person, firm or business, acquired in the exercise of his powers or in the performance of his duties, to any person, except—

- (a) to the Minister or a member of the board or any committee thereof or an officer in the public service for the purposes of the performance of any duty in connection with any matter investigated under the said section; or
- (b) for the purpose of the performance of his duties; or

(c) for the purpose of the institution of any legal proceedings or when required to do so before a court or under any law.

(2) No member of the board or of any committee thereof and no such officer shall disclose any information received by him under sub-section (1), to any person, except for a purpose referred to in paragraph (b) or (c) of the said sub-section.

Withdrawal And Amendment Of Proclamations And Notices

33. Whenever the Governor-General or the Minister, as the case may be, is by this Act authorized to issue any proclamation or notice, he may in like manner, whenever it is deemed expedient, withdraw or amend such proclamation or notice.

Penalties

34. (1) Any person who—

- (a) contravenes the provisions of sub-section (1) of section *four*, paragraph (b), (b) or (c) of sub-section (1) of section *five*, sub-section (1) of section *eight*, section *nine*, sub-section (1) of section *ten*, sub-section (1) of section *twelve*, sub-section (1) of section *sixteen* or section *nineteen*; or contravenes or fails to comply with any condition of a permit; or
- (c) contravenes or fails to comply with the provisions of sub-section (4) of section *fifteen*, sub-section (5) of section *thirty-one* or section *thirty-two*; or
- (d) having been summoned or called under section *twenty-eight* or under the said section read with section *twenty-nine*, fails, without sufficient cause to attend at the time and place specified in the summons or to remain in attendance until excused from further attendance, or refused to be sworn or to affirm as a witness; or
- (e) refuses or fails, without sufficient cause, to answer fully and satisfactorily to the best of his knowledge and belief any relevant question lawfully put to him at an enquiry under section *twenty-eight* or under the said section read with section *twenty-nine*, or to produce any book, document or thing in his possession or custody which he has been lawfully required to produce at such enquiry; or
- (f) having been sworn or having made an affirmation at any such enquiry, gives an answer to any relevant question lawfully put to him or makes relevant statement, which is false in any material particular, knowing such answer or statement to be false; or
- (g) falsely holds himself out to be an inspector; or
- (h) refuses or fails, without sufficient cause, to answer fully and satisfactorily to the best of his knowledge and belief any relevant question lawfully put to him by an inspector in the exercise of his powers; or
- (i) gives an answer to any such question or makes any relevant statement to an inspector, which is false in any material particular, knowing such answer or statement to be false; or
- (j) hinders or obstructs the chairman, the secretary or any member of the board or of a committee thereof, or any person nominated under paragraph (c) of sub-section (1) of section *twenty-eight* or under the said paragraph read with section *twenty-nine*, or any inspector, in the exercise of his powers or functions under this Act,

shall be guilty of an offence, and liable on conviction, in the case of an offence referred to in paragraph (a), (b) or (f), to a fine not exceeding two hundred pounds or to imprisonment for a period not exceeding two years, or to both such fine and imprisonment, and in the case of an offence referred to in any other paragraph, to a fine not exceeding one hundred pounds or to imprisonment for a period not exceeding one year or to both such fine and imprisonment.

(2) The court which convicts any person of a contravention of sub-section (1) of section *four*, sub-section (1) of section *ten* or sub-section (1) of section *twelve*, may order the person convicted to vacate the land or premises to which the conviction relates, on or before a date to be specified in such order but not less than fourteen days after the date of the conviction.

(3) Any person who fails to comply with an order made under sub-section (2), shall be guilty of an offence and liable on conviction to a fine not exceeding fifty pounds or to imprisonment for a period not exceeding six months, or to both such fine and imprisonment, and to a further fine not exceeding five pounds for every day during which the failure to comply with such order continued.

Presumptions

35. (1) A person who in appearance obviously is a white person shall for the purposes of this Act be presumed to be a member of the white group until the contrary is proved.

(2) A person who in fact or by general acceptance and repute is a member of an aboriginal race or tribe of Africa shall for the purposes of this Act be presumed to be a member of the native group until the contrary is proved.

(3) A person who is not in appearance obviously a white person and who is not in fact or by general acceptance and repute a member of an aboriginal race or tribe of Africa shall for the purposes of this Act be presumed to be a member of the coloured group until the contrary is proved.

(4) Whenever in any proceedings under this Act, whether civil or criminal, it is alleged by or on behalf of the Minister or any officer in charge of a deeds registry or in any indictment or charge that any company is a company wherein a controlling interest is held by a member of any group, that company shall be presumed to be such a company, until the contrary is proved.

Regulations

36. (1) The Governor-General may make regulations—
- as to the registration of any persons as members of any group referred to in any proclamation under sub-section (2) of section *two*;
 - as to the manner in which any governing body referred to in sub-section (1) of section *six*, is to be constituted (including the election of all or some of its members), the powers and functions of such governing body (including the power to levy rates and charges), the supervision to be exercised over such governing body by any local authority referred to in sub-section (2) of the said section, and the powers and functions of such local authority in any group area concerned;
 - prescribing the form of a certificate under section *twenty-one* and the fee payable in respect thereof;
 - prescribing requirements to be complied with in connection with the registration of immovable property for the purpose of ensuring compliance with the provisions of this Act; and generally, as to all matters which he considers it necessary or expedient to prescribe in order that the purposes of this Act may be achieved.
- (2) Different regulations may be made in respect of different groups and of different areas or provinces of the Union.
- (3) The regulations may provide for legal presumptions in regard to membership of any group established under sub-section (2) of section *two*, and may prescribe penalties for any contravention thereof or failure to comply therewith, not exceeding a fine of fifty pounds or imprisonment for a period of six months.
- (4) No regulations shall be made under paragraph (b) of sub-section (1), unless the Minister has consulted the Administrator of the province concerned.

Coming Into Operation Of This Act

37. (1) The provisions of this Act, in so far as they relate to the board or to inspectors, shall come into operation in the Union upon a date to be fixed by the Governor-General by proclamation in the *Gazette*, and in so far as they relate to any other matter, they shall come into operation in each province of the Union upon a date to be fixed for that province by the Governor-General by proclamation in the *Gazette*: Provided that in the case of the province of the Cape of Good Hope, the Governor-General may either fix a date for the province or by one proclamation or by more than one proclamation issued at different times, fix different dates for different areas within the said province.
- (2) Any reference in this Act to its commencement shall be construed in accordance with the provisions of sub-section (1).

Repeals

38. (1) Sections *ten* to and including *fifteen* and paragraphs (b) to and including (f) of sub-section (1) of section *sixteen* of the Asiatic Land Tenure Act, 1946 (Act No. 28 of 1946), sections *fourteen*, *fifteen* and *sixteen* of the Asiatic Land Tenure Amendment Act, 1949 (Act No. 53 of 1949), and section *four* of the Asiatic Land Tenure Amendment Act, 1950 (Act No. 15 of 1950), are hereby repealed as from the date fixed by the proclamation first referred to in section *thirty-seven*.

(2) Any reference in the first-mentioned Act or in any other law to the Land Tenure Advisory Board established by section *ten* of the said Act, shall, as from the said date, be deemed to be a reference to the board.

(3) The laws specified in the First Schedule are hereby amended to the extent set out in the second column of that Schedule, with effect as from the date fixed under section *thirty-seven* for the province of Natal, except in so far as any relevant provision referred to in the said column relates to land or premises in the province of Transvaal or in the territories referred to as the Northern Districts in section *three* of the Northern Districts Annexation Act, 1902 (Act No. 1 of 1902) of Natal.

(4) The laws specified in the Second Schedule are hereby repealed and amended to the extent set out in the second column of that Schedule, with effect as from the date fixed under section *thirty-seven* for the province of Transvaal, except in so far as any relevant provision referred to in the said column relates to land or premises in the province of Natal, with the exclusion of the said territories.

(5) As from the date fixed under section *thirty-seven* for any province of the Union, or for any area in the province of the Cape of Good Hope, the provisions of sub-section (1) of section *one* of the Natives Land Act, 1913 (Act No. 27 of 1913) shall cease to apply in respect of land in that province or area which is situated in the controlled area or in any group area.

Short Title

39. This Act shall be called the Group Areas Act, 1950.

First Schedule

Law amended.	Extent of amendment.
Transvaal Asiatic Land Tenure Amendment Act, 1936 (Act No. 30 of 1936).	The repeal of paragraphs (e) and (f) of sub-section (1), and sub-sections (4) and (5) of section <i>fourteen</i> .
Asiatic Land Tenure Act, 1946 (Act No. 28 of 1946).	The repeal of sections <i>one</i> to and including <i>four</i> sections <i>six</i> to and including <i>nine bis</i> , and sections <i>sixteen</i> , <i>seventeen</i> and <i>thirty-nine</i> .
Asiatic Land Tenure Amendment Act, 1949 (Act No. 53, 1949)	The repeal of sections <i>six</i> to and including <i>thirteen</i> , and sections <i>sixteen</i> , <i>seventeen</i> and <i>eighteen</i> .
Asiatic Land Tenure Amendment Act, 1950 (Act No. 15 of 1950).	The repeal of section <i>three</i> .

Second Schedule

Law repealed or amended.	Extent of repeal or amendment.
Law No. 3 of 1885 of the Transvaal.	The repeal of the whole.
The Asiatic (Land and Trading) Amendment Act (Transvaal), 1919 (Act No. 37 of 1919).	The repeal of the whole, except section <i>one</i> , so much of section <i>eleven</i> as defines and expression used in section <i>one</i> and <i>twelve</i> . The amendment of section <i>twelve</i> by the substitution for the words "Asiatics (Land and Trading) Amendment Act (Transvaal)" of the words "Gold Law (Coloured Persons) Amendment Act." The amendment of the long title by the deletion of the words "with reference to the prohibition of ownership of land by Asiatics and," and the substitution for the words "and trading by them" of the words "by coloured persons."
Asiatic (Cape Malay) Amendment Act, 1924, (Act No. 12 of 1924.)	The deletion in sub-section (1) of section <i>one</i> , of the words "Law No. 3 of 1885 of the Transvaal, of section <i>two</i> of the Asiatics (Land and Trading) Amendment Act (Transvaal), 1919 (Act No. 37 of 1919) or" and of the word "other."

Law repealed or amended	Extent of repeal or amendment
Asiatics in the Northern Districts of Natal Act, 1927 (Act No. 33 of 1927).	The repeal of section <i>fourteen</i> .
Transvaal Asiatic Land Tenure Act, 1932 (Act No. 35 of 1932).	The repeal of sections <i>seven</i> , <i>eight</i> and <i>nine</i> .
Transvaal Asiatic Land Tenure Amendment Act, 1936 Act No. 30 of 1936).	The repeal of sections <i>one</i> , <i>eight</i> , <i>nine</i> , <i>ten</i> and <i>eighteen</i> . The deletion of paragraphs (e) and (f) of sub-section (1), and sub-sections (4) and (5) of section <i>fourteen</i> .
Asiatic Land Tenure Act, 1946 (act No. 28 of 1946).	The repeal of sections <i>one</i> , <i>five</i> , <i>six</i> , <i>seven</i> , <i>eight</i> , <i>nine bis</i> , sections <i>sixteen</i> , to and including <i>nineteen</i> , sections <i>twenty-five</i> to and including <i>thirty-two</i> and sections <i>thirty-seven</i> and <i>thirty-nine</i> .
Asiatic Land Tenure Amendment Act, 1949 (Act No. 53, 1949).	The repeal of sections <i>one</i> to and including <i>five</i> , sections <i>ten</i> to and including <i>thirteen</i> , and sections <i>sixteen</i> to and including <i>nineteen</i> .
Asiatic Land Tenure Amendment Act, 1950 (Act No. 15 of 1950).	The repeal of sections <i>one</i> and <i>two</i> .

ગુરૂ એરિયાઝ બીલ

રથાવર મીલકતની માલીકી મેળવવા ઉપર અને જમીન અને મકાન માં વસવાટ કરવા ઉપર અંકુશ મુકવા વર્ગીય લાભો રથાવર અને તેને હાની બાબતો માટે વ્યવસ્થા કરનાર બીલ.

વ્યાખ્યાઓ

- (૧) આ કાયદામાં, તેના લખાણમાં જીલ્લા જ્યાંવાયેલું હોય તે સિવાય (૧) રથાવર મીલકતના સંબંધમાં "એકવાવર" (મેળવણું) શબ્દનો અર્થ ઠાક પણ પ્રકારે તેની મીલકતના માલીક બનવું એવો થાય છે;
- (૨) "મોડર્ન"નો અર્થ કલમ ચોવીસથી સ્થાપવામાં આવેલી લેન્ડ ટેન્ડર એજન્સીની મોડર્ન એવો થાય છે;
- (૩) "કંપની"માં ઠાક પણ ખાનગી કંપની, કલમ સોળમાં જ્યાંવાયેલી ઠાક પણ કંપની અને ૧૯૨૬ના ૪૬ નંબરના કંપનીઝ એક્ટની બંધો ઓગણી ચીસની કલમમાં વ્યાખ્યા કરવામાં આવેલી છે એવી ઠાક પણ પરદેશી કંપની નો સમાવેશ થાય છે;
- (૪) "કન્ટ્રોલ્ડ એરિયા"નો અર્થ ગુરૂ એરિયા અથવા જાહેર થયેલો તેવી એરિયા લોકેશન, તેવી વીલેજ, કલડ લોકો માટેનું સેલેજમેન્ટ, મીરાન રેસીડ અથવા કલમ ત્રણની પેટા કલમ (૩) ના પારિઆક્ટ (સી) માં જ્યાંવાયેલો કમ્યુનલ રીઝર્વ ન હોય તેવા ઠાક પણ તે લતા અને તેમાં, કલમ દસના અપવાદ સીવાય, કલમ અગીયારમાં જ્યાંવાયેલા ઠાક પણ ખાસ લતા નો સમાવેશ થાય છે. અપવાદ એ કે, ઠાક પણ ગુરૂ એરિયા, જે, કલમ ત્રણની પેટા કલમ (૧) ના પારિઆક્ટ (એ) ની રૂએ થયેલી જાહેરાત મુજબ વસવાટને માટેનો ગુરૂ એરિયા નહિ હોય, તે કન્ટ્રોલ્ડ એરિયામાં જમીન કે મકાનના વસવાટમાં સંબંધમાં, આ કાયદાના અર્થને માટે કન્ટ્રોલ્ડ એરિયાનો ભાગ ગણાયો, અને ઠાક પણ ગુરૂ એરિયા, જે ઉકત પેટા કલમમાં પારિઆક્ટ (બી) ની રૂએ થયેલી જાહેરાતથી માલીકીને માટેનો ગુરૂ એરિયા નહિ હોય તે, કન્ટ્રોલ્ડ એરિયામાં રથાવર મીલકતની માલીકી મેળવવાના સંબંધમાં આ કાયદાના અર્થને માટે કન્ટ્રોલ્ડ એરિયાનો ભાગ ગણાયો.
- (૫) ઠાક પણ કંપની ના સંબંધમાં "કન્ટ્રોલ્ડ ઇન્ટરેસ્ટ" નો અર્થ નીચે પ્રમાણે થાય છે.—

- (એ) તેના શેરોનો મોટા ભાગ; અથવા
- (બી) શેર કેપીટલના અરધા ઉપરના શેરો; અથવા
- (સી) સંઘના શેરોની પ્રથમે કોમિતની અરધી ઉપરની કોમિતના શેરો; અથવા
- (ડી) શેર ધરાવનારાઓ તેના અરધા ઉપરના નફાને અથવા પુછના અધિકારીની જેનેટલા શેરો; અથવા
- (ઇ) શેરો ધરાવનારાઓ મોટા ભાગના અથવા ઘણા ખરા વોટોના અધિકારી અને તેટલા શેરો; અથવા
- (એક) ઠાક લોન ઉપરથી ઉપરિચલ થયેલો કલેમ, જે તેની અરધી શેર કેપીટલની અરધી ઉપરની કોમિતનો હોય; અથવા
- (ઇ) કંપનીની પ્રવૃત્તિઓ અથવા કંપનીની પુછ ઉપર, (એ) થી (એક) સુધીના પારિઆક્ટમાં સુચવવામાં આવ્યા છે તેવા પકારના કે તે સિવાય ના ઠાક પણ બંધનના ઠાક પણ અન્ય કંપનીમાં કે ઠાક પણ બીજી રીતે, સીધી યા આકતરી રીતે લાભો રાખીને કંપની ઉપર અથવા કંપની ની પ્રવૃત્તિઓ કે તેની સુડી ઉપર ઠાક પણ બંધનનો અંકુશ ધરાવવાની સત્તા;

(૬) રથાવર મીલકત, જમીન અથવા મકાનના સંબંધમાં "ડીરેક્ટોલી-ઇલ્ડ (નાલાયક દેવેલી) કંપની"નો અર્થ એવી કંપની કે જેમાં, તેની મીલકત, જમીન કે મકાનના સંબંધમાં નાલાયક દેવેલા માણસ તરફથી અથવા તેની પત્ની અથવા તેના લાભમાં અંકુશ ધરાવવામાં આવતો હોય અથવા ધરાવતો જ્યાંવો હોય;

(૭) ઠાક પણ ગુરૂ એરિયામાં રથાવર મીલકત, જમીન અથવા મકાનના સંબંધમાં "ડીરેક્ટોલી-ઇલ્ડ પરચેસ"નો અર્થ એવો માણસ કે જે કલમ ત્રણ ની રૂએ થયેલી લાગતી વળગતી જાહેરાતમાં દર્શાવવામાં આવેલા ગુરૂ (વર્ગ)નો

ન હોય અને કન્ટ્રોલ્ડ એરિયામાં આવેલી ઠાક પણ સ્થાપર મીલકત, જમીન કે મકાનનો માલીકના ગુરૂનો ન હોય, અથવા જે માલીક કે પેટા પ્રાંતની મ્યુનીસીપી-પાલીટી સીવાયની ઠાક પણ કાયદાથી સ્થપાયેલી મંડળી હોય તે તેવી મંડળીના મોટા ભાગના સભ્યોના ગુરૂનો ન હોય, અથવા એવી ઠાક પણ મ્યુનીસીપાલીટી હોય તે તેની કાઉન્સિલના મોટા ભાગના સભ્યોના ગુરૂનો ન હોય અથવા જે ઠાક કંપની માલીક હોય તે તેવી કંપનીમાં અંકુશ ધરાવતા અથવા તેની વતી અથવા તેના લાભમાં અંકુશ ધરાવતા ગણતા હોય તેવા માણસના ગુરૂનો ન હોય;

- (૮) "ગુરૂ"નો અર્થ કલમ બેમાં જ્યાંવેલ વ્હાઈટ ગુરૂ, (સારાનો વર્ગ) કલડ ગુરૂ અથવા તેવી ગુરૂ, અને તેમાં ઉકત કલમની પેટા કલમ (૨) ની રૂએ લાગતી વળગતી જાહેરાત અમલમાં મુકવાની જેટલે દરજ્જે જરૂર હોય તેટલે દરજ્જે ઉકત કલમની રૂએ ગુરૂ તરીકે જાહેર કરવામાં આવેલા હોય તેવા લોકોના કેઈ પણ ગુરૂ (વર્ગ)નો સમાવેશ થાય છે.

(૯) "ગુરૂ એરિયા"નો અર્થ કલમ ત્રણની રૂએ જાહેર કરવામાં આવેલો ઠાક પણ લતો;

(૧૦) "રથાવર મીલકત"માં તેવી મલકતમાં ઠાક પણ બંધનનો ખરો હક ધરાવતો હોય અને જે હક રજીસ્ટર થવાથી તેવો ખરો હક બંધનનો હોય તેનો અને (કલમ અગીયાર ની રૂએ ખાસ ઠરાવવામાં આવેલો હોય, તેવા લતામાં આવેલી રથાવર મીલકતના લીસ અથવા સબ-લીસ સિવાય રથાવર મીલકતના ઠાક પણ લીસ કે સબ-લીસનો સમાવેશ થાય છે, પરંતુ રથાવર મીલકત ઉપરના મોડર્ન જોન્ડનો સમાવેશ થતો નથી;

(૧૧) "ઇન્ટરેક્ટર"નો અર્થ કલમ એકત્રીસની રૂએ નીમવામાં આવેલો ઇન્ટરેક્ટર;

(૧૨) "જમીન"માં જમીનના ઠાક પણ ભાગનો સમાવેશ થાય છે;

(૧૩) "વોલક્ટ એથોરીટી" (રયાનિક સંતો) નો અર્થ ૧૯૦૯ના સાઉથ આફ્રિકા એક્ટની કલમ પંચાશીના પારિઆક્ટ (૬) માં ધારવામાં આવેલી ઠાક પણ સંસ્થા કે મંડળી;

(૧૪) "ક્ષમ"માં એક પત્નિ અથવા અનેક પત્નિઓ વાળો તેવી કાયદા અથવા રિવાજ મુજબ અથવા બંને પક્ષ મંથી ગયો તેના ધર્મના નીમનો મુજબ સ્વિકારવામાં આવેલાં લબનો સમાવેશ થાય છે;

(૧૫) "પ્રધાન"નો અર્થ મુલકી પ્રધાન: સિવાય કે તેવી ગુરૂ માટેના ઠાક પણ ગુરૂ એરિયાના સંબંધમાં અથવા તેવીવેને લગતાં જમીનના કાયદાની રૂએ સ્થપાયેલા ઠાક પણ લતાના સંબંધમાં પ્રધાનનો અર્થ તેવી એક્ટિસના પ્રધાન;

(૧૬) "પરમોટ"નો અર્થ કલમ ચૌદના લાગતા વળગતા ભાગની રૂન અપવામાં આવેલ અથવા અપવામાં આવેલ ગુરૂઓથી પરવાનો;

(૧૭) "શપ્સ" (પરસન) ના અર્થને ઠાક પણ નાલાયક ઠરાવાયેલા શપ્સ, નાલાયક ઠરાવાયેલી કંપની, ખાનગી કંપની, કલમ સોળમાં સુચવવામાં આવેલી કંપની અથવા કાયદાથી સ્થપાયેલી મંડળીના કંઈ પણ ખાસ સુચવના કારણે મર્યાદિત કરવામાં આવશે નહિ;

(૧૮) "મકાન" (રેગીસ્ટર) માં ઠાક પણ મકાનના ઠાક પણ અંક કે ભાગનો સમાવેશ થશે;

(૧૯) "કાયદાથી સ્થપાયેલી મંડળી"નો અર્થ ઠાક પણ કાયદાની રૂએ અથવા કાયદાથી સ્થપવામાં આવેલી મોડર્ન કે મંડળી.

આ કાયદાના હેતુઓ માટે ગુરૂ

૨. (૧) આ કાયદાના હેતુઓ માટે નીચે પ્રમાણેના ગુરૂો રહેશે
- (એ) વ્હાઈટ (ગોરનો) ગુરૂ, જેમાં ઠાક પણ શપ્સ, જે દેખાવે દેખીતી રીતે ગોરો છે અથવા જે સામાન્ય રીતે અથવા શાખથી ગોરા તરીકે સ્વિકારા થયેલ છે, અને જે દેખાવે દેખીતી રીતે ગોરો હોય છતાં, સામાન્ય રીતે અને શખથી રંગવર્ણી શપ્સ છે, તેના જેવા નથી, અથવા જે પારિઆક્ટ (બી) અને (સી) ના પેટા પારિઆક્ટ (૨) અને (૩) ની રૂએ અથવા આ પેટા કલમના પારિઆક્ટ (સી) અને પેટા કલમ (૨) ના પારિઆક્ટ (એ) સહીત ઉકત પેટા પારિઆક્ટોની રૂએ બીજા ઠાક પણ ગુરૂનો નથી, તેનો સમાવેશ થશે;
- (બી) તેવી ગુરૂ, જેમાં નીચેનાનો સમાવેશ થશે—

(૧) ઠાક પણ શપ્સ જે હકીકતમાં આફ્રિકાની ખસલી પ્રજા કે બંધીનો છે અથવા સામાન્ય રીતે અને શાખથી એ પ્રજા કે બંધીનો સભ્ય તરીકે સ્વિકારા

શેલા છે અને જે પારિશ્રાદ (સી) ના પેટા-પારિશ્રાદ (ર) અને (૩) ની રૂએ રંગબણી (કલડ) ગ્રહણને નથી; અને

(૨) કોઈ પણ શખ્સ, જે પેટા પારિશ્રાદ (૧) ની રૂએ દરાવાયેલા નેટીવ ગ્રહના છે, તેવા શખ્સોની સાથે તેવા શખ્સોની કોઈ પણ કોમના શખ્સ તરીકે આદતથી બળતો હશે, અને પારિશ્રાદ (સી) ના પેટા પારિશ્રાદ (૩) ની રૂએ દરાવાયેલા કલડ ગ્રહણને નહિ હોય; અને

(૩) ગમે તે પ્રજા, ભત્તી કે વર્ગની કોઈ પણ સ્ત્રી, જેની અને પેટા પારિશ્રાદ (૧) અને (૨) ની રૂએ દરાવાયેલા નેટીવ ગ્રહના કોઈ શખ્સની વચ્ચે લગ્ન થયેલાં હશે અથવા જે તેવા શખ્સની સાથે સંગ કરતી હશે;

(સી) કલડ ગ્રહ, જેમાં નીચેના નો સમાવેશ થશે—

(૧) કોઈ પણ શખ્સ જે ગોરા ગ્રહ અથવા નેટીવ ગ્રહનો નથી;

(૨) કોઈ પણ શખ્સ જે પેટા પારિશ્રાદ (૧) ની રૂએ દરાવાયેલા કલડ ગ્રહના શખ્સોની સાથે, તેવા શખ્સોની કોઈ પણ કોમના માણસ તરીકે, આદતથી બળતો હશે, અને જે પારિશ્રાદ (બી) ના પેટા પારિશ્રાદ (૩) ની રૂએ દરાવાયેલા નેટીવ ગ્રહનો નહિ હોય; અને

(૩) ગમે તે પ્રજા ભત્તી કે વર્ગની કોઈ પણ સ્ત્રી જેની અને પેટા પારિશ્રાદ (૧) અથવા (૨) ની રૂએ દરાવાયેલા કલડ ગ્રહના કોઈ પણ શખ્સની વચ્ચે લગ્ન થયાં હશે, અથવા જે તેવા શખ્સની સાથે સંગ કરતી હશે; અને

(ડી) પેટા કલમ (૨) ની રૂએ એક ગ્રહ (વર્ગ) તરીકે બહેર થયેલો હોય તેવા ગ્રહના શખ્સોની કોઈ પણ ગ્રહ.

(૨) ગ્રેટમાં બહેરાતથી ગવરનર-બવરલ

(એ) કોઈ પણ ભત્તીના, બાપાના, સંરક્ષિતના અથવા અન્ય વર્ગના શખ્સો, જેઓ નેટીવ ગ્રહના હોય અગર કલડ ગ્રહના હોય તેની વ્યાખ્યા આપશે; અને

(બી) તેની વ્યાખ્યા આપાયેલા ગ્રહને, આ કાયદાના હેતુઓને માટે અથવા બહેરાતમાં નજીવાયેલા હોય તેની તેની કલમોના હેતુઓને માટે અને યા તો સામાન્ય રીતે અથવા એક યા વધુ ગ્રહ એરિયાજ (વર્ગીય લતાઓ) ના અથવા કન્ટ્રોલ્ડ એરિયાસનાં અથવા તેના કોઈ પણ ભાગના સંબંધમાં, અથવા એક યા વધુ ગ્રહ એરિયાજ અને કન્ટ્રોલ્ડ એરિયાજ બંનેના સંબંધમાં અથવા તેના કોઈ પણ ભાગના સંબંધમાં એક ગ્રહ તરીકે બહેર કરશે.

(૩) પેટા કલમ (૨) ના પારિશ્રાદ (એ) ની રૂએ થયેલી બહેરાતમાં એવું દર્શાવી શકશે કે, જે શખ્સો બહેરાતમાં સુચવવામાં આવેલા ગ્રહના તરીકે ધારા મુજબ અરજ કરીને અથવા કોઈ પણ ખીલા કાયદાની રૂએ રજીસ્ટર થયેલા હશે તેવા શખ્સો જ એ ગ્રહના ગણાશે.

(૪) નેટીવ ગ્રહ અથવા કલડ ગ્રહનો કોઈ પણ માણસ જે પેટા કલમ (૨) ના પારિશ્રાદ (એ) ની રૂએ વ્યાખ્યા આપાયેલા કોઈ પણ ગ્રહનો માણસ હોય અથવા બનેશે તે, ઉક્ત પેટા કલમના પારિશ્રાદ (બી) ની રૂએ કરવામાં આવેલી કોઈ પણ બહેરાતને અમલમાં મુકવાને બહેર નજીવારો તેટલે દરજ્જા, નેટીવ ગ્રહ અથવા કલડ ગ્રહ, જે હોય, તેમાંથી ખાતલ કરવામાં આવશે.

ગ્રહ એરિયાજની સ્થાપના

૩. (૧) ગવરનર-બવરલ લાખનું નજીવારો ત્યારે ગ્રેટમાં બહેરાતથી—

(એ) એવું બહેર કરી શકશે કે બહેરાતમાં દર્શાવાયેલી તારીખ જે તારીખ બહેરાતની તારીખની ઓછામાં ઓછાં એક વર્ષ બાદની હશે, ત્યારથી બહેરાતમાં વ્યાખ્યા આપવામાં આવેલા લત્તો બહેરાતમાં દર્શાવવામાં આવેલા ગ્રહના લોકોના વસવાટને માટે; લત્તો ગણાશે; અથવા

(બી) એવું બહેર કરી શકશે કે બહેરાતમાં દર્શાવવામાં આવેલી તારીખ થી બહેરાતમાં વ્યાખ્યા આપવામાં આવેલા લત્તો તેમાં દર્શાવવામાં આવેલા ગ્રહના લોકોને માલિકી માટેના લત્તો ગણાશે.

(૨) પેટા કલમ (૧) ના પારિશ્રાદ (એ) અને (બી) ની રૂએ બહેરાતો એના એજ લતાના સંબંધમાં પણ થઈ શકશે.

(૩) આ કલમની રૂએ કોઈ પણ બહેરાત થઈ નહિ શકે—

(એ) સિવાય કે પ્રત્યેક દાખલામાં પાલોનેન્ટની બંને સમાઓના દરાવથી તેને માટે પ્રથમ સંમતિ મેળવવામાં આવી હશે; અપવાદ એ કે

તેની સંમતિ મેળવ્યા વીના તેની બહેરાત થઈ શકશે—

(૧) જે કોઈ અથવા નાટલ પ્રાંતમાં આવેલા લતાના સંબંધમાં આ કાયદાની શરૂઆતથી પાંચ વર્ષની મુદત પુરી થયાં પહેલાં કરવામાં આવેલા હશે; અથવા

(૨) જે તે ટ્રાંસવાલમાં કલડ ગ્રહને માટેના લતાના સંબંધમાં અથવા કલમ બે ની પેટા કલમ (૨) ની રૂએ વ્યાખ્યા આપવામાં આવેલા, કલડ ગ્રહના માણસોના બનેલા ગ્રહને માટેના લત્તો જેનો આખો અથવા મોટો ભાગ, આ કાયદાની શરૂઆત થઈ એ વખતે ટ્રાંસવાલના ૧૮૮૫ ના નંબર ના કાયદાની કલમ બે ના પારિશ્રાદ (ડી) ની રૂએ અથવા ટ્રાંસવાલના ૧૯૦૫ ના મ્યુનીસિપલ એમેન્ડમેન્ટ ઓર્ડીનન્સની કલમ દસની રૂએ, ઈલાખા સ્થાપવામાં આવેલા લતાનો હોય તેના સંબંધમાં અથવા ટ્રાંસવાલના ૧૯૦૮ ના પ્રોવિસ એન્ડ મેટ્ર મેટ્રસ એક્ટની કલમ એકસો એકવીસ (એ) ની પેટા કલમ (૧૦) માં નજીવાયેલી જમીનના સંબંધમાં થયેલી હોય;

(બી) સિવાય કે પ્રત્યેક દાખલામાં પ્રથમે લાગતા વળગતા પ્રાંતના એક્ટનીરીફ્ટરની સાથે મસલત કરી હશે, અને ગોરા ગ્રહ સિવાયના ખીલા કોઈ ગ્રહને માટેના લત્તો, જે આખો અથવા તેનો અમુક ભાગ, જેથી જમીનપર આવેલી હોય, કે જે ખાણને લગતા કોઈ પણ કાયદાની રૂએ પ્રોલેન્ડ થયેલી હોય અથવા પ્રોલેન્ડ ગણાતી હોય, તેવા દાખલામાં ખાણ પાતાના પ્રધાનની સાથે મસલત કરી હશે, અને જે લત્તો આખો અથવા તેનો અમુક ભાગ જેથી ૧૯૪૭ ના નેચરલ રીસોર્સીસ ડીવેલપમેન્ટ એક્ટની કલમ એકમાં વ્યાખ્યા આપવામાં આવેલી છે, તેવા કન્ટ્રોલ્ડ એરિયા માં આવેલો હોય તેવા દાખલામાં ઉક્ત કાયદાની કલમ બે થી રચાયેલી નેચરલ રીસોર્સીસ ડીવેલપમેન્ટ કાઉન્સિલની સાથે મસલત કરેલી હશે;

(સી) જે યદી કોઈ પણ ગ્રહ એરિયામાં નીચેના પણ સમાવેશ થશે હશે—

(૧) નેટીવ એરિયા તરીકે દરાવાયેલો હોય તેવા લતામાં આવેલી આખી જમીન અથવા તેનો અમુક ભાગ અથવા ૧૯૩૬ ના નેટીવ ટ્રસ્ટ એન્ડ લેન્ડ એક્ટની રૂએ મુકત કરવામાં આવેલો લત્તો;

(૨) ૧૯૪૫ ના નેટીવ (અરબન એરિયાજ) ડેવલપમેન્ટ એક્ટની કલમ બે માં દર્શાવેલ કોઈ પણ નેટીવ લોકોના, નેટીવ વીલેજ અથવા નેટીવ હોર્સલ, અથવા ઉક્ત કાયદાની કલમ નવની પેટા કલમ (૨) ના પારિશ્રાદ (એચ) ની રૂએ નેટીવોના વસવાટને માટે સંમતિ આપાયેલી કોઈ પણ લત્તો;

(૩) ૧૯૪૬ ના કલડ પરસન્સ સેલેક્શન એક્ટની કલમ, એકમાં જેની વ્યાખ્યા આપવામાં આવેલી છે તેવું કોઈ પણ કલડ લોકોના વસવાટનું સ્થળ;

(૪) કોઈ પણ મીશન સ્ટેશન અથવા કમ્યુનલ રીઝર્વ, જેને કેપનો ૧૯૦૯ ના મીશન સ્ટેશન્સ એન્ડ કમ્યુનલ રીઝર્વ એક્ટની કલમ સોળ અથવા ૧૯૪૯ ના કલડ મીશન સ્ટેશન્સ એન્ડ રીઝર્વ એક્ટની કલમ સોળ સાથે ઉપરોક્ત કાયદાની કલમો લાગુ પડતી હોય; અથવા

(૫) કોઈ પણ લત્તો જે ૧૯૨૬ ના નેશનલ પાકર્સ એક્ટની રૂએ નેશનલ પાકર્સ અથવા તેના પાકર્સો ભાગ હોય તેવી કોઈ પણ જમીન.

ગ્રહ એરિયાજમાં વસવાટ

૪. (૧) કલમ જમીન પેટા કલમ (૧) ના પારિશ્રાદ (એ) ની રૂએ થયેલી લાખતી વળગતી બહેરાતમાં દર્શાવવામાં આવેલી તારીખથી, અને જમીન કે મકાનમાં વસવાટને લગતી કોઈ પણ ખાસ કે કાયદાથી થયેલી ગોઠવણમાં ગમે તે નજીવાયેલું હોય તે પછી, કોઈ પણ ડીવેલપમેન્ટ (નાલાયક) દરાવાયેલા શખ્સથી, જેના સંબંધમાં બહેરાત થયેલી હોય તેવા કોઈ પણ ગ્રહ એરિયામાં આવેલી કોઈ પણ જમીન કે મકાનમાં પરવાના વીના વસવાટ કરી નહિ શકાય, અને કોઈ પણ શખ્સથી તેના ડીવેલપમેન્ટ કોષ્ટક (નાલાયક) દરેકા શખ્સને વસવાટ કરવા દઈ નહિ શકાય.

(૨) પેટા કલમ (૧) ના વિધાનો કોઈ પણ નાલાયક દરેકા એવા શખ્સને કોઈ પણ ગ્રહ એરિયામાં આવેલી જમીન કે મકાનમાં વસવાટ કરવાનું ગેર કાયદેસર દરાવશે નહિ—

(એ) જે તે રાજ્યની, કાયદાથી રચાયેલી મંડળની અથવા (નાલાયક) દરાવાયેલી કંપની કે કલમ સોળમાં સુચવાયેલી કોઈ પણ કંપની સિવાય; ઉક્ત જમીન કે મકાનમાં કાયદેસર વસવાટ કરી રહેલા કોઈ પણ શખ્સની ખરા અર્થમાં નોકરી કરતો હશે;

(બી) ને તે ઉકત જમીન કે મકાનમાં કામ્પેસર વસવાટ કરી રહેલા કોષ પજુ શખ્સને ખરા અર્થમાં મુલાકાતે આપેલો હશે અથવા કોષ પજુ હોટેલમાં ખરા અર્થમાં મહેમાન હશે;

(સી) ને તે કોષ પજુ હોસ્પિટલ, નરસીંગ હોમ, પાગલ ખાનું, કે તેવી કોષ પજુ સંસ્થામાં દરદી હશે અથવા કેદખાનું, પ્રવૃત્તિ ક્ષેત્ર, કે એવી કોષ પજુ સંસ્થામાં કેવી તરીકે કે બીજી રીતે મુકાયેલો હશે; અથવા

(ડી) ને (નોટરી કરનાર માણસ સહીત) એવી જમીનમાં કે મકાનમાં કામ્પેસર વસવાટ કરનાર કોષ પજુ શખ્સનો પતિ, પતિન, સગીર બાળક કે આશ્રિત હશે; અપવાદ એ કે આ પારિશ્રાદના વીધાનો કોષ પજુ ગ્રુપ એરીયાના સંબંધમાં તેજુ લાગુ પડશે ને અવરનર-બનરએ ગેઝેટમાં જાહેરાત થી એ ગ્રુપ એરીયાના સંબંધમાં તે લાગુ પડવાનું જાહેર કયું હશે, અને ઉકત જાહેરાતમાં દર્શાવવામાં આવેલું હશે એટલેજ દરબજે અને (ને કંઈ પજુ શરતો હશે તે) એટલીજ શરતોએ લાગુ પડશે.

(૩) પેટા કલમ (૧) માં સુચવવામાં આવેલા કોષ પજુ ગ્રુપ એરીયા માં આવેલી કોષ પજુ સ્થાવર મીલકતના ટાઇટલ ડીડમાં ગ્રુપને માટે એ લતો સ્થાપવામાં આવેલો હોય એ ગ્રુપના શખ્સોને તેવી મીલકતમાં વસવાટ કરવાની કે તેનો ઉપયોગ કરવાની બંધી કરનારું કે પ્રતિબંધીત કરનારું કંઈ પજુ વિધાન હશે તે ઉકત પેટા કલમમાં સુચવવામાં આવેલી તારીખથી ૨૬ થશે અને ત્યાર બાદ એવી કોષ પજુ મીલકતના ટાઇટલ ડીડમાં એવું કોષ પજુ વિધાન દાખલ કરવામાં આવશે નહિ.

ગ્રુપ એરીયાઓમાં સ્થાવર મીલકતની માલીકી

૫. (૧) ને કોષ ગ્રુપ એરીયા કલમ ત્રણની પેટા કલમ (૧) ના પારિશ્રાદ (બી) ની રૂએ માલીકીને માટેનો ગ્રુપ એરીયા હશે તે—

(એ) કોષ પજુ નાલાયક હરેલા શખ્સથી કે નાલાયક હરેલી કંપનીથી, જાહેરાતમાં જણાવવામાં આવેલી લાગતી વળગતી તારીખથી અથવા ત્યાર બાદ એ લતામાં આવેલી કોષ પજુ સ્થાવર મીલકત એ તારીખ પહેલાં વસીલતાનામાંથી યા બીજા કોષ પજુ પ્રકારના કરાર થએલા હોય તે પજુ, પરવાના વીના મેળવી નહિ શકાય; અપવાદ એ કે આ પારિશ્રાદના વિધાનો કામલાથી સ્થપાયેલી કોષ પજુ મંડળી તરફથી એવી મીલકત મેળવવાનું ગેર કાયદે દર્શાવેલું નહિ;

(બી) કોષ પજુ નાલાયક હરેલી કંપની ને ઉકત તારીખે એ લતામાં આવેલી કોષ પજુ સ્થાવર મીલકતની માલીકી ધરાવતી હશે તેનાથી ઉકત તારીખથી દસ વર્ષની મુદત બાદ એવી મીલકતની માલીકી વગર પરવાને ધરાવી શકાશે નહિ;

(સી) કોષ પજુ કંપની ને ઉકત તારીખે અથવા તે પછી નાલાયક કંપની હરે અથવા ફરીથી નાલાયક કંપની હરે તેનાથી તે લતામાં આવેલી કોષ પજુ સ્થાવર મીલકત, જે તેણે એ તારીખથી અથવા તે પછી વગર પરવાને મેળવવી હશે તેની માલીકી પરવાનો મેળવ્યા વીના ધરાવી શકાશે નહિ.

(ડી) એ લતામાં આવેલી કોષ પજુ સ્થાવર મીલકતનાં ટાઇટલ ડીડમાં, જે ગ્રુપને માટે એ લતો સ્થાપવામાં આવેલો હશે એ ગ્રુપના શખ્સો તરફ થી તેવી મીલકતની માલીકી મેળવવાની બંધી કરનારું કે પ્રતિબંધ મુકનારું કંઈ પજુ વિધાન હશે તે ઉકત તારીખથી ૨૬ થશે અને ત્યારબાદ તેવી કોષ પજુ મીલકતના ટાઇટલ ડીડમાં બનું કંઈ પજુ વિધાન દાખલ કરવામાં આવશે નહિ.

(૨) સ્થાવર મીલકત મેળવવા અથવા ધરાવવાને લગતાં કોષ પજુ ખાસ અથવા કામલાના વિધાનોમાં ગમે તે જણાવેલું હોય છતાં પેટા કલમ (૧) લાગુ પડશે, પરંતુ ઉકત પેટા કલમ ખાસ અથવા બીજા ધાતુની શેષ કરવાને ખાતર કોષ પજુ મીલકત મેળવવા અથવા ધરાવવા અથવા વેચી દેવા સંબંધી કોષ પજુ કામલાના વિધાનના અમલને ઉકત પેટા કલમ રોકાઈ નહિ શકે.

(૩) પેટા કલમ (૧) ના પારિશ્રાદ (એ) માં સુચવવામાં આવેલી તારીખે અથવા તે પછી વસીલતાનામાંથી કે કોષ બીજી રીતે કોષ પજુ શખ્સ પેટા કલમ (૧) ની વીલકત જાણુ સ્થાવર મીલકત મેળવી અથવા તેની માલીકી ધરાવી શકે તેવા કંઈ પજુ કરાર થયા હશે તે નકામા ગણાશે.

અમુક ગ્રુપ એરીયાઓ માટે વહીવટ મંડળી

૬. (૧) પ્રધાન ગેઝેટમાં નોટીસથી (ગોરા ગ્રુપને માટેના લતા સિવાયના બીજા) કોષ પજુ ગ્રુપ એરીયાને માટે ધારાઓની મુજબ બનીલી એક વહીવટી મંડળી સ્થાપી શકશે.

(૨) તેવી વહીવટી મંડળી આખી અથવા મોટે ભાગે જે ગ્રુપને માટે ગ્રુપ એરીયા સ્થાપવામાં આવેલો હોય તે ગ્રુપના લોકોની બનેલી કોષ પજુ શકશે અને તેને ધારામાં જણાવવામાં આવેલું હશે તેવા કામ અને સત્તાઓ રહેશે, અને બંધાં લાગતો વળગતો ગ્રુપ એરીયા આખો અથવા તેનો અમુક ભાગ સ્થાનિક સત્તાની હકમત નીચે હશે ત્યાં તેવી સ્થાનિક સત્તાની ધારાથી કરા વાયેલી દેખરેખ નીચે પોતાની સત્તા અને કામ ચલાવી શકશે, અને બંધાં લાગતો વળગતો ગ્રુપ એરીયાનો કેટલોક ભાગ એક સ્થાનિક સત્તાની હકમત ના વિસ્તારમાં આવેલો હોય અને બીજા ભાગ કોષ બીજી સ્થાનિક સત્તાની હકમત નીચે આવેલો હોય અથવા કોષ પજુ સ્થાનિક સત્તાની હકમતની બહાર હોય તે તે પ્રધાન તરફથી નીમવામાં આવેલી સ્થાનિક સત્તાની દેખ રેખ નીચે પોતાનું કામ અને સત્તા ચલાવશે.

(૩) આ કલમની રૂએ લાગતા વળગતા ગ્રુપ એરીયાને માટે વહીવટી મંડળી સ્થાપવાથી એવી વહીવટી મંડળી પાસે જે સત્તાઓ અને કામો નહી હોય તે સત્તાઓ અને કામો તે ગ્રુપ એરીયાના સંબંધમાં કોષ પજુ સ્થા નીક સત્તા પાસેથી છીનવી લેવાથી નહિ.

(૪) પ્રધાન આ કલમની રૂએ પોતાને મોકલી સત્તાને લાગતા વળ ગતા પ્રાંતના એડમીનીસ્ટ્રેટર સાથે મસલત કરી બાદ ઉપયોગ કરશે.

અમુક લતાઓમાં મ્યુનીસીપલ કારભાર બંદોબસ્ત ચલાવવ માટે

૭. (૧) પ્રધાનને જે એવો મત થાય કે ટાંચવાલો ૧૮૮૫ ના ૩ નંબર ના કામલાની કલમ બે ના પારિશ્રાદ (ડી) માં, અથવા ટાંચવાલો ૧૯૦૫ ના મ્યુનિસીપલ એગ્રેગેશન ઓર્ડિનન્સની કલમ દસમાં, અથવા કોષ પજુ સ્થાનિક શહેરી સત્તાની હકમત હેઠળના લતામાં આવેલા (ગોરા ગ્રુપ માટેના લતા સિવાયના બીજા) કોષ પજુ ગ્રુપ એરીયામાં એ સ્થાનિક સત્તા તરફથી બંદોબસ્ત કારભાર ચલાવવામાં આવતો નથી તે લાગતા વળગતા પ્રાંતના એડમીનીસ્ટ્રેટરને તપાસ કરવાની તે વીનિ કરી શકશે (ઉકત સ્થાનિક સત્તાને પોતાની વાત રજુ કરવાની તક આપવામાં આવશે) અને ત્યાર બાદ ઉકત એડમીનીસ્ટ્રેટર, બેખીત નોટીસથી, તેવી સ્થાનિક સત્તાને, ઉકત નોટીસમાં દર્શાવવામાં આવેલું કંઈ પજુ કામ, જે ઉકત સ્થાનિક સત્તાને કરવાની સત્તા હોય, અને જે એડમીનીસ્ટ્રેટરને એવો મત હોય એ લતાનો કારભાર બંદોબસ્ત ચલાવવાને જ્વરી છે, તે તુરત જ કરવાનું તેને જણાવી શકશે; અને જે એવી સ્થાનિક સત્તા ને નોટીસ મુજબ વર્તતા મુકશે તે એડમીનીસ્ટ્રેટર બંધે એ કામ કરાવી શકશે અને તેને માટે સ્થાનિક સત્તા કામ્પેસર ને કરી શકે તેનું કંઈ પજુ કામ કરવાની કોષ પજુ શખ્સને સત્તા આપી શકશે.

(૨) આ કલમની રૂએ એડમીનીસ્ટ્રેટર લાગતી વળગતી સ્થાનિક સત્તા પાસેથી તેના તરફથી થએલો કંઈ પજુ ખર્ચ વસુલ કરી શકશે—

(એ) જે સ્થાનિક સત્તા એ ખર્ચ ન બરે તે તેની સામે કોર્ટ મારફતે પગલાં લઈને; અથવા

(બી) જે સ્થાનિક સંસ્થાએ ખર્ચ નહિ ભર્યો હોય તેની હકમત નીચેના લતામાં કરા લાગુ પડનારી સમગ્રી મીલકતોપર ખાસ કર નાખીને; અથવા

(સી) ખર્ચ નહી બરનારી સ્થાનિક સત્તા કોન્સોલિડેટેડ રેવન્યુ ફન્ડમાંથી અથવા એડમીનીસ્ટ્રેટર તરફથી મળતી કોષ પજુ નાણા મદદ કે ગ્રાન્ટ કે અન્ય રકમોમાંથી બાદ કરીને,

અથવા વસુલ કરવાની એવી ગણે અથવા બે રીતો લઈને અને આ કલમની રૂએ સ્થાનિક સત્તા પાસેથી આ રકમ વસુલ કરવાની છે તેનો એડમીનીસ્ટ્રેટરનું સર્વશિક્ષેટ પુરાવો ગણાશે, સિવાય કે તેની સામે પ્રધાનને ખપીલ કરી શકાશે, જેનો મુકાદો છેવટનો ગણાશે.

કન્સોલિડેટેડ એરીયા માં સ્થાવર મીલકત સંબંધી અમુક કરારો

૫૨ પ્રતિબંધો

૮. (૧) કોષ પજુ શખ્સ, પરવાના વગર, પોતાની વતી અથવા બીજા કોષ પજુ શખ્સની વતી કે તેના લાભમાં અથવા કોષ પજુ મતના કરાર કરી નહિ શકે જેનાથી નાલાયક હરેલા કોષ શખ્સથી અથવા ના

લાયક હરેલી કોષ્ટ પજુ કંપનીથી કન્ટ્રોલ્ડ એરિયામાં આવેલી કોષ્ટ પજુ મીલકત મેળવી શકાય.

(૨) ૧૯૩૬ ના નેટીવા દુરટ એન્ડ લેન્ડ એક્ટ ના વિધાનો મુજબ અથવા ૧૯૪૫ ના નેટીવસ (અરબન એરિયા) કોન્સોલિડેશન ઓફ ટાઇટલ ડીમ્સ ઓફ ડેપુટી કમિશનર ઓફ લેન્ડ એન્ડ ટેન્સીયર પ્રમાણેના નેટીવ તરફથી સ્થાયર મીલકત મેળવવાના અથવા તેની પાસેથી ખરીદવાના સંબંધમાં પેટા કલમ (૧) લાયક નહિ પડે.

(૩) પેટા કલમ (૧) ના હેતુએ માટે શેરીફ, ડેપુટી શેરીફ, કોર્ટના મેજિસ્ટ્રેટ, ડેપુટી, એકઝીક્યુટિવ, લીકવેટીર, ક્યુરેટર અથવા એડમીનીસ્ટ્રેટર જે પોતાના એ દરબજામાં સ્થાયર મીલકત સંબંધી કામ કરતો હોય તે, અથવા કોર્ટ પજુ બીજા શખ્સ, જે પ્રતિનિધિ તરીકે સ્થાયર મીલકત સંબંધી કામ કરતો હોય તે, જેના નામ પર મીલકત રજીસ્ટર થયેલી હોય તે શખ્સ ની વતી અથવા તેના લાભમાં કામ કરતો ગણ્યો.

(૪) પેટા કલમ (૧) ની વીરુદ્ધ થએલા કઈ પજુ કરાર ન કામા ગણ્યો.

કન્ટ્રોલ્ડ એરિયામાં કંપનીઓ તરફથી સ્થાયર મીલકત ધરાવવા પર પ્રતિબંધ

૯. (૧) આ કાયદાની શરૂઆતમાં જે કોષ્ટ પજુ ઝૂપની કંપની કન્ટ્રોલ્ડ એરિયામાં સ્થાયર મીલકત ધરાવતી હોય, અને ત્યાર બાદ, બીજા ઝૂપની કંપની અને તે તેનાથી પરવાના વગર જે મીલકત ધરાવી શકાશે

(૨) આ કાયદાની શરૂઆત પછી જે કોષ્ટ પજુ ઝૂપની કંપની કન્ટ્રોલ્ડ એરિયામાં સ્થાયર મીલકત મેળવે અને ત્યાર બાદ બીજા કોષ્ટ ઝૂપની કંપની અને તે તેના પરવાના વગર જે મીલકત ધરાવી નહિ શકે, સિવાય કે, તેણે જે મીલકત એવા બીજા ઝૂપના કોષ્ટ શખ્સ કે કંપની પાસેથી કાયદેસર મેળવેલી હશે.

(૩) આ કલમના હેતુએ માટે કંપની એટલે એક ઝૂપની કંપની ગણ્યો, જે એ કંપનીમાં અંકુશ રાખનારો હોય તે ઝૂપના માણુસ તરફથી અથવા તેની વતી અથવા તેના હિતમાં ધરાવતો હશે.

કન્ટ્રોલ્ડ એરિયામાં જમીનના વસવાટ પર પ્રતિબંધ

૧૦. (૧) કોષ્ટ પજુ નાલાયક હરેલા શખ્સથી પરવાના વગર કન્ટ્રોલ્ડ એરિયામાં આવેલાં કોષ્ટ પજુ જમીન કે મકાનમાં વસવાટ કરી શકાશે નહિ અને કોષ્ટ પજુ શખ્સથી કોષ્ટ પજુ નાલાયક હરેલા શખ્સને તેની જમીન કે મકાનમાં વસવાટ કરવા દેશ શકાશે નહિ.

(૨) પેટા કલમ (૧) ના વિધાનો કોષ્ટ પજુ નાલાયક હરેલા શખ્સને કોષ્ટ પજુ જમીન કે મકાનમાં વસવાટ કરવાનું ગેરકાયદે દરારી નહિ શકે—

(એ) જે તે લ્હાં કોષ્ટ પજુ કાયદાથી અથવા કાયદાની રૂએ મળેલા કોષ્ટ પજુ હકના આધારે વસવાટ કરતો હશે;

(બી) જે તા. ૨૪ એપ્રિલ ૧૯૪૦ પહેલાં કઈ પજુ કરાર અથવા વસીયત નામા દારા મળેલા હકથી, અથવા જે એ જમીન કે મકાન એવાં હોય કે જે કલમ (૩૩) ની રૂએ થયેલી કોષ્ટ પજુ અહેરારતના આધારે તેને કલમ ૧૧ ની રૂએ થયેલી અહેરારત લાયક નહિ પડી શકતી હોય, એ જમીન કે મકાનને છેલ્લી જણાવેલી અહેરારત લાયક પડતી હતી તે વખતે કઈકે કર શકી અથવા વસીયતનામા દારા મળેલા હકથી અથવા કોષ્ટ પજુ નવેસર થએલા એવા કરારના આધારે તે લ્હાં વસવાટ કરતો હોય;

(સી) આ કાયદાની શરૂઆત પહેલાં તેણે લાંબા સમયના વસવાટથી મેળવેલા હકના આધારે તે લ્હાં વસવાટ કરતો હોય;

(ડી) ૧૯૨૦ ના દાઉજીંગ એક્ટની રૂએ અથવા ૧૯૪૫ ના દાઉજીંગ (એમરજન્સી પાવર્સ) એક્ટની રૂએ થયેલી કઈ પજુ કોષ્ટ પજુ મીલકતથી, એક ઘર કે મકાન જે વર્ગના લોકોને માટે હોય તે વર્ગના તે પોતે હોવાના આધારે તે લ્હાં વસવાટ કરતો હોય,

(ઇ) જે જમીન, કાયદાથી રચાયેલી કોષ્ટ મંડળોના, (નાલાયક હરેલી કંપની અથવા કલમ ૧૬ માં જણાવેલી કંપની સિવાય) એ જમીન કે મકાનમાં કાયદેસર વસવાટ કરનાર કોષ્ટ પજુ શખ્સને તે નોકર હોવાના આધારે તે લ્હાં વસવાટ કરતો હોય;

(એફ) જે જમીન કે મકાનમાં કાયદેસર રહેના કોષ્ટ પજુ શખ્સની તે મુલાકાતે આવેલા તરીકે અથવા કોષ્ટ પજુ હોટેલમાં મહેમાન તરીકે વસવાટ કરતો હોય;

(જ) કોષ્ટ પજુ હોટેલોટમાં, નર્સિંગ હોમમાં, એસાયલમાં, કે જેવી કોષ્ટ પજુ સરવા અથવા કેલબાનામાં, વસવાટ કરતો હોય;

(ઝે) જેવી જમીન કે મકાનમાં કાયદેસર વસવાટ કરવા શખ્સ કે તેના નોકરના પતિ, પત્ની, સમીર આગક કે આશ્રિત તરીકે લ્હાં વસવાટ કરતો હોય.

(૩) એટમાં અહેરારતથી ગવરનર-જનરલ અહેરારતમાં જણાવેલા કોષ્ટ પજુ લતાને તેમાં જણાવેલી મુદતને માટે પેટા કલમ (૧) ના વિધાનોમાંથી ખાતલ કરી શકશે.

બાર અને તેરમી કલમોના અમલ

૧૧. (૧) એટમાં અહેરારતથી ગવરનર-જનરલ અહેરારત કરી શકશે કે ૧૨ અને ૧૩ મી કલમોના વિધાનો અહેરારતમાં જણાવેલી તારીખથી કન્ટ્રોલ્ડ એરિયાના તેમાં જણાવેલા કોષ્ટ પજુ બાગને લાયક પડશે.

(૨) એ તારીખથી એ વિધાનો, જમીન અને મકાનના વસવાટને લગતા ખાસ કે અન્ય કાયદાના વીધાનોમાં ગમે તે જણાવ્યાં હોય તે પજુ, કન્ટ્રોલ્ડ એરિયાના એવા કોષ્ટ પજુ બાગને લાયક પડશે અને કલમ (૧૦) ના વિધાનો ના અમલને આ પ્રથમ જણાવેલા વીધાનો લાયક પડે તે દરમિયાન કન્ટ્રોલ્ડ એરિયાના એ બાગમાંથી મોકુફ રાખવામાં આવશે.

(૩) કોષ્ટ પજુ ઝૂપ એરિયા સ્થાપનાથી આ કલમની રૂએ થયેલી લાગતી વધતી અહેરારતો અમલ કન્ટ્રોલ્ડ એરિયાના જેટલો બાગ એ ઝૂપ એરિયામાં આવેલો હશે તેટલા બાગમાં બંધ થશે.

કલમ (૧૧) માં જણાવેલા લતાઓમાં જમીન અને મકાનના વસવાટ પર પ્રતિબંધ

૧૨. (૧) જણાવવામાં આવેલી તારીખથી કોષ્ટ પજુ શખ્સ, જે કોષ્ટ ઝૂપનો હોય તે પરવાના વગર એવી કોષ્ટ પજુ જમીન કે મકાનમાં વસવાટ કરી નહિ શકે કે જેમાં કાયદેસર વસવાટ થઈ રહી નહિ હોય અને એ તારીખે કલમ (૧૩) ની રૂએ એ જ ઝૂપના માણુસ તરફથી વસવાટ થતો નહિ હોય.

(૨) કલમ દસની પેટા કલમ (૨) ના પારિઆરો (બ) (એક) (ઝ) અને (એમ) ના વિધાનો નોંધતા દેશકારો સાથે દર્શાવેલી જમીન કે મકાન ના વસવાટના સંબંધમાં લાયક પડશે.

દર્શાવાયેલી તારીખ પછી બંધાયેલા અથવા પુરાં થયેલા મકાનો

અને એ તારીખે વસાયેલા નહિ હોય તેવાં મકાનો જમીન અને જગ્યા

૧૩. (૧) દર્શાવાયેલી તારીખ પછી, પેટા કલમ (૩) ના પારિઆર (એ) ની રૂએ અહેરારતથી જણાવાયેલા લતાની બહાર દર્શાવેલા કોષ્ટ પજુ લતામાં આવેલી જમીન કે જગ્યામાં કોષ્ટ પજુ મકાન બંધાવે કે પુરું થયું હશે, અથવા ઉકત તારીખે દર્શાવાયેલા કોષ્ટ પજુ લતામાં આવેલા કોષ્ટ પજુ મકાન, જમીન કે જગ્યા વસાયેલાં નહિ હોય તો, તેવાં મકાન, જમીન કે જગ્યા—

(એ) જે કાયદેસર મંડળી સિવાય બીજા કોષ્ટ શખ્સ તેની માલીકી ધરાવતો હશે તો, કલમ બારના હેતુએને માટે, પેટા કલમો ૨, ૩, (૩), (૪) (૫) અને (૭) ના વિધાનો ની શરતે દર્શાવાયેલી તારીખે તેના માલીક તરફથી વસાયેલાં ગણ્યાં.

(બી) જે એવાં મકાન, જમીન કે જગ્યાની માલીકી કોષ્ટ કાયદેસર મંડળી હશે, અથવા ઉકત તારીખે તેવાં મકાન, જમીન કે જગ્યામાં કાયદેસર વસવાટ થયેલો નહિ હોય તો પ્રધાન, પેટા કલમ (૩) ના વિધાનોના અપવાદ સિવાય, માલીકની લેખીત અરજી પરથી દર્શાવાયેલી તારીખથી કયા ઝૂપના માણુસથી તે વસાયેલાં મણુસ એ એ નક્કી કરશે.

(૨) દર્શાવાયેલી તારીખ પછી દર્શાવાયેલા કોષ્ટ પજુ લતામાં આવેલા જમીન કે જગ્યા પરનું કોષ્ટ પજુ મકાન તોડી પાડવામાં આવ્યું હશે તેને એવ જણાવેલી થીજી કોષ્ટ મકાન બંધાયું હશે, અથવા તેનો વધાર

આખું દશે, અને એ દર્શાવાયેલા સત્તો પેટા કલમ (૩) ના પારિચ્છાદ (બી) ની રૂએ બંધારતથી દર્શાવાયેલા લતાની બહાર દશે, તો તેવું બંધાએલું અથવા બંધારવામાં આવેલું મકાન પેટા કલમો (૩), (૪), (૫) અને (૭) ના વિધાનોની શરતે, કલમ (૧૨) ના હેતુઓ માટે દર્શાવાયેલી તારીખે એ મકાનને તોડવામાં આવ્યું અથવા બંધારવામાં આવ્યું તે પહેલાં શખ્સથી તે કાયદેસર વસાયેલું હતું તેનાથી વસાયેલું લેખારો.

(૩) (બી) ગવરનર-બનરક, એક્ટમાં બંધારતથી પારિચ્છાદ (બી) ના હેતુઓને માટે કોઈ પણ દર્શાવાયેલા લતામાં કોઈ પણ લતા દરાવી શકશે.

(બી) એવી બંધારતની તારીખ પછી એવી કોષ્ટ પણ બંધારતમાં દરાવવામાં આવેલા લતામાં પુરાં થયેલાં, બંધાએલાં અથવા બંધારવામાં આવેલાં (પછી તે તેની ડાહ્યામાં આવેલાં મકાનની બદલીમાં હોય તો પણ) મકાનના માલિકની લેખીત અરજ પરથી અથવા એવા કોષ્ટ પણ લતામાં આવેલ કોષ્ટ પણ જમીન કે જગ્યા જે ઉકત તારીખે ખાલી પડેલાં હોય અથવા કાયદેસર વસાયેલ ન હોય તો પ્રધાન દર્શાવાયેલી તારીખે કલમ (૧૨) ના હેતુઓ માટે તે ક્યા જગ્યાના માણસથી વસાયેલા ગણ્યારો એ નિર્ણય કરશે.

(સી) પારિચ્છાદ (બી) ની રૂએ કોષ્ટ પણ મકાનના સંબંધમાં ક'ઈ પણ નીચું થાય નહિ ત્યાં સુધી, તેવું મકાન કલમ (૧૨) ના હેતુઓ માટે દર્શાવાયેલી તારીખે ખાલી પડેલું લેખારો.

(ડી) પારિચ્છાદ (બી) ની રૂએ યએલા કોષ્ટ પણ નીચું મુજબ કોષ્ટ પણ મકાન, જમીન કે જગ્યા નેટીવ રૂપ અથવા કલંડ જગ્યાના માણસથી વસાયેલું લેખાયું દશે, અને એના નીચું પણ પછી કલમ (૨) ની પેટા કલમ (૨) ની રૂએ એવા જગ્યાના માણસોનો જૂથ સ્થાપવામાં આવ્યો દશે તો પ્રધાન એ પ્રમાણેની અરજ પરથી એ નીચું પાઠો ખેંચી લાઇ શકશે અને ઉકત પારિચ્છાદની રૂએ તેવું મકાન, જમીન કે જગ્યા છેલ્લા જુથાવાયેલા જગ્યાના માણસથી વસાયેલ હોવાના નીચું કરશે.

(૪) કોષ્ટ પણ દર્શાવાયેલા લતામાં કોષ્ટ પણ રહેવાનું મકાન કે બીજું કોષ્ટ મકાન, જે ૧૯૨૦ ના હાઉઝીંગ એક્ટની રૂએ અથવા ૧૯૪૫ ના હાઉઝીંગ (મિમરબન્સી પાવર્સ) એક્ટની રૂએ યએલા કોષ્ટ પણ ધારાઓની રૂએ બંધાયું દશે, તો તે, કલમ (૧૨) ના હેતુઓ માટે, દર્શાવાયેલી તારીખે, જે વર્ગના માણસોને માટે તે ઘર અથવા મકાન હોવાના ધરાદો રાખવામાં આવ્યો દશે તે જ જગ્યાના માણસથી તે વસાયેલું લેખારો.

(૫) દર્શાવાયેલા કોષ્ટ પણ લતામાં કોષ્ટ પણ મકાન, જમીન કે જગ્યાના ટાઇટલ ડીડમાં એવી કોષ્ટ પણ શરત દશે કે જે એક યા વધુ જગ્યા માણસોને તેમાં વસવાની વંધી કરનારી અથવા પ્રતિબંધ સુકનારી દશે તો પ્રધાન પેટા કલમ (૩) ની રૂએ એવી શરતની વિગદ હોય એવા કોષ્ટ નીચું નહિ કરે

(૬) પ્રધાનને, કોષ્ટ પણ વખતે તેમ કરવું લાજવાની જણ્યારો, ત્યારે તે પેટા કલમ (૨) કે પેટા કલમ (૩) ના પારિચ્છાદ (બી) ની રૂએ નિર્ણય આપવાનું પોતાને યોગ્ય લાગે તેટલી મુદતને માટે મોકુફ રાખશે.

(બી) કોષ્ટ પણ દર્શાવાયેલા લતામાં કોષ્ટ પણ જમીન કે જગ્યામાં વસવાટ કરવાના સંબંધમાં પરવાનો અપાના હોય તો તેવી જમીન કે જગ્યા, પરવાના મુજબ વસવાટ ચાલુ થાય ત્યારથી કલમ (૧૨) ના હેતુ ના માટે દર્શાવાયેલી તારીખે જે જગ્યાના માણસના વસવાટ માટે પરવાનો આપવામાં આવ્યો દશે તે જ જગ્યાના માણસથી વસાયેલ ગણ્યારો, સિવાય કે પરવાનામાં સપટ રીતે બીજું કયું જુથાયેલું હોય.

૮. (બી) કોષ્ટ પણ દર્શાવાયેલા લતામાં કોષ્ટ પણ મકાન, જમીન કે જગ્યાના સંબંધમાં પેટા કલમ (૨) અથવા ૧૯૪૬ ના એશીયાટીક લેન્ડ ટેન્ચર એક્ટની કલમ (૬) ની પેટા કલમ (૪) ના પારિચ્છાદ (બી) ની રૂએ કોષ્ટ પણ નિર્ણય વર્તેલો હોય, અને તેવું મકાન, જમીન કે જગ્યા ખાલી પડેલી હોય અથવા તેમાં મકાનનું બાંધકામ કે વધારો પુરાં થયાં નહિ હોય, તો તેવા નીચું કલમનાં લાગતા વળગતા વિધાનોની રૂએ યએલો લેખારો: અપવાદ એ કે એ નિર્ણયમાં એશીયાટીક સિવાયના કોષ્ટનું સુચન કરવામાં આવ્યું દશે તો તે જોગ જગ્યાના માણસનું સુચન થયેલું લેખારો, અને જે તેમાં એશીયાટીકનું સુચન થયું દશે તો તે કલંડ જગ્યાના માણસનું સુચન થયેલું લેખારો.

(બી) એ ઉકત તારીખે કોષ્ટ પણ દર્શાવાયેલા લતામાં જમીન કે જગ્યામાં વસવાટ મંજૂર કરનારી ઉકત કાયદાની કલમ (૮) ની રૂએ પરવા

નો હરિતમાં દશે, અને તેવી જમીન કે જગ્યા પરવાના મુજબ વસાયેલ નહિ હોય તો પરવાનો આ કાયદાની કલમ (૧૪) ના લાગતા વળગતા વિધાનો ની રૂએ અપાયેલો લેખારો.

પરવાના અને નિર્ણયો

૧૪. (૧) પ્રધાન, કલમ (૨) ના વિધાનોની શરતે, પોતાની મુન સુધીમાં આવે તો, લેખીત અરજ પરથી—

(એ) પોતે નીમેલા અમલદારની સહી સાથેની પોતે દરાવેલી શરતોએ—

(૧) જુપ એરિયા કે કન્ડ્રોલ એરિયામાં સ્થાવર મીલકત મેળવવા કે ધરાવવાને; અથવા

(૨) જુપ એરિયા, કન્ડ્રોલ એરિયા કે કલમ (૧૨) માં સુચવ્યું મુજબ દર્શાવાયેલા લતામાં વસવાટ કરવા માટે અથવા વસાવવાની પરવાનગી માટે પરવાનો આપવાનું સુચવી શકશે; અને

(બી) પરવાનાની શરતોમાં ફેરફાર કરવાનું સુચવી શકારો અથવા જે જમીન કે જગ્યાને માટે પરવાનો આપવામાં આવેલો દશે તે જે જમીન અથવા જગ્યાના અમુક ભાગને માટે જ લાગુ પડશે એવું સુચવી શકશે.

(૨) પ્રધાન, પેટા કલમ (૧) ની રૂએ—

(અ) કોષ્ટ પણ જુપ એરિયામાં મીલકત મેળવવા કે ધરાવવા અથવા જમીન કે જગ્યામાં વસવાટ કરવા પરવાનો આપવા મંજૂરી નહિ આપે, સિવાય કે, તેનો એવો મત દશે કે એવા પરવાનો નહિ આપવાથી વધારે પડતી મુશ્કેલી પડશે અથવા પરવાનો આપવામાં જે જગ્યાને માટે જુપ એરિયા સ્થપાયો છે તે જગ્યા ઉત સમાયેલું છે; અથવા

(બી) કોષ્ટ પણ માણસને, કોષ્ટ પણ જુપ કે વર્ગના લોકોને જમીન કે જગ્યા મેળવવા, ધરાવવા કે, તે પર વસવાટ કરવાની બંધી કરનારાં કે પ્રતિબંધ સુકનારાં કોષ્ટ પણ ટાઇટલ ડીડમાં વીધાનો હોય તેની વિગદ જુપ ને કોષ્ટ પણ જમીન, કે જગ્યા મેળવવા, ધરાવવા કે તેના પર વસવાટ કરવા પરવાનો આપવા મંજૂરી નહિ આપે.

(૩) પેટા કલમ (૧) ની રૂએ પરવાનો આપવાનું અથવા તેની શરતો માં ફેરફાર કરવાનું સુચવતાં અને કલમ (૧૩) ની રૂએ નિર્ણય કરતાં, પ્રધાન, કોષ્ટ પણ લાગતા વળગતા જગ્યાની ધરાની વ્યવસ્થા કરવા સંબંધી જીવનની અને કેળવણી અને વિશ્વતીની સમવેદોની જરૂરીયાતો સંબંધી, વેપાર અને ઉદ્યોગોનાં લેવામાં આવેલાં કામો બંધી કોષ્ટ પણ જગ્યાના માણસો તરફથી ધરાવાયેલી અન્ય મીલકત, જમીન કે જગ્યાના સંબંધમાં ઉકત સ્થાવર મીલકત, જમીન કે જગ્યાની શું સ્થિતિ છે તેની, અને એવી ક'ઈ પણ બીજી બાબતો, જે તેમના મત પ્રમાણે એવા પરવાનો આપવો જોઈએ કે નહિ, અથવા, તેની શરતોમાં ફેરફારો થવા જોઈએ કે નહિ, અથવા કોષ્ટ પણ નિર્ણય કેવી રીતે થવો જોઈએ, તેને જાનમાં લેશે.

(૪) સ્થાવર મીલકત ધરાવવા અથવા જમીન કે જગ્યામાં વસવાટ કરવાની સત્તા આપનારો પરવાનો અપોક્સ મુદતને માટે, અથવા અમુક દરાવેલી મુદતને માટે અથવા પ્રધાનની મુનસુધીમાં આવે ત્યારે તે પાછો ખેંચી લેવામાં આવે ત્યાં સુધીને માટે આપી શકારો.

(૫) કલમ (૧૬) માં સુચવેલી ક'પનીને સ્થાવર મીલકત મેળવવાની સત્તા આપનારો પરવાનો.

(એ) કોષ્ટ પણ એકસ સ્થાવર મીલકતના સંબંધમાં; અથવા

(બી) પરવાનામાં દર્શાવાયેલા કોષ્ટ પણ લતામાં આવેલી સ્થાવર મીલકતના સંબંધમાં; અથવા

(સી) સામાન્ય સ્થાવર મીલકતના સંબંધમાં; અને

(ડી) પારિચ્છાદ (બી) અને (સી) માં સુચવાયેલા દાખલાઓમાં અમુક દરાવેલી મુદતને માટે અથવા પ્રધાનની મુનસુધીમાં આવે ત્યારે તે પાછો ખેંચી લેવામાં આવે ત્યાં સુધીને માટે આપવામાં આવશે: અપવાદ એ કે એવી ક'ઈ પણ મુદત પુરી થતાં, અથવા પરવાનો પાછો ખેંચી લેવા માં એ સત્તાના આધારે મેળવાયેલી કોષ્ટ પણ સ્થાવર મીલકતને પરવાના ની શરતો લાગુ પડતી ચાલુ રહેશે.

(૬) કલમ (૪) ની પેટા કલમ (૨) ના પારિચ્છાદ (એ) માં સુચવાયેલી અથવા કલમ (૧૦) ની પેટા કલમ (૨) ના પારિચ્છાદ (સી) માં

મુચવાયેલી કંપનીના કોષ્ટ પશુ નોકરને કન્ટ્રોલ એરિયામાં આવેલી કોષ્ટ પશુ જમીન કે જગ્યામાં વસવાટ કરવાની સત્તા આપનારો પરવાનગી કોષ્ટ પશુ બ્યક્ટિગત નોકરને અથવા પરવાનામાં દર્શાવેલા કોષ્ટ પશુ વર્ગના નોકરને આપી શકશે અને ઉપરોક્ત છેલા દાખલામાં કોષ્ટ પશુ ઠરાવાયેલી સુદતને માટે અથવા પ્રધાનની મુનસુફમાં આવે ત્યારે પાછી ખેંચી લેવાય ત્યાં સુધીને માટે આપી શકશે.

(૭) જે જમીન કે જગ્યાને માટે અથવા તેવી જમીન કે જગ્યાના કોષ્ટ પશુ ખાતને માટે પરવાનાની અરજી ના મંજૂર થઈ હોય તો એની એજ જમીન કે જગ્યાને માટે પરવાનાની અરજી એવી નામંજૂરીની તારીખ બાદ બે વર્ષની અંદર કરી શકે અને એવી પ્રત્યેક અરજીને માટે પ્રધાનને પાઉન્ડ ૨૫ ની ધી ભરવી પડશે; અપવાદ એ કે, એવી કોષ્ટ પશુ અરજી ને ધ્યાન-આપ્યા બાદ પ્રધાનની મુનસુફીમાં આવે તો, પાઉન્ડ-૨૮ તરફથી તેને માટે મંજૂર થયેલી રકમમાંથી અરજદારને તેજી ભરેલી હોય તેટલી રકમ અથવા તે પ્રધાનને યોગ્ય લાગે તેટલી રકમ પાછી મળે આપી શકશે.

(૮) કરારથી મેળવાયેલી કોષ્ટ પશુ સ્થાવર મિલકત માટે પરવાને અપાયા બાદ, છ મહિનાની અંદર, અથવા એ સુદત પુરી થયા પહેલા અચેલી અરજી પરથી પ્રધાને વધારી આપેલી સુદતની અંદર જે પરવાના મુજબ, એવી સ્થાવર મિલકતના કરાર થઈ ગયા નહિ હોય, અથવા, જે, જમીન કે જગ્યામાં વસવાટ માટે પરવાનો આપવામાં આવેલા હોય તો, પરવાનો અપાયા બાદ છ મહિનાની અંદર અથવા તેટલી સુદત પુરી થયા પહેલાં કરવામાં આવેલી અરજીપરથી પ્રધાને વધારી આપેલી સુદતની અંદર પરવાના મુજબ, એ જમીન કે જગ્યામાં વસવાટ ચાલુ થયા નહિ હોય, તો પરવાનો રદ થશે.

(૯) કોષ્ટ પશુ જમીન કે જગ્યા, જેના સંબંધમાં પેટાકલમ (૧) ના પારિત્રાહ (એ) ના પેટા પારિત્રાહ (૨) ની રૂએ પરવાનો અપાયો હોય તેમાં પરવાનાની શરત વેંદક વસવાટ થતો હશે અથવા તેની વિરુદ્ધ તેને, ઉપયોગ થતો હશે તો પ્રધાન પરવાના ધરાવનારને ઝાઝામાં ઝાઝી એક મહિનાની નોટીસ આપ્યા બાદ પરવાનો રદ કરશે.

ખાનગી કંપનીના શેરો અને ડીબેન્ચરો

૧૫. (૧) ન્યારે કોષ્ટ પશુ ખાનગી કંપની સ્થાવર મિલકત ધરાવતી હશે ત્યારે એ કંપનીના કોષ્ટ પશુ શેર કે ડીબેન્ચર એ કંપનીના સંબંધમાં નાલાયક હરેલા કોષ્ટ પશુ શખ્સ તરફથી અથવા નાલાયક હરેલી કોષ્ટ પશુ, કંપની તરફથી ધરાવાતા હશે અથવા તેના નાખર થયા હશે અથવા કોષ્ટ બીબેન્ચર-શખ્સ તે શખ્સને વતી કે તે કંપનીની વતી કે તે શખ્સ કે કંપની ના હિતમાં ધરાવતો હશે તો રાખ તરફથી તે જપ્ત કરી લેવામાં આપશે.

(૨) પેટાકલમ (૧) માં જણાવેલી, સ્થાવર મિલકત ધરાવતી કોષ્ટ પશુ કંપનીના સેક્રેટરી અને પ્રત્યેક ડિરેક્ટરની ઉપર એ કંપનીના સંબંધમાં શેર કે ડીબેન્ચર કોષ્ટ પશુ નાલાયક હરેલા શખ્સ કે નાલાયક હરેલી કંપની ના હાથમાં હોય અથવા તેની નાલાયક હરેલા શખ્સ કે નાલાયક હરેલી કંપની ની વતી કે તેના હિતમાં કોષ્ટ બીબેન્ચર શખ્સના હાથમાં હોય તો તેની કંપની એના રજીસ્ટ્રારને ખબર કરવાની ફરજ રહેશે.

(૩) ખાનગી કંપનીના નીચેના કોષ્ટ પશુ શેરો કે ડીબેન્ચરોના સંબંધ માં પેટા કલમ (૧) અને (૨) ના વિધાનો લાગુ નહિ પડે—

(એ) જે આ કાયદાની શરૂઆત પછી ટ્રાન્સ જ કોષ્ટ નાલાયક હરેલા શખ્સ અથવા નાલાયક હરેલી કંપની તરફથી ધરાવાતા હશે, અથવા કલમ (૩) ની પેટા કલમ (૧) ના પારિત્રાહ (બી) ની રૂએ થયેલી લાગતી વળગતી જાહેરાતમાં દર્શાવેલી તારીખ બાદ ટ્રાન્સ કોષ્ટ પશુ શખ્સ કે કંપની તરફથી ધરાવાતા હશે કે જે, તેવી જાહેરાતના પરિણામે તેવી ખાનગી કંપની તરફથી ધરાવાતી સ્થાવર મિલકતના સંબંધમાં, તેના માથુસ કે કંપની તરફથી શેરો અને ડીબેન્ચરો ધરાવાઈ રહ્યા હશે તે દરમિયાન નાલાયક હરેલા શખ્સ કે નાલાયક હરેલી કંપની બની જ્યાં અથવા;

(બી) જે કોષ્ટ નાલાયક હરેલા માથુસ તરફથી ધરાવા હશે, જે તેને કાયદેસર ધરાવતા નાલાયક હરેલા માથુસ પાસેથી વારસામાં મળેલા હશે; અથવા

(સી) જે એવા નાલાયક હરેલા માથુસ તરફથી નાલાયક હરેલી કંપની તરફથી ધરાવતા હશે, જે માથુસ કે કંપની એ કંપનીના કોષ્ટ પશુ બીબે

શેરો કે ડીબેન્ચરો કાયદેસર ધરાવતા હશે, જે એવા માથુસ અથવા એ કંપનીએ એવા ઉપરોક્ત પહેલાં જણાવેલા શેરો કે ડીબેન્ચરો એવા નાલાયક હરેલા માથુસ કે એવી નાલાયક હરેલી કંપની પાસેથી મેળવેલા હશે કે જે માથુસ કે કંપનીએ તે કાયદેસર ધરાવેલા હશે;

અપવાદ એ કે આ પેટા કલમમાં જણાવવામાં આવેલું કશું પશુ, આ કાયદાની શરૂઆતમાં જોરકાપે ધરાવાયેલા કોષ્ટ પશુ શેરો કે ડીબેન્ચરો ના સંબંધમાં પેટા કલમ (૧) અને (૨) લાગુ પાડવામાં આવે આવી શકશે નહિ.

(૪) જે કોષ્ટ પશુ કંપનીના શેર કે ડીબેન્ચર પેટા કલમ (૧) ની રૂએ પાછા લઈ લેવામાં આવ્યા હશે તો, કંપનીના સેક્રેટરી કંપની અંકેચ હેઠળના કોષ્ટ પશુ રજીસ્ટર, ચોપડા કે દસ્તાવેજોમાં તેની નોંધ કરશે અને તે પાછા લઈ લેવાને કંપનીના રજીસ્ટ્રાર તરફથી સુચવવામાં આવે એવું દસ્તાવેજ પુરું પાડશે.

(૫) આ કલમના હેતુઓ માટે કોષ્ટ પશુ માથુસને, જપ્ત એરિયા સ્થપાયો હોવાના કારણે એ લગામ આવેલી કોષ્ટ પશુ સ્થાવર મિલકતના સંબંધમાં નાલાયક હરેલા માથુસ ગણવામાં આવશે નહિ, સિવાય કે એ લગતો કલમ (૩) ની પેટા કલમ (૧) ના પારિત્રાહ (બી) ની રૂએ કરવામાં આવેલી જાહેરાતથી માલિકી મટિના જપ્ત એરિયા તરફ સ્થપાયો હશે.

બેન્ચર શેરો અને ડીબેન્ચરોવાળી કંપનીઓ

૧૬. (૧) કોષ્ટ પશુ કંપની, જેણે એવા શેરો કે શેર વેત-પેટા કે ડીબેન્ચરો આપેલા હશે કે જે તેના બેન્ચરને એ કંપનીના સંબંધમાં કંષ્ટ પશુ હક આપનારાં હશે, અને કોષ્ટ પશુ કંપની, જેમાં કન્ટ્રોલીંગ ઇન્ટરેસ્ટ એવી કોષ્ટ પશુ કંપની તરફથી અથવા તેની વતી અથવા તેના હાથમાં ધરાવાતો હશે, તેનાથી કન્ટ્રોલ એરિયામાં અથવા કોષ્ટ પશુ જપ્ત એરિયામાં પરવાના વગર સ્થાવર મિલકત મેળવી નહિ શકાય.

(૨) પેટા કલમ (૧) માં જણાવેલી કોષ્ટ પશુ કંપની કન્ટ્રોલ એરિયા માં કોષ્ટ પશુ સ્થાવર મિલકત ધરાવતી હશે-તો પ્રધાન, જે કંપનીમાં, ઝાઝામાં ઝાઝી તથા મહિનાની નોટીસ આપ્યા બાદ, ગેઝેટમાં નોટીસ ડાખીને એવી કંપની તરફ જાહેર કરી શકશે કે જેમાં કન્ટ્રોલીંગ ઇન્ટરેસ્ટ, કલમ દ્વારા હેતુઓ માટે, ઉક્ત નોટીસમાં જણાવેલા જપ્તના માથુસથી ધરાવાયેલો ગણ્યારો, અને ત્યાર બાદ એ કંપની ઉક્ત હેતુઓ માટે વધુમાં એવું જણાવવામાં આવશે કે એ કંપનીમાં કોષ્ટ પશુ બીબે જપ્તના કોષ્ટ પશુ માથુસ તરફથી અથવા તેની વતી કે તેના હાથમાં કન્ટ્રોલીંગ ઇન્ટરેસ્ટ ધરાવતો નથી.

કંપનીઓમાં કન્ટ્રોલીંગ ઇન્ટરેસ્ટ સંબંધી રૂકવેરો

૧૭. (૧) કોષ્ટ પશુ કંપનીમાં કન્ટ્રોલીંગ ઇન્ટરેસ્ટ કોષ્ટ પશુ જપ્ત ના કોષ્ટ પશુ માથુસ તરફથી અથવા તેની વતી કે તેના હાથમાં ધરાવાઈ રહ્યો છે એમ માનવને કારણે જે એમ જે પ્રધાનને લાગે તો તે લેખીત નોટીસથી એ કંપનીને, ઉક્ત નોટીસમાં જણાવેલી સુદતની અંદર, એ કંપની ના ધરાવાતા કન્ટ્રોલ સંબંધી નોટીસમાં સુચવવામાં આવેલી વીગતો રજૂ કરવા ફરમાવી શકશે.

(૨) હરોલેલી સુદતની અંદર અથવા પ્રધાન તરફથી વધુ લખાવી આપવામાં આવેલી હોય તો તેટલી લખાવી આપવામાં આવેલી સુદતની અંદર જે એ કંપની નોટીસનો એમક કરતાં સુકશે, અથવા નોટીસનો અચલ કરેતો હશે, અને પ્રધાનને સંજોગ થશે કે એ કંપનીમાં કન્ટ્રોલીંગ ઇન્ટરેસ્ટ તેની નોટીસની તારીખે કોષ્ટ પશુ જપ્તના કોષ્ટ પશુ માથુસ તરફથી અથવા તેની વતી અથવા તેના હાથમાં ધરાવાતો હશે, તો ગેઝેટમાં નોટીસ બહાર પાડી તે રૂકવેરો કરી શકશે કે આ કાયદાના હેતુઓ માટે એ કંપની એવી કંપની ગણ્યારો જેમાં કન્ટ્રોલીંગ ઇન્ટરેસ્ટ એ જપ્તના માથુસ તરફથી અથવા તેની વતી અથવા તેના હાથમાં ધરાવાય છે, અને ત્યાર બાદ એ કંપની એ હેતુઓ માટે એવી કંપની ગણ્યારો, અને એ હેતુઓ માટે વધુમાં એવું જણાવશે કે કોષ્ટ પશુ બીબે જપ્તના કોષ્ટ પશુ માથુસ તરફથી અથવા તેના હાથમાં એ કંપનીમાં કન્ટ્રોલીંગ ઇન્ટરેસ્ટ ધરાવી શકશે નહિ.

(૩) કંપનીને એવા ડેકલેરેશનની જાણ કરવામાં આવશે અને એ હકેશનમાં જાણવવામાં આવેલી તારીખ બાદ બે મહિનાની અંદર પેટા કલમ (૨) માં જાણવેલી નોટીસ ૨૬ કરવાના હુકમને માટે હકુમત ધરાવતી કોષ્ટ પથ પ્રાંતિક સુધીમ કોર્ટને તે અરજી કરી શકશે, અને જે કંપની એનું પુરવાર કરી આપે કે એ એવી કંપની નહોતી કે જેમાં પેટા કલમ (૧) ની રૂએ અપાયેલી નોટીસની તારીખે અથવા તે પેટા કલમ (૨) ની રૂએ અપાયેલી નોટીસની તારીખે કન્ટ્રોલિંગ ઇન્ટરેસ્ટ જેને વીધે સલાહ ઉઠેલો છે એ ગુપ્તતા માણસ તરફથી અથવા તેની વતી અથવા તેના લાભમાં ધરાવતો હતો તે કોર્ટ તેવી નોટીસ ૨૬ કરી શકશે.

(૪) પેટા કલમ (૨) ની રૂએ અપાયેલી નોટીસને અમલ, સ્થાવર ધોષનમાં સંબંધમાં, નોટીસમાં જાણવેલી તારીખે કંપની તરફથી ધરાવતા અથવા ખેલ યથેલા શેરો કે ડીવેન્ચરો સંબંધમાં, પેટા કલમ (૩) માં જાણવેલી મુદત પુરી થતાં સુધી મોકલે રાખવામાં આવશે, અથવા ઉક્ત પારિશ્રદ્ધી રૂએ અરજી થઈ હશે તે અરજીને ધ્યાન અપાયા સુધી મોકલે રાખવામાં આવશે.

(૫) ૧૯૨૬ ના કંપનીઝ એક્ટની કલમ બસો ઓગ્રણુનીસમાં આપવામાં આવેલી વ્યાખ્યા મુજબ કોષ્ટ પથ પરદેશી કંપનીના દાખલામાં પેટા કલમ (૧) અથવા (૩) ની રૂએ અપાયેલી નોટીસ અંતરિમ અપાયેલી ગણાશે—

(એ) જે તે એવા માણસપર જાણવાએલી હશે કે જે લાગતી વળગતી કંપનીના સંબંધમાં ઉક્ત કાયદાની કલમ (૨૦૧) ની પેટા કલમ (૧) ના પારિશ્રદ્ધ (સી) મુજબ સત્તા ધરાવતો હશે; અથવા

(બી) જે તેવો કોષ્ટ માણસ યુનીયનમાં ન હોય તે લાગતી વળગતી કંપનીને જાણ થાય તેવી, પ્રધાનને મત થાય, તેવી રીતે જાણવવામાં આવી હશે.

સ્થાવર મીલકત સંબંધી અમુક વિધાનો ૨૬ થશે

૧૮. કોષ્ટ પથ પ્રકારના દસ્તાવેજમાં એવી કોષ્ટ પથ શરત કે વિધાન હશે કે જેથી કોષ્ટ પથ નાલાયક હરેલા માણસ કે નાલાયક હરેલી કંપનીને સ્થાવર મીલકતનું ટ્રાન્સફર કરવામાં કોષ્ટ પથ પ્રકારની વગ ચલાવવા ની સત્તા મળતી હશે તે ૨૬ થએલી ગણાશે. અપવાદ એ કે જ્યાં એવી શરત કે વિધાન થએલો હોય તે વખતે લાગતો વળગતો માણસ કે કંપની ધારતી વળગતી મીલકતના સંબંધમાં નાલાયક હરેલો માણસ કે નાલાયક હરેલી કંપની હોય ત્યાં એવી મીલકતના સંબંધમાં તેવો માણસ કે તેવી કંપની નાલાયક ગણાતાં અટકે તે તેને ફરી સજીવન કરવામાં આવશે.

બીજા માણસ વતી મીલકત મેળવવા અને ધરાવવા વિષે

૧૯. જે માણસ આ કાયદાની રૂએ કાયદેસર સ્થાવર મીલકત મેળવે કે ધરાવી શકે તે ન હોય તેની વતી કોષ્ટ પથ માણસથી તેવી સ્થાવર મીલકત મેળવી કે ધરાવી શકાશે નહિ.

ગેરકાયદે ધરાવાયેલી મીલકતનો નિકાલ

૨૦. (૧) જે કોષ્ટ પથ સ્થાવર મીલકત—

(એ) આ કાયદાના કોષ્ટ પથ વિધાનની વિરૂદ્ધ મેળવાઈ અથવા ધરાવાઈ હશે અથવા આ કાયદાથી ૨૬ થતાં કોષ્ટ પથ કરારથી મેળવાઈ કે ધરાવાઈ હશે, અથવા જે પરવાનાની રૂએ તે મેળવાઈ કે ધરાવાઈ હોય તેની કોષ્ટ પથ શરતની વિરૂદ્ધ તેનો ઉપયોગ થતો હશે કે તેનો નિકાલ લાવવામાં આવશે; અથવા

(બી) આ કાયદાની શરૂઆતમાં, આ કાયદાથી ૨૬ કરવામાં આવેલા કોષ્ટ પથ કાયદાના કોષ્ટ પથ વિધાનની વિરૂદ્ધ અથવા એવા કોષ્ટ પથ વિધાનથી ૨૬ થએલા કોષ્ટ પથ કરારની રૂએ મેળવાઈ કે ધરાવાઈ હશે અથવા એવા કોષ્ટ પથ વિધાનની રૂએ આપવામાં આવેલા પરવાના કે સર્ટીફિકેટ કે જેના આધારે તે મેળવાઈ કે ધરાવાઈ હશે તેની વિરૂદ્ધ તેનો ઉપયોગ થયો હશે અથવા નીકાલ લાવવામાં આવ્યો હશે, તે—

પ્રધાન, લાગતાવળગતા માણસને એણમાં આઠા ત્રણ મહિનાની નોટીસ આપ્યા બાદ લાગતો વળગતો માણસ કસ્ટોડિયન થાય અને પ્રધાન સંમત થાય તે શરતે ખાનગીમાં અથવા તે પ્રધાન હરાવે તે શરતે જાહેર લીલામ માં તે મીલકત વેચાવી દઈ શકશે

(૨) તેવાં વેચાણનો ખર્ચ વેચાણથી થએલી ઉપજમાંથી પ્રથમ વસુલ કરવામાં આવશે અને જે કંઈ બાકી રહ્યું હશે તેમાંથી એ મીલકતને અંગે જે કંઈ કરજ થયું હશે તે ભરવાઈ કરવામાં આવશે અને ત્યાર બાદ શેષ રહેલી રકમ—

આ કાયદાની કલમ (૫) ની પેટા કલમ (૧) ના પારિશ્રદ્ધ (બી) અથવા (સી) માં અથવા ૧૯૪૬ ના એશીયાટીક લેન્ડ-ડેવલપમેન્ટ એક્ટની કલમ (૩) માં જાણવેલી મીલકત હોય તે લાગતી વળગતી કંપનીને આપવામાં આવશે; અને

(બી) એ સિવાયની હોય તે એ રકમ ફાન્સોલીડેટ્ડ ડેવલપમેન્ટમાં જશે, સિવાય કે પ્રધાને બીજી કશી સુચના કરેલી હોય.

અપવાદ એ કે જે એ મીલકત આ કાયદાની કલમ (૧૯) ની વિરૂદ્ધ મેળવાઈ કે ધરાવાઈ હોય તે તેની ઉપજ જે માણસની વતી અથવા જેના લાભમાં તે મેળવાઈ કે ધરાવાઈ હશે તેનું કોષ્ટ પથ જતનું કરજ ભરવા માટે સીધી યા આડકતરી રીતે વાંપરી શકાશે નહિ.

(૩) પેટા કલમ (૧) ની રૂએ અપાયેલી પ્રત્યેક નોટીસની નકલ લાગતી વળગતી ડીઝ રેજીસ્ટ્રી જેના હાથમાં હોય તે અમલદારપર મોકલવા માં આવશે અને એ અમલદાર તે મળતાં તેનાપર તે મળી તે દીવસ અને વખતની તારીખ અને કલાકની નોંધ લેશે અને લાગતા વળગતા રજીસ્ટ્રારે માં નોંધ લેશે કે જે નોટીસ લાગતી સ્થાવર મીલકતના સંબંધમાં આપવા માં આવી છે.

